

॥ શ્રી આદિનાથાય નમઃ ॥ ॥ શ્રી સંભવનાથાય નમઃ ॥ ॥ શ્રી મુનિસુવતસ્વામિને નમઃ ॥
॥ સિરસા વંદે મહાવીરં ॥ નમો લોએ સત્યસાહુણં ॥

સુશીલતા કોર્સ

[Level - 5 (For Boys Only)]



॥ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥
॥ आयओ गुरुबहुमाणो ॥

બ્રહ્મ *Easy*

પ્રિયમૃ

અહો શુતમ्

શા. બાબુલાલ સરેમતજી

સિદ્ધાચલ બંગલોઝ, હીરા જૈન સોસાયટી,

સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૪. મો. ૯૪૨૬૫૮૫૯૦૪

ahoshrut.bs@gmail.com

અર્જુન વાત

‘બ્રહ્મ’ના સૂત્રો, ‘બ્રહ્મ’ના સમીકરણો
 અને ‘બ્રહ્મ’ના સમ્યક્ ઉપાયોની આ પ્રસ્તુતિમાંથી
 આપ પસાર થાઓ
 તે પહેલા
 એક ખાસ વાત.

ખીની દ્વય-ભાવ અશુચિની વાત ન હોય
 એવા બ્રહ્મ-ઉપદેશનો કોઈ અર્થ જ નથી.
 આ વાત સહજ સમજ શકાય તેમ છે.
 છતાં પણ આ વાત ખીની નિંદા નથી જ.

‘સર્વત્ર નિન્દાસન્ત્યાગः’નો ઉચ્ચ આદર્શ આપનારા
 જ્ઞાની ભગવંતો પાપીની નિંદાનો પણ ધરાર નિષેધ કરતા હોય,
 ત્યાં જીતિની નિંદાનો તો સવાલ જ ક્યાં આવે છે ?
 નિંદનીય છે મોહ.

નિંદનીય છે વિજાતીય આકર્ષણુ,
 જે આ ઉપદેશ વિના દૂર થાય એવી કોઈ જ શક્યતા નથી.
 જ્ઞાની ભગવંતોના આ પવિત્ર આશયને સમજ્યા વિના
 એમના ઉપર નિંદાનો આક્ષેપ કરવો
 એ એમની ઘોર આશાતના છે.

જ્ઞાની ભગવંતોએ જ અનેક શાસ્ત્રોમાં કહ્યું છે
 કે ખીની અસારતાની અમે જેટલી વાત કહી છે
 તે બધી જ વાત ખીઓએ પુરુષોની બાબતમાં સમજ લેવાની છે.
 એટલું જ નહીં,
 ‘તત્તો અહિગતરા વા’
 પુરુષની શક્તિ વધુ હોવાથી
 તેના દોષ પણ વધુ બળવાન હોઈ શકે છે.’



ભરહેસર સજીજાયની ગાથાઓમાં

જે મહાસતીઓના નામોની હારમાળા છે તેઓ પણ ‘સ્વી’ જ હતાં.
તીર્થકરોની જે માતાઓ હોય છે તેઓ પણ ‘સ્વી’ જ હોય છે.

ગાણધર ભગવંતોથી માંડીને પ્રભુ વીરની પાવન પાટ પરંપરાને
શોભાવનાર મહાપુરુષોની માતાઓ પણ ‘સ્વી’ જ હોય છે.

જેમની જ્ઞાની ભગવંતોએ

ચાર નહીં પણ ચારસો મુખે સ્તુતિ કરી છે.

સંવેગરંગશાળા ગ્રંથ આ વિષયનો નિયોડ આ રીતે આપે છે -
તા ણિયસીલરકખાગાળાં પુરિસાણાં ણિદિયા મહિલા ।

ણિયસીલરકખંતીણાં નારીણાં ણિદિયા પુરિસા ॥

પોતાના શીલનું જેણો રક્ષાણ કરવું છે,
એ પુરુષો માટે ‘સ્વી’ એ નિંદિત છે
અને જેમણો પોતાના શીલની રક્ષા કરવી છે,
એ સ્વીઓ માટે ‘પુરુષ’ એ નિંદિત છે.

જ્ઞાની ભગવંતો

જેમ પ્રવચન આપતી વખતે

સ્વીઓ પર દસ્તિ ન પડે એ માટે

જેમ પુરુષોને સામે રાખીને ઉપદેશ આપે છે,
બરાબર એ જ રીતે

ગ્રંથ સર્જનમાં પણ પુરુષોને ઉદેશીને ઉપદેશ આપે છે.

તેથી ‘બ્રહ્મ’ના ઉપદેશના ગ્રંથોમાં

‘સ્વી’ની અસારતા વિશેષ જોવા મળે છે.

હુકીકતમાં આવા ઉપદેશમાં જ્યાં જ્યાં ‘સ્વી’ શબ્દ આવે,
ત્યાં ત્યાં તેનો તાત્પર્યાર્થ ‘વિજ્ઞતીય’ એ રીતે લેવાનો છે.

બસ, આટલી વાત ધ્યાનમાં લઈ આગળ વધો.

બ્રહ્મવિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.



ઈન્દ્રિયોમાં રસના
 કર્મોમાં મોહનીય
 અને વ્રતોમાં બ્રહ્મગર્ભ
 આ તૃપુણે ખૂબ જ દુર્જ્ય ગાળાય છે.
 એમને જીતવા અધરા છે.
 સહેલા કરતાં જેમાં વધુ મહેનત પડે
 એને આપણે અધરું કહેતા હોઈએ છીએ.
 અને જેમાં અધરા કરતા વધુ મહેનત પડે
 એને આપણે અશક્ય કહેતા હોઈએ છીએ.

All things are difficult
 before they become easy
 સરળ થઈ જાય એ પહેલાં
 બધી વસ્તુ અધરી હોય છે.
 ‘બ્રહ્મ’ ની બાબતમાં પણ
 કંઈક આવી જ વાત છે.
 એ સરળ થઈ શકે છે.
 એ સહજ પણ થઈ શકે છે.
 ને એ સ્વભાવ પણ બની શકે છે.
 પણ એની પહેલાં એ અધરું હોય છે.

કોઈ વસ્તુ અધરી છે
 એનો અર્થ એટલો જ છે.
 કે આપણે એને સરળ બનાવી નથી.



બ્રહ્મને સરળ બનાવવા માટે
 એક વાત ખાસ સમજવા જેવી છે.
 કે જે અધરું છે, ને નીચલી કક્ષાનું હોય છે.
 જે સર્વોત્કૃષ્ણ છે, તે સૌથી સરળ હોય છે.
 પહેલા દિવસે સાઈકલ ચલાવવી અધરી હોય છે.
 પહેલા દિવસે તરવું અધરું હોય છે.
 પહેલા દિવસે પ્રવચન આપવું અધરું હોય છે.
 પહેલા દિવસે ચિત્રકામ કરવું અધરું હોય છે.
 આ બધી જ અધરી વસ્તુને
 નજર સામે લાવીએ,
 એ બધી જ નીચલી કક્ષાની વસ્તુ હોય છે.
 એ બધી જ દ્યાસ્યાસ્પદ કે દ્યાસ્પદ વસ્તુ હોય છે.
 વધુ સ્પષ્ટ કહીએ તો એ વસ્તુ હોતી જ નથી.

I mean

એને સાયકલીંગ, સ્થિરભિંગ કે પેઇન્ટિંગ કહી જ ન શકાય.
 હવે એ વ્યક્તિની કલ્પના કરીએ
 જે આ બધામાં માસ્ટર છે.
 એ વ્યક્તિ એને સર્વોત્કૃષ્ણ રીતે કરશે.
 એ વ્યક્તિ માટે તે તે વસ્તુ સાવ સરળ પણ હશે.
 તો નિષ્કર્ષ આ છે -
 જ્યાં પછાતપણું છે, ત્યાં અધરાપણું છે.
 જ્યાં ઉત્કૃષ્ટપણું છે, ત્યાં સરળપણું છે.

પછાત બ્રહ્મ અધરું છે.

ઉત્કૃષ્ટ બ્રહ્મનો અર્થ છે.



સર્વકાળીન મન-વચન-કાયાની નિર્વિકારતા.

કોઈ પણ સમયે મન-વચન-કાયાને

વિકારનો અંશ પણ ન સ્પર્શો

એ ઉતૃષ્ટ બ્રહ્મ છે.

ટ્રાફિક, સિથલ, ફાટક, સ્પીડ બ્રેકર, ટન્સ્

કશું જ ન હોય

સીધો-સપાટ-સ્થૂમસામ રસ્તો હોય

એમાં ર્રાઇલિંગ કરવું તે સરળ અને સુખદ હોય છે.

એવું જ ઉતૃષ્ટ બ્રહ્મની બાબતમાં છે.

શ્રીભગવતીસૂત્રનું એક પદ છે - ગુત્તબંભયારી

નવ ગુમિથી સુરક્ષિત ‘બ્રહ્મ’ના પાલક.

આ વાત ઉતૃષ્ટ ‘બ્રહ્મ’ની છે.

વિજાતીયને જોવા-મળવા-વાત કરવાની

પ્રવૃત્તિ ચાલુ હોય

એ સ્થિતિમાં બ્રહ્મચર્ય અધરું હોય.

એમાં શું આશ્ર્ય છે ?

વિજાતીયના દર્શનની સંભાવના હોય,

ત્યાં સાધકનું મન ચકળ-વકળ થાય

એમાં શું આશ્ર્ય છે ?

વિજાતીયના ચિત્રો/ફોટોઓ સમીપમાં હોય

અને સાધકનો વૈરાગ્ય ઓસરવા લાગે

એમાં ન બનવા જેવું શું છે ?

ઠોકી ઠોકીને ખાધા પછી



શરીર એની પ્રતિક્રિયા બતાવે
 એમાં શું આશ્વર્ય છે ?
 સ્થૂલ દાખિ એમ કહેશે
 કે નવ વાડનો ભંગ કરે તો ‘બ્રહ્મ’ જોખમમાં આવે.
 સૂક્ષ્મ દાખિ કહેશે
 કે નવ વાડનો ભંગ એ ‘બ્રહ્મ’નો ભંગ છે.
 સૂક્ષ્મતર દાખિ કહેશે
 કે નવ વાડનો ભંગ એ ‘વિરતિ’નો જ ભંગ છે.
 સૂક્ષ્મતમ દાખિ કહેશે
 કે નવ વાડનો ભંગ એ ‘સમ્યક્તવ’ નો પણ ભંગ છે.

યાદ આવે શ્રીમહાનિશીથ સૂત્ર-
 ગુત્તી ય વિરાહિંતો મિચ્છદિદ્વી મુણી ભણિઓ ।
 ગુમિની વિરાધના કરતા મુનિને
 જ્ઞાનીઓએ મિથ્યાદાખિ કહ્યા છે.

એક આશ્વર્ય ભગવંત
 ઉપરના માળે બિરાજમાન હતા.
 શિષ્યો કોઈ કારણસર બહુર ગયા હતા.
 કોઈ ખી ઉપર ચડી રહી છે.
 એવો અવાજ પૂજ્યશ્રીને આવ્યો.
 “કોણ બહેન ઉપર આવે છે ?”
 એવી રહ પાડી.
 બહેન પાછા જતા રહ્યા
 એ પૂજ્યશ્રી બ્રહ્મસપ્રાટ હતા.
 કારણ કે એ ગુમિસમાટ હતા.



ગુમિ વિનાનું બ્રહ્મ બોધું હોય છે, પોલું હોય છે.
તકલાદી હોય છે, માંદું હોય છે, અધ્યાતું હોય છે.
ને તાત્ત્વિક દૃષ્ટિએ એ હોતું જ નથી.

ગુમિની ઉપેક્ષા એ બ્રહ્મની ઉપેક્ષા છે.

પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કહે છે -
એગો એગિત્થીએ સંદ્રિણેવ ચિદ્ગ્રે ણ સંલવે ।
એકલાએ એકલી સ્ત્રી સાથે ઉભા સુદ્ધા ન રહેવું
અને વાત સુદ્ધા ન કરવી.
પરમ પાવન શ્રી કદ્વપસૂત્ર કહે છે
પોતાની સાથે કોઈ સાધુ હોય
ને તે સ્ત્રી સાથે પણ કોઈ સ્ત્રી હોય,
તો ય તેમની સાથે ઉભા ન રહેવાય.
વરસાદ વગેરે કારણ હોય
તો પણ નહીં.
જો કોઈ પાંચમું હોય, તો ઉભા રહી શકાય.

પરમ પાવન શ્રી છેદ-આગમો કહે છે.

ચउ-છકળા ।

આચાર્ય ભગવંત પાસે સાધુ આલોચના કરે,
તો બે જણા સાંભળો-પૂજયશ્રી અને આલોચક મહાત્મા.
જો સાધ્વી આલોચના કરે
તો તે બે ઉપરાંત એક વૃદ્ધ સાધ્વી હાજર રહે
અને તે પણ સાંભળે,
જો આચાર્ય ભગવંત યુવાન હોય,
એટલે કે પચાસ વર્ષથી ઓછી ઉંમરના હોય,



તો એ તાણ ઉપરાંત એક પીઠ સાધુ પણ હાજર રહે
અને તે પણ સાંભળે.

ગુમિ.

સુરક્ષા.

જડબેસલાક વ્યવસ્થા.

પરમાત્માએ સર્વજ્ઞતાના પ્રકાશમાં સ્પષ્ટ જોયું છે.
કે એના વિના ‘બ્રહ્મ’ પિંખાઈ જશે, ચૂંથાઈ જશે
ને તરફડી તરફડીને ખલાસ થઈ જશે.

બે વ્યક્તિને ‘સ્વી’થી કોઈ જ ભય ન હોય-
કેવળજ્ઞાનીને અને મિથ્યાદાદિને.
એ બેના વ્યવહારમાં પણ એટલો ફરક પે
કે કેવળજ્ઞાની પણ બ્રહ્મગુમિનું અણિશુદ્ધ પાલન કરે,
જેનાથી માર્ગની રક્ષા થાય
અને બીજા જીવો પણ ખોટું આલંબન ન લે.
મિથ્યાદાદિને બ્રહ્મ કે ગુમિ
કોઈ સાથે કોઈ લેવા-દેવા હોતી જ નથી.

ભય એ બ્રહ્મનું સુરક્ષાકવચ છે.

નવે વાડનો સાર ભય છે.

બ્રહ્મના દરેક વિધનથી ભય, ફફડાટ અને ગભરાટ અનુભવે
અનું નામ બ્રહ્મચારી.

યાદ આવે પરમ પાવન શ્રી દશવૈકલિક સૂત્ર-

જહા કુકુડપોઅસ્સ, ણિચ્ચં કુલલાઓ ભયં ।

એવં ખુ બંભયારિસ્સ, ઇત્થીવિગાહાઓ ભયં ॥

કૂકડાના બચ્ચાને

જેમ બિલાડીથી સતત ભય છે.



તેમ બ્રહ્મચારીને સતત શ્રી-શરીરથી ભય છે.

‘શ્રી-શરીર’ આવું કેમ કહ્યું ?

એનો જવાબ પૂ. હરિભદ્રસૂરિ મહારાજા ટીકામાં આપે છે.

મૃતશરીરાદપિ-

બ્રહ્મચારીને શ્રીના મડદંથી પણ ભય છે.

પરમ પાવન શ્રીનિશીથ સૂત્ર ભાષ્ય કહે છે -

જે જગ્યાએ દેવ-શ્રી, મનુષ્ય-શ્રી કે તર્યારી-શ્રીની

પ્રતિમા હોય

ત્યાં પણ સાધુને રહેવું કલ્પે નહીં.

ત્યાં રહેવાથી પણ પ્રાયશ્ચિત આવે.

સાધ્વી-પક્ષે આ જ વાત પુરુષ-પ્રતિમાની બાબતમાં
કહેલી છે.

ભય.

શ્રીના પડધાયાથી ય ડરવું.

એની પ્રતિમાથી ય ડરવું.

ને એના ફોટોથી ય ડરવું.

પરમ પાવન શ્રી દશવૈકાલિક સૂત્ર કહે છે-

ચિત્તભિત્તિ ણ ણિજ્ઞાએ, ણારી વા સુઅલંકિયં ।

ભક્તબરં પિવ દઢ્ઢણ, દિંદિં પડિસમાહરે ॥

દિવાલ પર શ્રીનું ચિત્ર હોય તે ય ન જોવું,

શાણગાર કરેલી નારી હોય તેને ય ન જોવી,

કદાય ભૂલથી જોવાઈ જાય

તો ય તરત જ એવી રીતે નજરને પાછી ખેંચી લેવી,



જે રીતે બપોરના સૂરજને જોઈને ખેંચી લેવાય.

રાગોત્પાદનના સંદર્ભમાં

સ્વી, સ્વી-પ્રતિમા, સ્વી-ચિત્ર, સ્વી-શબ્દ કે સ્વી-મહું

આ બધાં જ સમાનાર્�ી શબ્દો છે.

ઝેર એનું એ છે.

ફક્ત એનું પેકિંગ બદલાયું છે.

કુલટા, કુલવધુ, કાકાની દીકરી, સગી બહેન કે માતા

બ્રહ્મચારી માટે બધું જ ‘ભય’ છે.

માટે જ જ્ઞાનીઓ કહે છે -

માત્રા સ્વસ્થા દુહિત્રા વા, ન વિવિક્તાડસનો ભવેત् ।

બલવાનિન્દ્રિયગ્રામો, વિદ્વાનોઽપ્યત્ર મુહૃત્તિ ॥

માતા હોય, બહેન હોય કે દીકરી હોય,

અમની સાથે પણ એકાંતમાં તો ન જ બેસવું.

બળવાન છે ઈન્દ્રિયોનો સમૂહ.

વિદ્વાન પણ અહીં મુંજાઈ જાય છે.

નીતિવાક્યામૃતમ् કહે છે

જનન્યાડપિ પરસ્થિત્યા સહ રહો ન તિષ્ઠેત् ।

પરસ્થી સાથે એકાંતમાં ન જ રહેવું

પછી ભલે ને એ સગી મા પણ કેમ ન હોય.

બાઈબલ કહે છે

‘જ્યારે એક પુરુષ પરસ્થી સાથે એકાંતમાં બેસે છે,

ત્યારે એ બંનેની વર્ચ્યે શેતાન આવીને બેસી જાય છે.



બ્રહ્મચારી માટે
સ્ત્રી અને પરસ્ત્રી
આ બંને સમાનાર્થી શબ્દો છે.

‘સ્ત્રીત્વ એ એટલું ભજબૂત વિધન છે
કે પવિત્ર પારિવારિક સંબંધ, શારીરિક ખોડ કે
અતિ વૃદ્ધ અવસ્થા પણ
એના વિધનત્વને સમાસ કરી શકતી નથી,
કારણ કે એ દરેકમાં પણ ‘સ્ત્રીત્વ’ તો
અકબંધ જ રહે છે.

માટે જ પરમ પાવન શ્રી દશાવેકાલિકસૂત્ર કહે છે.

હત્થપાયપડિચ્છિન્ન, કન્નનાસવિગણિયં ।

અવિ વાસસયં ણારીં, બંભયારી વિવજએ ॥

સ્ત્રી એ સ્ત્રી છે.

પછી ભલે એ એના હાથ-પગ કાપી નંખાયા હોય,
ભલે ને એના કાન અને નાક પણ કાપી નંખાયા હોય,
ભલે ને એ સો વર્ષની તોશી પણ કેમ ન હોય ?
બ્રહ્મચારીએ એનાર્થી પણ બધી રીતે દૂર રહેવું,

‘બધી રીતે’ એટલે

એનું દર્શન, એના શબ્દો, એના ચિત્રો,
એનો પરિચય, એની સાથેનો વ્યવહાર -
બધી રીતે.

યાદ આવે પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-
ઇત્થીં વિપ્પજહે અણગારે ।

સ્ત્રીનો સર્વ રીતે સર્વ ગ્રયતનથી સર્વ અવસ્થામાં



ત્યાગ કરે તે સાધુ.

પરમાત્માએ કેવળજ્ઞાનના પ્રકાશમાં જોયું છે.

કે દરેક છભસ્થ જીવની ભીતરમાં

મોહનીયનું પેટ્રોલ તો ભરેલું પડ્યું જ છે.

એમાં જો બાધ નિમિત્તોની ચિનગારી પડી જાય,

તો ભડકો થવાનો જ છે.

આ પેટ્રોલને ખાલી કરી દેવું ખૂબ જ જરૂરી છે.

તો એને ખાલી કરી દેવાની પ્રક્રિયા દરમિયાન

નિમિત્તની ચિનગારીથી સો ફૂટ દૂર જ રહેવાય

એ પાણ ખૂબ જરૂરી છે.

કહેવાતા કારણા, આવશ્યકતા, ફરજ,
ઔચિત્ય, દાક્ષિણ્ય, શેહ-શરમ, ન-ધૂટકો
આ બધું ભેગું થઈને પણ
ચિનગારીને ચિનગારીઝપે મટાવી શકતું નથી.
ચિનગારીથી સતત દૂર ભાગતાં રહેવું
એ જ પરમ કર્તવ્ય છે.

માટે જ પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર કહે છે -

અદંસણં ચેવ અપત્થણં ચ

અચિત્તણં ચેવ અકિત્તણં ચ ।

ઇત્�ીજણસ્મારિયજ્ઞાણજુગં

હિયં સયા બંભવએ રયાણં ॥

સ્વીનું દર્શન હરગીઝ ન હોય,

સ્વીની ઈચ્છા પાણ ન જ હોય,

સ્વીનો વિચાર સુદ્રા ન હોય,



હોય ફક્ત ધર્મધ્યાન અને શુક્લધ્યાન
બસ,
આ જ બ્રહ્મચારીના હિતમાં છે.

નિમિત્તસેવનનો અર્થ છે બ્રહ્મહૃત્યા,
'સ્ત્રી' નો અર્થ છે બ્રહ્મપાત.
ઉળાણ જેર ખાઈને જો જીવી શકાય
તો 'સ્ત્રી' ના સંપર્કમાં રહીને બ્રહ્મ પાળી શકાય.

જ્ઞાનીઓ કહે છે,
નામાપિ સ્ત્રીતિ સંહલાદિ, વિકરોત્યેવ માનસમ् ।
કિમ્પુનર્દર્શનં તાસાં, વિલાસોળ્લાસિતભ્રુવः ॥
સ્ત્રી-આ નામ પણ મનને બહેલાવે છે.
મનમાં વિકાર લાવે જ છે.
તો પછી સ્ત્રીના દર્શનની તો શું વાત કરવી ?
એ સ્ત્રી પાછી વિલાસથી આંખોના ભવાં ઉછાળતી હોય
પછી તો શું બાકી રહે ?

કાવ્યશિક્ષાશાસ્ત્રોમાં કવિઓને ઉદેશીને
એક વાત કહી છે
કે કેટલાક શબ્દો ત્રાણ લિંગમાં હોય છે
દા.ત. તટઃ, તટી, તટમ् (કિનારો)
પટલઃ, પટલી, પટલમ् (સમૂહ)
તો આવા શબ્દોનો પ્રયોગ કરવાનો હોય,
ત્યારે તેના સ્ત્રી-લિંગનો પ્રયોગ કરવો,
તેનાથી તમારું કાવ્ય વધુ લોકપ્રિય થશે.”



કિનારાનું કે સમૂહનું
 કશું જ કરવાનું નથી
 છતાં ય ભીતરમાં ઉડે ઉડે ઘર કરી ગયેલો
 સ્ત્રી પ્રત્યેનો રાગભાવ
 કેટકેટલી અર્થશૂન્ય અભિવ્યક્તિ કરે છે,
 એનું આ અવ્યલ દાણંત છે.

સ્ત્રી-ની લાતથી અશોક-વૃક્ષ પદ્ધતિ થાય
 ને એના આલિંગનથી બફુલ વગેરે વૃક્ષોનો
 વિશિષ્ટ વિકાસ થાય
 આ બધી મોહરાજાએ કરેલી મશકરી
 નહીં તો બીજું શું છે ?

યાદ આવે ભર્તૃહરિ -

કૃશ: કાણ: ખજ્જ: શ્રવણરહિત:, પુચ્છવિકલ:
 ક્ષુધાક્ષામો જીર્ણ:, પિઠરકકપાલા-ર્પિતગલ: ।
 બ્રણૈ: પૂયક્રિલન્નૈ:, કૃમિકુલચિતૈ-રાવૃતતનુ:,
 શુનીમન્વેતિ શ્વા, હતમપિ ચ હન્ત્યેવ મદન: ॥
 બિચારો કૂતરો.

એ દૂબળો છે, કાણો છે, લંગડો છે.
 એના કાન પાણ કપાઈ ગયા છે.
 ને પૂંછડી પાણ કપાઈ ગઈ છે.
 એ ભૂખ્યો ડાંસ છે ને ઘરડો થયો છે.
 એની આટલી દુર્દશા ઓછી હોય
 એમ એના ગળે માટલાનું મોટું ઢીકરું બાંધેલું છે.
 એના શરીરમાં ઠેર ઠેર ઘા છે,



એમાંથી રસી ય જરી રહી છે.
ને એમાં કીડા ય ખદબદ્ધ રહ્યા છે.
પણ એ કૂતરો ય કૂતરીની પાછળ જઈ રહ્યો છે.

રે કામ,
તું તો મરેલાને પણ મારે છે.

ભલે ભર્તૃહરિએ એ કૂતરીનું વાર્ણન નથી કર્યું.
પણ કૂતરી એ કૂતરી જ હોય છે.
કદાચ એટલે જ અનું વાર્ણન નથી કર્યું.
તો ભોગનો અર્થ આ છે -
વિંબના, મશરી, યાતના-ત્રાસ.
એક કૂતરાને કૂતરીમાં જે દેખાય છે
એ જ વસ્તુ
એક ગઘેડાને ગઘેડીમાં દેખાય છે.
એક ભૂંને ભૂંધણમાં દેખાય છે.
એક મનુષ્યને સ્ત્રીમાં દેખાય છે.
આનું સમાંતર સત્ય એ છે.
કે એ બધાં જ આંધળા હોય છે.

દિવા પશ્યતિ નો ઘૂકઃ, કાકો નક્કા ન પશ્યતિ ।
અપૂર્વઃ કોડપિ કામાન્ધો, દિવા નક્કા ન પશ્યતિ ॥

ધુવડને દિવસે નથી દેખાતું
ને કાગડાને રાતે નથી દેખાતું.
પણ કામાન્ધ તો કંઈક જુદી જ માયા છે.
એને દિવસે કે રાતે - કદી દેખાતું જ નથી.



વિવેકની આંખે આવરણ

એનું જ નામ તો કામ છે.

એક જ જુગુપ્સનીય, લજજનીય, પરિશ્રમપ્રદ અકૃત્ય

ને એમાંથી આખા સંસારની પળોજાણો ઉભી થાય છે.

તૃષ્ણાઓ, કથાઓ, રાગ-દ્રેષ્ઠો, ઈધર્યાઓ, સંકલોશો,

જરૂરિયાતો, ચિંતાઓ, ભાગ-દોડો, ઝગડાઓ...

યાદ આવે પરમ પાવન શ્રી દશવૈકાલિક સૂત્ર-

મૂલમેયમહમ્મસ્સ, મહાદોસસમુસ્સયં ।

તમ્હા મેહુણસંસગં, ણિગંથા વજયંતિ ણં ॥

અધર્મનું મૂળ છે મૈથુન.

મોટ-મોટા દોપોનો રાફડો છે મૈથુન.

માટે શ્રમણો એના ઓછાયાનો પણ ત્યાગ કરે છે.

કીડીને ભારવી એ જો હિંસા છે.

તો મૈથુન એ તો મહાહિંસા છે.

ઘૃટકાયના કતલખાનાઓથી ભરેલું ધર

એનું સર્જન મૈથુનથી થાય છે.

આંખ ફાટી જાય એટલી હિંસાઓથી ભરેલા

ધન-ઉપાર્જનની વિવિધ પ્રવૃત્તિઓ

એમનું મૂળ મૈથુન હોય છે.

કસાઈ ને માધીમાર સુદ્ધાના ભવો સહિતનું ભવભ્રમાણ

એનું કારણ છે મૈથુન.

એક કસાઈ એક બકરાને કાપે છે

ને એક વ્યક્તિ વિકારજનક નિમિત્તનું સેવન કરે છે.

એ બંને પ્રવૃત્તિ ભવહેતુ-સ્વરૂપે¹ તો સમાન જ છે.

1. સંસારના કારણ તરીકે



પહેલી પ્રવૃત્તિમાં આપણને હિંસા દેખાય છે.

બીજી પ્રવૃત્તિ સહજ લાગે છે.

સ્વીકાર્ય લાગે છે.

એમાં કંઈક પાપ છે એવું માનવા માટે

આપણું મન તૈયાર થતું નથી.

પણ હક્કિકતમાં તો એ બંને પ્રવૃત્તિમાં

હિંસા છે ને છે જ.

યાદ આવે પુરુષાર્થસિદ્ધ્યપાય -

આત્મપરિણામહિસનહેતુત્વાત् સર્વમપિ હિંસૈતત् ।

સત્યાદિગ્રાતમભિહિતં કેવલં શિષ્યબોધાય ॥

અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ-આ બધું પણ

આત્મપરિણામની હિંસાનું કારણ હોવાથી^૧

હિંસા જ છે.

તો ય સત્ય વગેરે વ્રતો

શિષ્યના બોધ માટે કદ્યા છે.

પહેલા ભીતરી હિંસા થાય છે

અને પછી બાધ હિંસા થાય છે.

યાદ આવે સવાસો ગાથાનું સ્તવન -

જે રાખે પરપ્રાણને, દયા તાસ વ્યવહારે ।

નિજ દયા વિષા કહો પર દયા, હોય કવણ પ્રકારે ? ॥

બીજાનો જીવ બચાવવો એ વ્યવહાર દયા છે.

આત્મપરિણામને કલુષિત ન થવા દેવા એ નિશ્ચય દયા છે.

નિજદયા વિના થતી પરદયા

એ તાત્ત્વિક હોતી નથી.

૧. મન બગાડનાર હોવાથી.



બ્રહ્મ એ આત્મદયા છે

માટે જ બ્રહ્મ એ વિશ્વદયા છે.

જ્યાં આત્મદયા છે ત્યાં વિશ્વદયા અવશ્ય હોય છે.

અબ્રહ્મ એ આત્મહિંસા છે

માટે જ એ વિશ્વહિંસા પણ છે.

જ્યાં સ્વ-ની દ્યા નથી

ત્યાં પર-ની દ્યા પણ નથી જ

તાત્ત્વિક દાખિએ જે દ્યાળું છે

તે અબ્રહ્મથી ઉરશે.

તે અબ્રહ્મના દરેક-મન-વચન-કાયાના

પ્રકારથી પણ ઉરશે

ને તે અબ્રહ્મના દરેક નિમિત્તથી પણ ઉરશે.

જ્યારે અબ્રહ્મના દરેક નિમિત્તમાં બિલાડો દેખાય

અને પોતાની જાતમાં ઉદર દેખાય

ત્યારે બ્રહ્મયાત્રા શરૂ થાય છે.

યાદ આવે પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર -

જહા બિરાલાવસહસ્પ મૂલે,

ણ મૂસગાણ વસહી પસત્થા ।

એવ ઇત્થીળિલયસ્પ મજ્જો,

ણ બંભયારિસ્પ ખમો ણિવાસો ॥

જોરાવર બિલાડાની અડોઅડ

ઉંદરો નિવાસ કરે

એમાં જેમ ભારોભાર જોખમ રહેલું છે.



બરાબર એ જ રીતે
સ્વીવાળા મકાનની અંદર બ્રહ્મયારી રહે
એમાં પાણ પૂરેપૂરો ખતરો છે.

જે એમ કહે છે કે -

“આ રીતે સ્વીથી નાસતા-ભાગતા-ગભરાતા રહીને
જે બ્રહ્મચર્ય પળાય તે સાચું ન કહેવાય,
સ્વીઓ વચ્ચે રહીને તમે શુદ્ધ રહો,
ત્યારે તમે સાચા બ્રહ્મયારી.”

એ વ્યક્તિ કુતર્ક કરે છે.

રોડની સાઈડમાં વૃક્ષારોપણ કરીને
સરકાર લોખંડની જાળી મુકે,
ત્યારે કોઈ એમ કહે
કે “આ રીતે જાળી મૂકીને-કોઈન-કવચ કરીને
તમે વૃક્ષ ઉગાડો.

એ સાચું ન કહેવાય.

એમ ને એમ - ગાય, બકરી, કૂતરા વગેરે વચ્ચે
વૃક્ષ ઉગાડી આપો તો તમે ખરા.”

તો આ વાતનો જવાબ શું હોઈ શકે ?

- (૧) આ રીતે વૃક્ષ ઉગાડવું શક્ય જ નથી.
- (૨) આ રીતે ઉગાડવું એટલે ન ઉગાડવું.
- (૩) આવું કહેવું એટલે વૃક્ષારોપણને અટકાવવું.
- (૪) સવાલ કવચ વચ્ચે ઉગાડવાનો

કે ગાયો વચ્ચે ઉગાડવાનો નથી,

સવાલ ઉગાડવાનો છે

અને એ આ રીતે કવચ સાથે જ ઉગી શકે છે.



બસ,

આ જ ઉત્તરો ‘બ્રહ્મ’ ના સંદર્ભમાં પણ લાગુ પડે છે,

(૧) આ રીતે = ગુમિની વિરાધના કરીને

બ્રહ્મ પાળવું એ શક્ય જ નથી.

(૨) આ રીતે બ્રહ્મ પાળવું એટલે ન પાળવું.

(૩) આવું કહેવું એટલે બ્રહ્મપાલન અટકાવવું.

(૪) સવાલ ગુમિઓને અપનાવીને બ્રહ્મ પાળવાનો

કે ગુમિઓને ફગાવીને બ્રહ્મ પાળવાનો નથી,

સવાલ બ્રહ્મ પાળવાનો છે

અને એ આ રીતે - ગુમિઓને અપનાવીને જ

પાળી શકાય તેમ છે.

આટલી વાતમાં ઘણા બધાં સમાધાનો સમાયેલા છે.

બ્રહ્મ કેમ અધ્યરું લાગે છે ?

એમાં કેમ સ્ખલના થાય છે ?

એની વિશુદ્ધિ કેમ પ્રાપ્ત થતી નથી ?

કંઈ નહીં તો છેવટે મન કેમ ભટક્યા કરે છે ?

કારણ આ જ છે - ગુમિવિરાધના.

જો ગુમિઓનું અણિશુદ્ધ પાલન કરાય.

અને આત્માને પ્રતિપક્ષ - ભાવનાથી ભાવિત કરાય

તો બ્રહ્મ સાવ જ સરળ છે.

ને જો આ બે વસ્તુ શક્ય ન બને

તો એના જેવું અધ્યરું બીજું કશું જ નથી.

પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા યોગશતકમાં કહે છે

થીરાગમ્મિ તત્ત્વ તાસિં ચિંતિજ સમ્મબુદ્ધીએ ।

કલમલગમંસસોળિયપુરીસકંકાલપાયં તિ ॥



રોગ જરા પરિણામં મરણાઇવિવાગસંગયં અહવા ।

ચલરાગપરિણિં જીવણાસણવિવાગદોસં ચ ॥

જેને ખ્રી પર રાગ છે,

તેણે સમ્યક્ બુદ્ધિપૂર્વક ખ્રીની વાસ્તવિકતાનો

વિચાર કરવો જોઈએ,

કે એનું શરીર કેટકેટલી ગંદકીથી ભરેલું છે.

એમાં માંસ છે, લોહી છે, વિષ છે,

ફેફસા છે, પિત અને કફ છે,

મૂત્ર અને આંતરડાં છે, આખે આખું હાડપિંજર છે,

એ શરીર પાછું રોગિષ થાય છે.

ઘડપણથી જર્જરિત થાય છે.

ને ભરી પણ જાય છે.

ખ્રીનું મન પણ ચંચળ હોય છે.

પળમાં રાગ થઈ જાય ને પળમાં ઓસરી ય જાય,

એ વીફરે તો ઠે કલેજે આપણી હત્યા ય કરી દે

અથવા તો

આપધાત કરીને આપણને મુજ્જેલીમાં મુકી દે,

એનામાં રાગ કરવા જેવું છે જ શું ?

એક આગમ છે તંદૂલવૈચારિક સૂત્ર.

એમાં ખ્રીને ૯૩ ઉપમાઓ આપી છે.

એક એક ઉપમા ખ્રીનો રાગ ઉતારી દેવા સમર્થ છે.

સવાલ ફક્ત ખ્રીનો નથી, મોહનો છે.

ખોટી જગ્યાનો રાગ ઘણા ખોટાં કામ કરાવે છે.

ભયાનક કર્મો બંધાવે છે.



ને આખા ભવિષ્યને ભયાનક બનાવી હે છે.

આ રહી તે ઉપમાઓ -

- (૧) સ્વભાવથી જ વાંકી
- (૨) મનગમતા વચ્ચનોની વેલકી
- (૩) કપટ-પ્રેમના પર્વત પરથી વહેતી તોફાની નદી
- (૪) દુજારો ગુનાઓનું ઘર
- (૫) શોકનું ઉદ્ગમ બિન્દુ
- (૬) પુરુષના બળનો વિનાશ
- (૭) પુરુષનું કંતલખાનું
- (૮) લજાનો નાશ
- (૯) દંભનું ઘર
- (૧૦) વેરની ખાણા
- (૧૧) શોકનું શરીર
- (૧૨) કુલમર્યાદાનો સત્યાનાશ
- (૧૩) રાગ-દ્રેખનું આશ્રયસ્થાન
- (૧૪) દુશ્રિતોનો નિવાસ
- (૧૫) અવિનયનો સમૂહ
- (૧૬) માયાનો ઢગલો
- (૧૭) જ્ઞાનની સ્ખલના
- (૧૮) શીલની વિદાય
- (૧૯) શ્રુત-ચારિત્ર ધર્મમાં વિદ્ધ.
- (૨૦) મોક્ષપથ સાધકોનો નિર્દ્ય શત્રુ
- (૨૧) આચારસંપત્તોનું કંદંક.
- (૨૨) કર્મરજની વાટિકા
- (૨૩) ગરીબીનું ભવન
- (૨૪) ગુસ્સે થાય એટલે ભોરિંગ નાગ જેવી
- (૨૫) કામવિળણ થાય એટલે હાથી જેવી
- (૨૬) મોક્ષમાર્ગની અર્ગલા.



- (૨૭) વાધણ જેવી દુષ્ટ હદયી.
- (૨૮) કૂવા પર ઘાસ ટાંક્યું હોય તેવા - ગૂઢ હદયવાળી
- (૨૯) માયાવી શિકારીની જેમ ફોસ્લાવીને સેંકડો બંધન નાંખનારી
- (૩૦) અનેક પુરુષોને ચાહુનારી,
- (૩૧) પુરુષોને અંદરથી બાળનારી
- (૩૨) જાણો વળગાડ થયો હોય તેમ અનવરસ્થિત મનવાળી.
- (૩૩) ખરાબ ઘા-ની જેમ અંદર સહેલા હદયવાળી
- (૩૪) કાળા સાપની જેમ અવિશ્વસનીય
- (૩૫) ઘણા જીવોના ક્ષયની જેમ ગૂઢ કપટવાળી.
- (૩૬) સન્ધ્યાના વાદળની જેમ ઘડીમાં પ્રેમનો રંગ બદલી દેનારી
- (૩૭) દરિયાના મોજાની જેમ ચંચળ સ્વભાવવાળી
- (૩૮) માછલાની જેમ પાછી વાળવી મુશ્કેલ. (એનામાં પરિવર્તન ન આવી શકે.)
- (૩૯) વાંદરાના જેવી ચંચળ ચિત્તવાળી.
- (૪૦) મૃત્યુની જેમ નિર્વિશેષ ભાવવાળી (જેમ મોત માટે કોઈ નાનું-મોટું-સગું-પારકું નથી હોતું તેમ નિર્લજ્જતા વગેરેને કારણે સ્વી માટે પણ ઉંમર-સંબંધ વગેરેના ભેદ વિના વિવિધ પુરુષો સમાન હોય છે.)
- (૪૧) ‘કાળ’ જેવી નિર્દ્ય.
- (૪૨) વસુણની જેમ હાથમાં પાશ (બંધન) રાખનારી.
- (૪૩) પાણીની જેમ ‘નીચ’ તરફ જનારી
- (૪૪) કંજૂસની જેમ હાથ લંબાવનારી (માતા-પિતા વગેરે પાસેથી ધન લેનારી)
- (૪૫) નરકની જેમ ખૂબ ત્રાસ આપનારી.
- (૪૬) વિષા ખાનાર ગધેડાની જેમ દુષ્ટ આચારવાળી (કારણ કે તે જે-તે જગ્યાએ પુરુષની કામના કરતી હોય છે.)
- (૪૭) ખરાબ ઘોડાની જેમ કાબુમાં લાવવી મુશ્કેલ.
- (૪૮) બાળની જેમ મુહૂર્તમાત્ર હદયવાળી (કારણ કે મુહૂર્ત પછી એને બીજા પર રાગ થાય છે.)
- (૪૯) માયા-મહાઅંધકારવાળી હોવાથી સમજવી મુશ્કેલ.
- (૫૦) વિષવેલીની જેમ સંગ કરવા માટે તદ્વન અયોગ્ય.
- (૫૧) દુષ્ટ જળચરોવાળી વાવડીની જેમ અંદર ઉત્તરવા માટે અયોગ્ય.



- (૫૨) સ્થાનભ્રષ્ટ શ્રીમંતની જેમ અપશંસનીય.
- (૫૩) માંસપેશીગૃહણની જેમ ઉપદ્રવવાળી. (જેમ માંસપેશી લેનાર પંખી બીજા પંખીઓના પ્રછારોને સહન કરે છે, માંસપેશી ખાવા જનાર માછલી માધ્યમારના યન્ત્રથી વીંધાઈ જાય છે, તેમ સ્વીને ગૃહણ કરનાર પણ ઘણા ઉપદ્રવોનો ભોગ બને છે.)
- (૫૪) કિંપાક ફળની જેમ પહેલા મધુર અને પછી ખૂબ ભયંકર.
- (૫૫) પોલી મુઢીની જેમ બાલિશ લોકોને લોભાવનારી.
- (૫૬) જો એને છોડાય નહીં તો બળતા ઘાસના પૂળાની જેમ બધું જ બાળી નાંખનારી.
- (૫૭) ભયાનક પાપના ફળથી જેમ બચી ન શકાય, તેમ સ્વીધી પણ બચી ન શકાય.
- (૫૮) ખોટા રૂપિયાની જેમ ગમે ત્યાં ગમે ત્યારે ફરનારી.
- (૫૯) ભયાનક કોધીને રાખવો જેમ મુશ્કેલ છે, તેમ સ્વીને રાખવી પણ મુશ્કેલ છે.
- (૬૦) ખૂબ વિષાદની કારણ.
- (૬૧) જુગુપ્સા કરવા યોગ્ય. (એને ઓળખીએ તો ચીતરી જ ચે તેવી)
- (૬૨) કપટથી મીઠો વ્યવહાર કરનારી.
- (૬૩) ગંભીરતા વગરની.
- (૬૪) જુવાનીમાં સંભાળતા દમ નીકળી જાય તેવી
- (૬૫) પાલન કરતા થાકી જવાય તેવી
- (૬૬) જેનાથી કંટાળી જવાય તેવી.
- (૬૭) અનવસ્થિત - એક પુરુષમાં સ્થિર ન થાય તેવી
- (૬૮) આલોક-પરલોકમાં કર્કશ હુઃખ આપનારી.
- (૬૯) આલોક-પરલોકમાં ભયાનક વેર કરાવનારી.
- (૭૦) રૂપ-સૌભાગ્યથી મદોન્મત બનેલી.
- (૭૧) સાપની ચાલ જેવા વાંકા-ચૂકા હુદયવાળી.
- (૭૨) ભયાનક જંગલમાં રઝળપાટ અને નિવાસ કરવાના હોય, તેના જેવી યાતના દેનારી.
- (૭૩) કુળ, સ્વજન, મિત્ર- આ બધાંને તોડી નાંખનારી.
- (૭૪) બીજાના દોષને જાહેર કરી દેનારી.
- (૭૫) એના પર ગમે તેટલો ઉપકાર કર્યો હોય, તો ય સામે અપકાર કરનારી.
- (૭૬) પુરુષના દેહસર્વસ્વને ગાળી નાંખનારી.



- (૭૭) જંગલી ભૂંડને કંઈ ખાવા મળે તો ગુમ સ્થાને જઈ ખાય, તેમ પુરુષને પામીને એકાંતમાં દુરાચાર કરનારી.
- (૭૮) ચંગળ.
- (૭૯) વસ્ત્ર, આભૂષણ વગેરે આપો તો ગ્રેમ કરનારી.
- (૮૦) પુરુષોને અંદર અંદર ભંગાણ પડાવનારી.
- (૮૧) દોરડા વગરનું બંધન.
- (૮૨) લાકડા વગરનું જંગલ.
- (૮૩) પાપચેષ્ટામાં આળસ વગરની.
- (૮૪) અદશ્ય વેતરણી નહીં.
- (૮૫) નામ વગરનો અસાધ્ય રોગ.
- (૮૬) સતત વિલાપ.
- (૮૭) રોગ વગરનો ઉપસર્ગ.
- (૮૮) વાસના ઉપજલીને મનને ડામાડોળ કરનારી.
- (૮૯) આખા શરીરમાં વ્યાસ થનારો સંતાપ.
- (૯૦) વાદળા વગરની વીજળી.
- (૯૧) પાણી વગરનો તાણી જનારો મ્રવાહુ.
- (૯૨) જેને કોઈ રોકી ન શકે એવું સમુદ્રનું તોફાન
- (૯૩) જેનો વિશ્વાસ જ ન કરી શકાય તેવી.

આ છે સ્થી.
 એને ચાહી શકાય,
 એને સારી માની શકાય,
 એના માટે બધું જ કુરબાન કરી શકાય,
 એવું એનામાં શું છે ?

- શું કેન્સરને ચાહી શકાય ?
 શું રોગને સ્પૃહણીય માની શકાય ?
 શું હત્યાને આવકારી શકાય ?
 શું દુશ્મનના ખોળામાં માથું રાખી શકાય ?



શું વિષાનું વિલેપન કરી શકાય ?
 શું ભૂંડણમાં સૌન્દર્યની કલ્પના કરી શકાય ?
 શું અધિની જવાળાઓમાં સૂઈ શકાય ?
 ‘સ્ત્રી’ની લેશ પણ સ્પૃહ જગે
 એ બધું જ આના જેવું છે.

સ્ત્રી માયા કરે
 એ તો બીજા નંબરની વાત છે.
 પહેલી વાત તો એ છે
 કે સ્ત્રી પોતે જ માયા છે.
 દેખાવ જુદો ને અંદર જુદું એ જ માયા.
 ઉપર સોદામણી ચામડી ને અંદર ખદબદ્ધતી ગંદકી.
 ઉપર ગુણની ખાગ ને અંદર વિશ્વાસઘાત.
 ઉપર શાંત-પ્રશાંત ને અંદર ભયંકર કકરાટ.
 ઉપર માધુર્ય ને અંદર ઝેર જેવી કડવાશ.

સ્ત્રીનો અર્થ જ છેતરપિંડી છે.
 સ્ત્રી એટલે જાંઝવાના જળ.
 એનામાં જે દેખાય છે, એ કદી પણ મળવાનું નથી.
 ભોટ હરણાની જેમ પુરુષ આખી જિંદગી સુધી દોડતો જ રહે...
 દોડતો જ રહે, ને આ દોડના ઈનામ તરીકે એને મળે
 પરસેવો, પરિશ્રમ, અફ્સોસ,
 નિરાશા, અજંપો, ત્રાસ, હેરાનગતિ,
 કષાયો, અને મોત.
 જાંઝવાનું જળ એ જેવું જળ હોય છે,
 એવી જ દેખાતી સ્ત્રી એ પોતાની માનેલી સ્ત્રી હોય છે.



એ વધુમાં વધુ આ જ બધું આપી શકે છે.

યાદ આવે ઈન્દ્રિયપરાજ્યશતક.

ણ લિહિ જહા લિહંતો, મુહલિયં અદ્વિયં જહા સુણાઓ ।

સોસડ તાલુઅરસિયં, વિલિહંતો મણાએ સુક્રખં ॥

મહિલાણ કાયસેવી, ણ લહિ કિંચિ વિ સુહં તહા પુરિસો ।

સો મણાએ વરાઓ, સયકાયપરિસ્પમં સુક્રખં ॥

ભારે આસક્તિથી કૂતરો હાડકાંને ચાવે છે.

એનાથી એના મોઢામાંથી જ લોહી નીકળે છે.

એ લોહીના સ્વાદને

એ હાડકાંનો સ્વાદ માની બેસે છે.

વધુ બચકા ભરે છે ને વધુ દુઃખી થાય છે.

બરાબર એ જ રીતે,

સ્વીશરીરનું સેવન કરતા પુરુષને પણ

હકીકિતમાં એનાથી કશું જ મળતું નથી.

તે બિચારો

પોતાના શરીરના પરિશ્રમને જ સુખ માને છે.

સ્ત્રીનો અર્થ છે છેતરપિંડીઓનો સરવાળો.

એ નથી છેતરતી

ત્યારે પણ છેતરે છે.

એ સરળ હોય ત્યારે પણ વાંકી હોય છે.

એ સુસ્નાતા હોય ત્યારે પણ ગંદી હોય છે.

એ મૌન હોય ત્યારે પણ કોલાહુલ હોય છે.

એ અડતી ન હોય ત્યારે પણ બોજો હોય છે.

એ શાંત હોય ત્યારે પણ ચુદ્ધ હોય છે.



એ સહુજ વાત કરતી હોય
 તે પણ દુરાચારનું શિક્ષણ હોય છે.
 એની મીઠાશ કડવાશથી ભરેલી હોય છે.
 એની કોમળતા કરવત કરતાં ય વધુ કર્કશ હોય છે.
 એ અનુકૂળ હોય એ સર્વોત્કૃષ્ટ પ્રતિકૂળતા હોય છે.
 એ સ્વાધીન હોય એવી પરાધીનતા બીજી કોઈ જ નથી.
 એ તમને બધી જ રીતે સાચવે.
 એટલે હવે કદાચ તમને ભગવાન પણ બચાવી નહીં શકે.
 એ તમને ગમી
 એટલે તમારો ખેલ ખલાસ.

યાદ આવે પરમ પાવન શ્રી આચારાંગસૂત્ર -
 થીભિ લોએ પવ્વહિએ
 દુનિયા ખૂબ જ દુઃખી છે એનું કારણ છે શ્રી.
 ભર્તૃહરિ કહે છે -
 સત્ય જના વચ્ચિ ન પક્ષપાતાત्,
 લોકેષુ સર્વેષ્વપિ તથ્યમેતત् ।
 નાન્યન् મનોહારિ નિતમ્બિનીભ્યો,
 દુઃખૈકહેતુર્ન હિ કશ્ચિદન્ય: ॥

હે લોકો ! હું જે કહું છું, તે સાવ સાચી વાત છે.
 એમાં બિલકુલ પક્ષપાત નથી.
 બધાં લોકોમાં પણ આ અનુભવસિદ્ધ હકીકત છે કે
 શ્રીથી વધુ મનોહર કંઈ જ નથી,
 અને દુઃખનું એકમાત્ર કારણ પણ
 શ્રી સિવાય બીજું કશું જ નથી.



આપણને જે ગમે છે,
 એના આપણો ઓછા-વત્તા અંશો ગુલામ હોઈએ છીએ.
 અને જે સૌથી વધુ ગમે
 એને આપણો આપણી જાત વેંચી દીવી હોય છે.
 આમાં મહુત્વની વાત એ છે
 કે ગમતી વસ્તુ જે જે કારણોથી ગમતી હોય,
 તે તે કારણો ખરેખર એમાં હાજર હોય
 ને તે તે કારણો તેમાં કાયમ રહેવાના હોય.
 તો ય એ વસ્તુથી આપણે દુઃખી જ થવાના હોઈએ છીએ.

સ્વી જે જે કારણોથી ગમતી હોય,
 દા.ત. સૌન્દર્ય, કોમળતા, શુચિતા-આ બધું એનામાં હોતું નથી.
 આ બધી વસ્તુઓનો એમાં જે આભાસ થાય છે.
 એ આભાસના કારણો પણ એમાં કાયમ ટકતા નથી.
 સ્વીનો વર્તમાન પણ દુઃખદાયક હોય છે.
 અને એનામાં થતા પરિવર્તનો વધુ દુઃખદાયક હોય છે.

સોણ વર્ષે જે સ્વીમાં સૌન્દર્યનો આભાસ થતો હતો,
 તે જ સ્વીનો અદ્ધી સદ્ગીનો વિકાસ
 એને વૈરાળ્યનું કારણ બનાવી દે છે.
 એના જે અંગો મોહુનો ઉદ્ય કરતા હતા.
 એ જ અંગો મોહુનો અસ્ત કરી દે છે.
 એને જોવી એ પણ ‘ત્રાસ’ હોય છે.

રાગથી ત્રાસ સુધીની આ યાત્રા
 એટલે જ ધર-સંસાર.
 જેમાં સુખના શમણા હોય છે,



સુખ પામવા માટેના ધમપણા હોય છે.
ક્યારેક કંઈક સુખનો આભાસ હોય છે.
પણ હુકીકતમાં સુખનો છાંટો પણ હોતો નથી..

સંસારની બધી જ પળોજાણા.. બધી જ મથામણા
એ જેના માટે હોય છે.

આખી જિંદગી માણસ જેના માટે
બધી જ હાડમારી વેઠે છે.
એ વિષયસેવનનો કુલ સમય કેટલો ?

અંશી વર્ષના જીવનમાં એક વર્ષ પણ ખરું ?
શાંતિથી વિચાર કરીએ તો જ્યાલ આવે કે
ઘાટ કરતાં ઘડામણ મોંધી
એ સ્થિતિને તો ક્યાંય સારી કહેવડાવે,
એવી હાલત આ દુનિયાની થઈ છે.

ઓગણીશ કલાકની મુસાફરી કરીને
અમેરિકા જોવા જવું
અને ફક્ત અડધો કલાકમાં ત્યાંથી પાછા ફરવું
એવી આ મૂખ્યમી છે.

જો અમેરિકામાં ફક્ત અડધો જ કલાક ગાળવાનો હોય
તો એ રીતે અમેરિકા ન જવાય
એમ નજીવા ને નજીવા સમયના વિષયભોગ માટે
આખી જિંદગીની હાડમારી ન વેઠાય.
આ બધી તો સ્થૂળ દસ્તિની વાતો છે.
બાકી તાત્ત્વિક દસ્તિએ વિષયોનો ભોગ હોતો જ નથી.
જે હોય છે તે આત્માનો જ ભોગ હોય છે.



યાદ આવે ભર્તૃહરિ -

ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા: ।

અમે ભોગો ભોગવ્યા એ અમારી નરી ભ્રમણા ઉતી.
હકીકતમાં તો અમે પોતે જ ભોગવાઈ ગયા છીએ.

આત્મા એના સ્વભાવથી બ્રષ્ટ થાય.

એમાં ખાનાખરાબી થાય.. એ ચૂંથાય.

એ મસળાય.. એ પિંખાઈ જાય

એનું નામ ભોગ.

કદાય એમાં કંઈક સુખ હોત પણ
તો ય એ નજીવા ને નજીવા સમયના સુખ માટે
દુઃખોના દરિયાને નિમંત્રણ આપવું એ કેટલું ઉચિત ?
આ તો એક ભવની તુલનાની વાત છે.
બાકી સમગ્ર ભવચકની તુલનાએ જોઈએ,
તો એમાં વિષયસેવનનો સમય કેટલો ?
અબજો વર્ષની તુલનામાં
એક સેકન્ડના અબજોમાં ભાગ જેટલો પણ નહીં.

શું એટલા સમયના કલિપત સુખ માટે
આ સમગ્ર ભવચકની ભયાનક રજળપાટ કરવી ?

શું એટલા તુચ્છ કલિપત સુખ માટે
સાત નરકના ચોર્યાશી લાખ નરકાવાસોના
ભયાનકથી ય ભયાનક દુઃખ વહોરી લેવા ?

શું એટલા ખાતર તિર્યંગતિની
ખતરનાક યાતનાઓને કબૂલ કરી લેવી ?



સ્ત્રી

એ એના માટે તો જે હુશે તે હુશે.
આપણા માટે એ ભવભ્રમણ છે.
નરક છે, નિગોદ છે, કતલખાનું છે.
મર્યાદીમારી છે, પોદ્દ્રીફાર્મ છે, વિશ્વયુદ્ધ છે.
આણુભોગબ છે.

યાદ આવે ઉપનિષદો -

સ્ત્રીયં ત્યક્ત્વા જગત્ ત્યક્તં, જગત્ ત્યક્ત્વા સુખી ભવેત् ।

સ્ત્રી છોડી એટલે જગ છોડ્યું.

જગ છોડ્યું એટલે સુખી થયો.

યાદ આવે શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર -

ઇતથીઓ જે ણ સેવંતિ, આદિમોક્ખા ઉ તે ણરા ।

જેઓ સ્ત્રીને સેવતા નથી, તે પુરુષોનો સૌ પ્રથમ મોક્ષ થશે.
સ્ત્રીની વાત પણ સ્ત્રીનું સેવન છે.

અને સ્ત્રીનો વિચાર પણ સ્ત્રીનું સેવન છે.

અખ્રબ્ધના અઢાર પ્રકાર છે.

તેમ તેના ત્યાગ-સ્વરૂપ બ્રહ્મના પણ અઢાર પ્રકાર છે,

પ્રશભરતિમાં પૂ. ઉમાસ્વાતિ મહારાજા કહે છે -

દિવ્યાત् કામરતિસુખાત्, ત્રિવિધં ત્રિવિધેન વિરતિરિતિ નવકમ् ।

ઔદારિકાદપિ તથા, તદ્ બ્રહ્માષ્ટાદશવિકલ્પમ् ॥

મન-વચન-કાયા અને કરાણ-કરાવાણ-અનુમોદન

૩ x ૩ = ૯

૯ પ્રકારે દિવ્ય-ભોગનો ત્યાગ

૯ પ્રકારે ઔદારિક (મજુદ્ય-તિર્યં) ભોગનો ત્યાગ

આમ અઢાર પ્રકારનું બ્રહ્મ છે.



શ્રીનો મનથી વિચાર સુદ્ધા ન આવવો
 આ તો શી રીતે બની શકે ?
 એવો અજ્ઞાનીનો પ્રશ્ન છે.

જ્ઞાની ભગવંતો એની સામે પ્રતિપ્રશ્ન કરે છે -

કે એનો વિચાર આવે એ શી રીતે બની શકે ?
 શું ગટરનો વિચાર આવ્યા કરે એવું બને ?
 શું કોઈ શૌચાલયનો વિચાર કર્યા કરે એવું થાય ?
 શું કોઈનું મન ઉકરડામાં અટવાય એવું બને ?
 શું આ બધાં સ્થાનોમાં સારો પહુંચો લગાડવામાં આવે
 એટલા માત્રથી એ સ્થાનો સ્પૃહણીય થઈ જાય ?

જો ના

તો શ્રી પાણ સ્પૃહણીય થઈ શકે તેમ નથી જ.

જ્ઞાનાર્થ કહે છે -

કુથિતકુણપગન્થં યોષિતાં યોનિરન્થં,
 કૃમિકુલશતપૂર્ણ નિર્જરત ક્ષારવારિ ।
 ત્યજતિ મુનિનિકાય: ક્ષીણજન્મપ્રબન્ધો,
 ભજતિ મદનવીરપ્રેરિતોડ્ઝણી વરાક: ॥

શ્રીના ગુમ અંગમાંથી
 સેઢાં મડાં જેવી વાસ આવતી હોય છે.
 સેંકડો કીડાઓ એની અંદર ખદખદી રહ્યા હોય છે.
 ગંદુ પાણી અમાંથી ઝર્યા કરતું હોય છે.
 મોક્ષગામી મુનિઓ એનો સહૃજ ત્યાગ કરે છે.
 ને કામપરવશ જીવ
 બિચારો એને જ ચુંથ્યા કરે છે.



‘સત્ય કડવું છે.’

આ વાત પ્રસ્તુત સંદર્ભમાં ખરેખર સત્ય છે.

સ્વીના જે અંગોની પાછળ દુનિયા દિવાની છે,
તે અંગોની સર્વ્યાઈ શું છે ?

તંદૂલવૈચારિક આગમ કહે છે -

રાગેણ ણ જાણંતિ વરાયા કલમલસ્સ ણિદ્વમણ ।

તાણ પરિણંદંતા ફુલ્લ ણીલુપ્પલવણ વ ॥

બિચારા કામવાસનાને પરવશ જીવો જાણી શકતા નથી,

કે આ અંગ તો ગંદકીની વાહક ગટર છે.

એમને તો આ ખીલેલા નીલકમળના ઉપવન જેવું લાગે છે.

મોહાધીન જીવોની આ કરુણતા છે,

આ એમના દુર્ભાજ્યની હૃદ છે,

કે સ્વીના જે અંગો વધુ જુગુખ્સનીય છે,

એમનામાં જ એમને વધારે રાગ થાય છે

જ્ઞાનીઓ એમની આ સ્થિતિ જોઈને દ્રવિત થઈ જાય છે.

એમના ઉદ્ગાર છે -

ચર્મખણ્ડ સદાભિન્ન-મપાનોદ્ગારવાસિતમ् ।

તત્ત્ર મૂઢાઃ ક્ષયં યાન્તિ, પ્રાણૌરપિ ધનૈરપિ ॥

એ છે ભાત્ર એક ચામડાનો ટુકડો,

જેના બે ભાગ થયેલા છે.

અપાનવાયુ એમાંથી બહાર નીકળે છે.

ને એ અંગને વધુ દુર્ગંધમય બજાવતો જાય છે.

બિચારા મૂઢ જીવો એના ખાતર

પોતાનું ધન ને પોતાના પ્રાણ

બધું જ ગુમાવી દે છે.



ઉત્તાનોચ્છૂનમણ્ડૂક-દારિતોદરસન્નિભે ।

કલેદિનિ સ્થીવ્રણે સક્રિ-રકૃમે: કસ્ય જાયતે ? ||

દેડકો મરી ગયો હોય,

થોડો ફૂલી ગયો હોય, ચતો પડ્યો હોય

ને એનું પેટ ફાટી ગયું હોય,

કેટલું બીભત્સ.. ગંધું...ચિતરી ચે એવું દશ્ય !

આ છે સ્થીનું એ અંગ.

જાણે કોઈ ઘા હોય,

બગડેલા લોહી વગેરેથી ખરડાયેલો હોય.

કીડા સિવાય એ કોને ગમી શકે ?

અવધૂતગીતા કહે છે -

વિષાદિનરકં ઘોરં ભાગ ચ પરિનિર્મિતમ् ।

કિમુ પશ્યસિ રે ચિત્ત !? કથાં તત્ત્વૈવ ધાવસિ ? ||

ભગેન ચર્મકુણ્ડેન, દુર્ગન્ધેન વ્રણેન ચ ।

ખણ્ડિતં હિ જગત્ સર્વ, સદેવાસુરમાનુષમ् ॥

વિષા વગેરેથી ભરેલી નરક

જેટલી ભયંકર છે

અટલું જ ભયંકર છે સ્થીનું ગુહ્ય અંગ -

એ ય વિષા, મૂત્ર વગેરેથી ભરેલી નરક જ છે.

મન ! શું છે એમાં જોવા જેવું ?

શું છે એની પાછળ દોડવા જેવું ?

એ છે ફક્ત ચામડાનો કુંડ.

ગંદી વાસ છૂટી રહી છે એમાંથી

એક ઘા-થી વધુ કશું જ નથી એમાં



ને તો ય એણો દેવ-દાનવ-મજુષ્યો
આખી દુનિયાનો કચ્ચરધાણ કરી દીધો છે.

વિવેકનો અંશ પણ હોય
તો સ્ત્રીનો રૂપર્શ કરવો તો શક્ય નથી જ.
સ્ત્રીનો વિચાર સુદ્ધા અશક્ય છે.

દારુના નશાવાળો માણસ ગાટરમાં આળોટે છે.

મોહુના નશાવાળો માણસ

જુગુપ્સનીય અંગોને સારા માને છે.

શાંત અને સ્વસ્થ ચિંતે વાસ્તવિકતાનો વિચાર કરીએ

તો એ અંગો જુગુપ્સા સિવાય

બીજું કંઈ જ ઉપજાવી શકે તેમ નથી.

પરિણામ એ જ આવશે

કે એનો વિચાર સુદ્ધા નહીં આવી શકે.

જ્ઞાનાર્થવ કહે છે -

કુષ્ટવ્રણમિવાજસ્તં, વાતિ સ્વરતિ પૂતિકમ् ।
યત્ સ્ત્રીણાં જઘનદ્વારં, રતયે તર્દ્ધિ રાગિણામ् ॥

જાણો કોઈ કોઢીનો ધા ન હોય,
એમ વારંવાર જે દુર્ગધી વાયુ છોડે છે,
ગંદું પ્રવાહી ઝર્યા કરે છે,
એવું છે સ્ત્રીનું ગુણ અંગ,
પણ મૂઢ જીવને એમાં જ રાગ થાય છે.

કાક: કૃમિકુલાડ્ડકીર્ણે, કરઙ્ગે કુરુતે રતિમ् ।

યથા તદ્વદ્વ વરાકોડ્યં, કામી સ્ત્રીગુહામન્થને ॥

કોહિવાયેલું મહદું હોય



સેંકડો કીડાઓ ખદખદી રહ્યા હોય
 હાડપિંજર ડોકિયા કરતું હોય
 એ ય કાગડાને ગમે છે.
 તેમ બિચારા કામીને
 થીના જુગુપ્સનીય અંગને ચૂંથવું ગમે છે.

વક્રમણિ લજનીયે, દુર્ગન્ધે, મૂત્રશોળિતદ્વારે ।
 જઘનબિલે વનિતાનાં, રમતે બાલો ન તત્ત્વજ્ઞ: ॥
 જેની વાત કરતાં પાણ શરમ આવે
 જેની વાસ સાવ જ ગંદી છે.
 જેમાંથી મૂત્ર અને લોહી બહાર આવે છે.
 એ ગંદુ દર બાલિશને જ ગમે
 સમજુને નહીં.

અશુચિષ્વઙ્ગનાઙ્ગેષુ, સઙ્ગતા: પશ્ય રાગિણ: ।
 જુગુપ્સાં જનયન્ત્યેતે, લોલન્ત: કૃમયો યથા ॥
 થીના અંગો એટલે ખુદ પાણ ગંદકી,
 એમની અંદર પાણ ગંદકી,
 મૂઢ જીવો એમાં જ સંગ કરે છે.
 જાણે વિષામાં ખદખદતા કીડા.
 એ ગંદકી તો જુગુપ્સા કરાવે જ છે
 એ જીવો પર પાણ જુગુપ્સા થઈ જાય છે.

ઉત્તાનોચ્છૂનમણ્ડૂક-દારિતોદરસભે ।
 ચર્મરન્ધે મનુષ્યાણા-મપૂર્વ: કોડ્યસદ્ગ્રહ: ॥

દેડકાનું મડું ચતુ પેલું હોય,
 થોંં ફૂલી ગયું હોય



ને એનું પેટ ફાટી ગયું હોય,
એના જેવું છે એ ચામડાનું છિદ્ર,
'બસ, એ જ જોઈએ.'

આ કદાગ્રહ કેટલો તો વિચિત્ર છે !
વિવેકશૂન્યતા વિના આવી હુઠ થઈ જ ન શકે.

બધે જ ચોકખાઈનો આગ્રહ રાખતો
ને ગંદકીથી દૂર ભાગતો માણસ
સ્વી-ની બાબતમાં તદ્દન શીર્ષાસનને સ્વીકારી લે,
ને આ શૌચવાદને છોડીને
સાવ જ અશૌચવાદી બની જાય
એ મોહરાજાની ગંધી રમત છે.
કૂર ચાલ છે.
આપણો થોડો પણ વિવેક દાખવી શકીએ,
તો એનાથી આપણો બચી શકીએ છીએ.

કૂતરા કે ગધેડા જેવા સંભોધનો ય
જો આપણને દુઃખી કરી શકતા હોય,
તો ગંદકીના કીડા બનીને
આપણો શી રીતે સુખી થઈ શકીએ ?
યાદ આવે નારદપરિવ્રાજકોપનિષદ્ધ.

ત્વદ્માંસરુધિરસ્નાયુ-મજામેદોઽસ્થિતસંહતૌ ।
વિષ્ણૂપ્રયે રમતાં, કૃમીણાં કિયદન્તરમ् ? ||

સ્વી એટલે શું ?
ચામડી, માંસ, લોહી, સ્નાયુ, મજજા, ચરબી, હડકાં,
વિષા, મૂત્ર અને પરું.



જે એમાં રાયે

અનામાં અને કીડાઓમાં ફરક શું રહ્યો ?

સ્ત્રીણાવાચ્યદેશસ્ય, કિલનનાડીવ્રણસ્ય ચ ।

અભેદેઽપિ મનોભેદાજુ, જનઃ પ્રાયેણ વજ્યતે ॥

સ્ત્રીઓનું ગુધ અંગ।

અને ગંદકીને છોડ્યા કરતું ગુમું,

આ બંને હોય છે તો એક સરખા ૪.

પણ આ બંને માણસને જુદા લાગે છે.

ને અનાથી જ એ પ્રાયઃ છેતરાય છે.

ચર્મખણં દ્વિધા ભિન્ન-મપાનોદ્ગારધૂપિતમ् ।

યે રમન્તિ નમસ્તેભ્યઃ, સાહસં કિમતઃ પરમ् ॥

એ છે ફક્ત ચામડાનો ટુકડો,

જેના બે ભાગ થયા છે.

અપાન-વાયુની દુર્ગંધે

અને ઓર બીભત્સ બનાવ્યું છે.

જે એમાં રાયે છે અને અમે હુથ જોડીએ છીએ.

આનાથી વધુ અવિચારિત ફૂત્ય બીજું હોઈ શકે ?

શરીર એ ગાટર છે.

જો ગાટર ચોકખી થઈ શકે

તો શરીર ચોકખું થઈ શકે.

જો ગાટર સુગંધી થઈ શકે

તો શરીર સુગંધી થઈ શકે.

જિનાજ્ઞાના પાલનમાં શરીર જેટલું સહાયક થાય.

એટલો જ શરીરમાં સાર છે.

બાકી એમાં સૌનંદર્યની કદ્યપના,



એને અડવા ને ભોગવવાની તૃષ્ણા॥

એ બધું નર્યા ગાંડપણ સિવાય બીજું કંઈ જ નથી.

આરાધનાપતાકા ગ્રંથ કહે છે -

કિમિણો વ વળો કિમિકુલસએહિં સઙ્ગ સંકુલં સરીરમિણ ।
ઇંક્રં પિ ણત્થિ અંગં પૂયં સુઝ્યં ચ જં હુજા ॥

કીડાઓથી ખદબદ્તા ગુમડાં જેવું છે આ શરીર.
સેકડો કીડાઓ એની અંદર ખદબદી રહ્યા છે.
એનું એક પણ અંગ એવું નથી.
જે પવિત્ર હોય કે સ્વરદ્ધ હોય.

સબુક્તિયચમ્મં, પંડરગત્ત મુયંતવણરસિયં ।

સુદુ વિ દડ્યં મહિલા, દદું પિ ણરં ણ રોએડ્ઝ ॥

આખી ય ચામડી ઉખેડી લીધી હોય,
કિંકું ધોળું શરીર હોય,
ગુમડા જેવી રસી શરીરમાંથી વહી રહી હોય,
એ પુરુષ પુહેલાં ગમે તેટલો વહાલો કેમ ન હોય,
હવે સ્વીને એ જોવો પણ ગમશો નહીં.

જડ હુજ મચ્છિયાપત્તસરિસિયાડ તયાડ નો નદ્દં ।

કો નામ કુણિમભરિયં સરીરમાલદ્ધુમિચ્છિજ ॥

માખીની પાંખ જેવી ચામડી છે,
જેનાથી આ શરીર ઢંકાયેલું છે.
જો એ ન હોત
તો આ દુર્ગન્ધી માંસ વગેરેથી ભરેલા શરીરને
બેટવાની ઈચ્છા કોણ કરત ?



કણોસુ કળણગૂહો, જાયડ અચ્છીસુ અચ્છિદૂસીઓ ।

નાસાગૂહો નાસાઉડેસુ, વયણે ય દંતમલો ॥

કાનમાં, કાનનો મેલ... આંખોમાં આંખોનો મેલ..

નાકમાં નાકનો મેલ... મોઢામાં દાંતનો મેલ..

શરીર એ ખુદ મેલ પણ છે

અને એ મેલને પેદા કરતું કારખાનું પણ છે.

એનામાં વૈરાગ્ય સિવાય બીજું કંઈ જ કરવા જેવું નથી.

વિદ્વાપુણો ભિણો ઘડો વ્વ, અસું સમંતાઓ ગલઝ ।

પૂઙંગાલો વ વણો, મુંચઝ દુર્ગંધગંધવહં ॥

ઘડો ભાંગેલો હોય ને વિષાથી ભરેલો હોય,

એ જેમ બધી બાજુથી ગંદકી વહાવ્યા કરે.

એવું છે આ શરીર.

જાણો ગંદુ ગુમડું.

એમાંથી જાત જાતની રસી નીકળ્યા જ કરે.

એ સતત દુર્ગધને છોડ્યા જ કરે.

અસુદ્વણપુઙંધં સેવંતા મહિલિયાઝ કુણિમકુંડિ ।

સોઆહિમાણિણો જે તે લોએ હુંતિ હસણિજા ॥

સ્ત્રી એટલે માંસની ઝૂંપી.

સહેલા ગુમડા જેવી દુર્ગધ એમાંથી છૂટી રહી છે.

ગંદકીનું એ એક ઉતૃષ્ઠ ઉદાહરણ છે.

એક બાજુ અને દર્શનીય અને સ્પર્શનીય સમજવી

અને બીજુ બાજુ પોતાને સ્વચ્છતાપ્રિય સમજવા

એ પોતે જ પોતાની મશ્કરી કરવા બરાબર છે.

એ વ્યક્તિ શૌચપ્રિય તો નથી જ

માણસ પણ નથી.



યાદ આવે કાતિકિય-અનુપ્રેક્ષાટીકા -

દુર્ગન્ધે ચર્મગર્તે, વ્રણમુખશિખરે, મૂત્રરેત:પ્રવાહે,
માંસાસુકર્ડમાર્દે, કૃમિકુલકલિતે, દુર્ગમે દુર્નિરીક્ષે ।

વિષાદ્વારોપકણે, ગુદવિવરગલદ્-વાયુધૂમાર્તધૂપે,
કામાન્ધ: કામિનીનાં, કટિતટનિકટે, ગર્દભત્યુત્થમોહાત્ ॥

એ ખરાબ વાસ મારે છે.

એમાં ચામડાનો ખાડો છે.

એ કાણું ગુમડાની ટોંચ જેવું-ચિતરી ચે એવું છે.

મૂત્ર અને વીર્યની અશુચિ એમાંથી વહી રહી છે.

માંસ અને લોહીના કાદવથી એ ઓર બીભત્સ છે.

કેટલાંય કીડાઓ એમાં ખદબદ્દી રહ્યા છે.

એ તો જટિલ છે જ, એને જોવું ય જટિલ છે.

એમાં એક દ્વાર વિષાનું પણ છે.

એ કાણામાંથી પણ ગંદી વાસ નીકળ્યા કરે છે.

આ છે સ્ત્રીની કેડ.

કામાન્ધ જીવ એની પાસે ગઢેડા જેવો બની જાય છે.

રે મોહ ! તને જેટલા ધિક્કાર આપીએ એટલા ઓછા છે.

મોહનો અર્થ છે અંધાપો.

હજુ કદાચ અંધાપો સારો છે.

પણ મોહ સારો નથી.

અંધાપામાં માણસને દેખાતું નથી.

મોહોદ્યમાં ઉધું દેખાય છે.

અ-દર્શનમાં એટલું નુકશાન નથી.

જેટલું વિપરીત-દર્શનમાં નુકશાન છે.



યાદ આવે મહાભારત -

ન કાળો દણ્ડમુઘમ્ય, શિર: કૃન્તતિ કસ્યચિત् ।

કાલસ્ય બલમેતાવદ્, વિપરીતાર્થદર્શનમ् ॥

કાળ રૂઠે એટલે એ કંઈ તલવાર લઈને

કોઈનું માથું કાપી નથી નાખતો.

કાળનું બળ તો એટલું જ છે

કે એ જે છે એનાથી ઉંઘું દેખાડે છે.

મોહુ થયો એટલે કાળ રૂઠચો.

હવે તમે પોતે જ પોતાનું સત્યાનાશ વાળી દેશો.

મોહુ કે કાળ

એમણે વધુ તકલીફ લેવાની જ નથી..

એમના માટે આટલું જ પૂર્તું છે.

વિપરીતાર્થ-દર્શન.

અધ્યાત્મસાર કહે છે -

કુન્દાન્યસ્થીનિ દશનાનુ, મુખં શ્લેષ્મગૃહં વિધુમ् ।

માંસગ્રન્થી કુચૌ કુમ્ભૌ, હેમો વેત્તિ મમત્વવાનુ ॥

ખીના દાંત હકીકતમાં હાડકાં જ હોય છે.

પાણ કામાન્ધને એ મોગરા લાગે છે.

એનું મોહું કફનું ઘર હોય છે,

પાણ કામાન્ધને એ ચાંદા જેવું લાગે છે.

એના સ્તન માંસની ગાંઠ સિવાય કંઈ જ નથી.

ઇતાં કામાન્ધને એ સ્વાર્દુકળશ લાગે છે.

દુનિયાના દરેક માણસને ખબર છે

કે પોતાનું શરીર કેવું છે ?



જેવું પોતાનું શરીર છે, એવું જ બીજાનું શરીર છે.
 એ પાણ પરસેવાથી દુર્ગધી થાય છે.
 એ ય વાસ મારે છે
 એના ય વિવિધ અંગો ગંદકી છોડ્યા કરે છે
 એના ય ગુહ્ય અંગો જુગુપ્સનીય છે
 એના ય ગુહ્ય અંગો મલિન અને લજજનીય છે.
 એના ય ગુહ્ય અંગો સૌથી વધારે ગંદી વસ્તુના વાહક છે.
 તો પછી એમનામાં રાગ શી રીતે થઈ શકે ?
 એમનામાં રાગ કરવામાં કેટલું ઔચિત્ય ?
 એમને જોવા-અડવાની ઈચ્છા
 એ સાવ જ ગાંડપાણ નહીં તો બીજું શું ?
 યોગસૂત્રમાં મહર્ષિ પતંજલિ કહે છે -

સ્વાઙ્ક જુગુપ્સા પરૈરસંસર્ગ: ।

જો તમે વિવેકી છો
 તો તમને પોતાના શરીરની જુગુપ્સા થશે
 અને બીજાના શરીરનો સંગ કરવાનો
 વિચાર સુદ્ધા નહીં આવે.
 આમાં વધારાનું એટલું સમજવાનું છે
 કે ખીનું શરીર વધારે ગંદું છે.

ચાણક્યનીતિ કહે છે -

સ્ત્રીષુ શૌચं કુતः ?

સ્ત્રીઓમાં સ્વચ્છતા ક્યાંથી હોઈ શકે.
 એમની શરીર-સંરચના જ એવી છે.
 કે તેમનું શરીર



પુરુષ કરતાં પણ વધુ ગંદકીનું વાહક બને છે.

આખી દુનિયા એને જુએ છે, જાણે છે,

પણ મોહુ એને છતી આંખે આંધળી બનાવી દે છે.

બુદ્ધિના આ અંધાપામાં

માણસ એટલું અવિવેકી ફૂત્ય કરે છે,

કે જેના પર એને પોતાને જ શરમ ઉપજ્યા વિના ન રહે.

પ્રશભરતિમાં પૂ. ઉમાસ્વાતિ મહારાજા કહે છે -

આદાવત્યભ્યुદ્યા મધ્યે શૃઙ્ગારહાસ્યદીસરસાઃ ।

નિકષે વિષયા બીભત્સ-કરુણલજ્જાભયપ્રાયાઃ ॥

ભોગની શરૂઆતમાં કામરસ વિકસે છે.

પછી શુંગાર ને હાસ્યથી એ રસ વધે છે

પણ અંતે તો એમાં જુગુપ્સા થઈ જાય છે.

કરુણાતા છવાઈ જાય છે.

શરમ આવી જાય છે. અને ડર પણ લાગે છે.

નશામાં માણસ ગટરમાં સૂતો હોય

ને વિષા ચ્યૂથતો હોય,

પણ જે પળે એનો નશો ઉતરી જાય

ત્યારે પોતાની દશા જોઈને

એની જેવી હુલત થાય ?

જ્ઞાનીઓ કહે છે -

ભોજનાન્તે સ્મશાનાન્તે, મૈથુનાન્તે ચ યા મતિઃ ।

સા મતિઃ સર્વદા ચેત્ સ્યાન्, નરો નારાયણો ભવેત् ॥

ભોજનના અંતે, સ્મશાનના અંતે

અને મૈથુનના અંતે જેવી બુદ્ધિ થાય છે



એવી બુદ્ધિ જ હંમેશા રહે
તો નર નારાયણ થઈ જાય
સ્વીનો અર્થ છે દ્રવ્ય-ભાવ હિંસા.

સ્વી રાગ-દ્રેષ્ણનું પરમ કારણ છે
માટે એ ભાવ હિંસા છે.

સ્વીના સંગમાંથી આખા ઘર-સંસારનું સર્જન થાય છે
વેપાર-નોકરી-રસોડું... આ બધાનું મૂળ સ્વી-સંગ છે,
માટે સ્વી-સંગ દ્રવ્યહિંસાનું પણ કારણ છે.
સ્વીસંગ સ્વયં પણ દ્રવ્યહિંસા છે.

સંબોધમકરણમાં કહ્યું છે -

ઇથીણ જોળિમજ્જો ગબ્ભગયા ચેવ હુંતિ ણવ લક્ખ ।
ઇક્કો વ દો વ તિણિ વ ગબ્ભપુહત્ત ચ ઉક્કોસં ॥
ઇથીણ જોળિમજ્જો હવંતિ બેઝંદિયા અસંખ્યા ય ।
ઉપ્પજંતિ ચયંતિ ય સમુચ્છિમા જે તે અસંખા ॥
ઇથીસંભોગે સમગ્ન તેસિં જીવાણ હુંતિ ઉદ્વણ ।
રુયગણલિયાજોગપ્યઓગદિદૃતસબ્ભાવા ॥

સ્વીઓની યોનિમાં ગર્ભગત એક, બે, ત્રણ
કે ઉત્કૃષ્ટથી નવ લાખ જીવો ઉત્પત્ત થાય છે.
તેમાંથી એક કે બે જન્મે છે.
ને બીજા બધાં જ મૃત્યુ પામે છે.

એ સિવાય પણ
સ્વીની યોનિમાં અસંખ્ય બેઠિન્દ્રિય જીવો
અને અસંખ્ય સંમૂચ્છિમ જીવો
જન્મે છે ને મરે છે.

સ્વી-ભોગ વખતે તે જીવોની એક સાથે હિંસા થાય છે.



જેમ રૂ થી ભરેલા પાઈપની અંદર
 તપાવેલો લોખંડનો સળિયો નાંખવાથી
 તે બધું જ રૂ બળી જાય,
 તેમ મૈથુન દરમિયાન
 સ્વી-યોનિના તે તે જીવોની હિંસા થાય છે.
 ગંદા-જુગુપ્સનીય-તુચ્છ-શરમજનક-કહેવાતા સુખ માટે
 કેટકેટલા જીવોનો ત્રાસ આપવાનો !
 કેટકેટલા જીવોની હત્યા કરવાની !
 શું બદાર દેખાતા સ્થૂળ જીવોની હત્યા
 એ જ હત્યા છે ?
 શું એમને જ પીડા થાય ?
 બીજા જીવોને પીડા ન થાય ?

શું જીવદયામાં માનનાર ‘બ્રહ્મ’ ની ઉપેક્ષા કરી શકે ?
 હુકીકતમાં બ્રહ્મ એ જીવદયા છે.
 એ સ્વદયા પણ છે
 અને પરદયા પણ છે.

આ વસ્તુ આપણે પહેલા જોઈ ગયાં છીએ
 વિવાહ કર્યા વિના રથ પાછો વાળી રહેલા નેમિકુમારને
 તેમના પિતા વિવાહ કરવા માટે સમજાવે છે.
 ત્યારે તેઓ જવાબ આપે છે-

એકસ્તીસઙ્ગહેજનન્ત-જન્તુ સઙ્ઘાતઘાતકે ।
 ભવતાં ભવતાન્તેજસ્મિન्, વિવાહે કોર્યમાગ્રહ: ? ||
 “વિવાહનો અર્થ છે

એક સ્ત્રીનો પરિગ્રહ અને અનંત જીવોની હત્યા.
 વિવાહ એટલે દુર્ગતિઓની રઝળપાટ.



શા માટે આપ વિવાહ કરાવવાનો આગ્રહ કરો છો ?”

કેટલું સ્પષ્ટ હશે પ્રભુનું દર્શન !

કેવો અડગ હશે એ નિશ્ચય !

કેવો નીતરતો હશે એમનો વૈરાય !

બ્રહ્મને આત્મસાત્ત કરવા માટે

એક વાત મનમાં ફીટ બેસાડી દેવી જોઈએ.

કે અબ્રહ્મ એ કતલખાનું છે.

કદાય એ માનસિક વિકાર-સ્વરૂપ જ હોય,

તો ય એ કતલખાનું છે.

કારણ કે એ જ વિકારનું બીજ

વાસનાના વટવૃક્ષ-રૂપે ફૂલે-ફાલે છે.

ને ભવો-ભવ જીવોની કતલ કર્યા કરે છે.

જેને ‘જીવદયા’નો ગ્રેમ છે

ઓણે વહેલામાં વહેલી તકે મોક્ષે પહુંચી જવું જોઈએ

અને આ રીતે

ચૌદ રાજલોકના સર્વ જીવોને

પોતાના તરફથી કાયમી અભયદાન આપી દેવું જોઈએ.

આ શી રીતે શક્ય બને ?

ઓનો જવાબ છે બ્રહ્મ.

મોક્ષ કર્મકાયથી ગ્રાસ થાય છે.

કર્મકાય તપથી શક્ય બને છે.

અને બ્રહ્મચર્ય એ શ્રેષ્ઠ તપ છે.

યાદ આવે સૂત્રકૃતાંગ સૂત-

તવેસુ વા ઉત્તમબંભચેરં ।

તપમાં ઉત્તમ બ્રહ્મચર્ય એ શ્રેષ્ઠ છે.



બ્રહ્મચર્યનું પાલન કરવા માટે
આરાધના પતાકા નામના ગ્રંથમાં
પાંચ ઉપાયો બતાવ્યા છે -

કામકયા ઇતિથિકયા દોસા અસુઝીત વૃદ્ધસેવા ય ।
સંસગીદોસા વિ ય કરીતિ ઇત્થાસુ વેરંગ ॥

(૧) કામકૃત દોષો (નુકશાનો) (૨) સ્વીકૃત-દોષો
(૩) અશુચિપણું (૪) વૃદ્ધસેવા (૫) સંસર્ગ દોષો
આ પાંચના પરિભાવનાએ દ્વારા સ્વીઓ પર વૈરાગ્ય થાય છે.

‘કામ’ એ સુખનું નહીં, પણ કુઃખનું કારણ છે.
આ મૂળભૂત મુદ્રો છે.
આખી દુનિયા આ હકીકત અનુભવે છે.

માટે જ પ્રાગ્ય-કથાઓમાં
હઠય ઘાયલ થવું, ખોવાયેલા રહેવું, ઉંઘ હરામ થવી,
સુખ ચોરાઈ જવું, કુઃખી થવું,
વગેરે ઘટનાઓનું વર્ણન હોય છે.
ફિલ્મી-ગીતોમાં પણ આ બધી વાતો ગુંથાયેલી હોય છે.
આ બધી જ કામીઓની દુર્દશાની વાત છે.
ઇતાં ૪૩-મૂઢ્ય-મૂર્ખ જીવો એમાંથી બોધ લેવાને બદલે
એનાંથી જ વધુ કામાસક્ત થાય છે.

કામ એક સાપ છે.
એ ઉંઘે એટલે એના જેરની દશ અસરો થાય છે.

(૧) શોક (૨) કામપાત્રને જોવાની ઈચ્છા (૩) નીસાસા
(૪) તાવ (૫) અંગઢાણ (૬) ખાવાની અરુચિ (૭) મૂર્ખઈ
(૮) ગાંડપણ (૯) સુજ-બૂજ ગુમાવવી (૧૦) મૃત્યુ.



કામનાને આધારે આ અસરો તીવ્ર કે મંદ હોય છે.
 દલીલ થઈ શકે,
 કે આ બધું તો વિયોગમાં હોઈ શકે.
 સંયોગમાં તો સુખ જ હોય ને ?
 પણ હુકીકત એવી છે
 કે સંયોગ કરતા વિયોગ જ અનેકગાળો હોય છે.
 સંયોગ થાય જ નહીં એવું પણ બને છે.
 અને સંયોગ થઈ પણ જાય,
 તો ય કામી એની પછીના વિયોગમાં
 વધુ દુઃખી થતો હોય છે.
 અને જે સંયોગ કહેવાય છે.
 તેનું પણ સ્વરૂપ શું હોય છે ?

સંવેગરંગશાળા કહે છે -

પાયડિયવિગિયર્સ્વ - કામ કઢંગી સ્થિતિને પ્રગટ કરે છે.
 આયાસકિલેસસાહણિજં ચ - કામચેષાઓ પરિશ્રમ ને કલેશથી થાય છે.
 સંબંગિયગુરુવાયામ - શરીરના બધાં અંગોને ભારે વ્યાપામ થાય છે.
 જણિયસેયાહિઉબ્વેગ - માટે જ પરસેવો ને કંટાળો ઉપજે છે.
 સજ્જસરજ્જંતગિરં - ભય/ઉતાવળથી વાણી રુંધાઈ જાય છે.
 વિલજકજં - થોડી ય શરમ બચે, તો આ થઈ જ ન શકે.
 દુગુચ્છણિજં ચ - એની જુગુપ્સા સિવાય કશું જ કરવા જેવું નથી.
 પચ્છનાસેવણીયં - માટે જ સંતાયા વિના આ કરાતું નથી.
 વિવિહવાહીણં હેઉભૂય - હૃદયરોગ, ટી.બી. વગેરે ઘણા રોગોનું કારણ છે.
 અપ્પત્થભોયણં પિવ - કામ એટલે અપથયનું ભોજન
 બલવીરિયહાણિજણં ચ - બલ-વીર્યની હાનિ કરનાર છે.
 કિંપાકફલં પિવ - કિંપાકફળની જેમ ફક્ત શરૂઆતમાં એ સારું લાગે છે.



અવસાણવિરસમફુચ્છે - છેવટે એ ફિક્ઝુ-તુચ્છ અને પ્રાણ લઈ લેનાર હોય છે.
 વામોહકરં - એ બુદ્ધિને ભ્રષ્ટ કરનારું છે.
 નડનચ્ચિયં વ - એ નાટકિયાના ચાળા જેવું છે.
 ગંધવ્બણયરં વ - વાદળાઓની લીલા જેવું એ અસ્થિર છે.
 સુણગાઇણહીણજંતુસામન્ન - એ કાગડાં-કૂતરાં પણ કરે છે એવી વસ્તુ છે.
 સવ્વાભિસંકણીયં - એ કરનાર બધાંથી ગભરાય છે.
 ધર્મત્થપરત્તવિગ્યકરં - ધર્મ, પૈસો કે પરલોકહિત - એ બધામાં વિધન કરનારું છે.
 આવાયમેત્તસુહલેસસંભવમ્મિ - ફક્ત ઉપલક દાખિએ
 એમાં જરાક સુખ લાગે છે.

એવો કયો વિવેકી -સમજું હોય,
 કે જે મોક્ષના સુખને છોડીને
 ‘કામ’થી પોતાની જાતને પરેશાન કરે ?

મેહુણપસંગસંજણિય પાવપબ્ધારભારિયા સંતા ।
 નિવડંતિ નરા નરએ, જલે જહા લોહમયપિંડો ॥

જેમ લોખંડનો પિંડ પાણીમાં પડી જાય,
 એ રીતે
 મૈથુનથી પાપના પહંડોને ભીતરમાં ભરીને
 મનુષ્યો નરકમાં પડે છે.

‘કામ’ આલોકમાં પણ કેવો ઉત્પાત મચાવે છે.
 એ સમજવા જેવું છે.
 હઠયોગ પ્રદીપિકા કહે છે -
 મરણ બિન્દુપાતેન જીવન બિન્દુરક્ષણાત્ ।
 વીર્યના એક બિંદુનું પતન એટલે મૃત્યુ.
 તે બિન્દુનું રક્ષણ એટલે જીવન.



सिद्धे बिन्दौ महारत्ने, किं न सिध्यति भूतले ।

यस्य प्रसादान्महिमा, ममाप्येतादृशोऽभवत् ॥

बिन्दु ए भृत्यरत्न छे, ए सिद्ध थઈ जाय.

तो पछी धरती पर ऐवुं कशुं ज नथी, जे सिद्ध न थाय,

बिन्दुना प्रसादथी ज मारो पाण (शिवज्ञनो पाण)

आवो भृत्याथ थयो छे.

आलोकनो आधार छे शरीर

अने शरीरनो आधार छे वीर्य.

शरीरमां अभूत्य अने अत्यंत भृत्यपूर्ण धातु छे वीर्य.

रस, रक्त, मांस, भेद, अस्थि अने मज्जा

आ छ धातुनी उत्पत्ति बाढ

शरीरमां सातभी धातु वीर्य उत्पन्न थाय छे.

लोहीना ८० टीपामांथी वीर्यनुं एक टीपुं बने छे.

ज्यारे मानवनुं भन निर्विकार होय छे,

त्यारे आ वीर्य छये धातुमां व्यास होय छे.

ऐटले के आखा शरीरमां व्यास होय छे.

यथा पयसि सर्पिस्तु गुडशेक्षुरसे यथा ।

एवं हि सकले काये शुक्रं तिष्ठति देहिनाम् ॥

जेम दूधमां धी अने ईक्षुरसमां गोण होय छे,

तेम समग्र शरीरमां शुक्र व्यास होय छे.

ते शरीरमां ‘तेज’ तरीके इपांतरित थाय छे.

सुश्रुत ऋषिए कहुं छे -

रसादीनां शुक्रान्तानां धातूनां यत्परं तेजस्तत् खल्वोजस्तदेव बलम्।

रसथी शुक्र सुधीनी धातुओ पछी ज तेज थाय.

ते ओज छे, ते ज बण छे.



મનમાં જ્યારે વિકાર થાય ત્યારે વીર્ય ધાતુ અલગ પડે છે,
એની અધોગતિ થાય છે.

એ મનોવહા નાડીમાં થઈને વૃષણમાં ભેગું થાય છે
અને પછી તેનું સ્ખલન થાય છે.

જેમ ઘી છૂટું પડવાથી દૂધ ખોખલું થઈ જાય છે
તેમ શુક નીકળી જવાથી શરીર ખોખલું થઈ જાય છે.
શરીરની બધી જ નાડીઓ ઢીલી થઈ જાય છે,
શરીરના બધાં જ અવયવોમાં ઉદાસી છવાઈ જાય છે.
તેજ જતું રહેવાથી શરીર નિસ્તેજ બને છે.

નિર્બણ અને નિરુત્સાહી બને છે.

તે વ્યક્તિ ચોક્કસ સમય માટે
પોતાની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ ગુમાવી દે છે.
પુનઃ આ તેજનિર્માણ થાય તે પહેલા ફરી ફરી
આ જ - વિકાર અને સ્ખલનની ઘટનાઓ બને
તેનાથી તે વ્યક્તિ કાયમી ધોરણે 'તેજ'થી,
'શક્તિ'થી અને જીવનના ખરા આનંદથી
સાવ જ વંચિત બને છે.

અજંપો, નબળાઈ, હતાશા એને ઘેરી વળે છે
એ ફરી મૈથુનમાં જ પોતાનું સુખ શોધે છે.
ને પરિણામ એ જ આવે છે જે પહેલા આવ્યું હતું.
બસ, એ વ્યક્તિ કદી પણ આ વિષયકમાંથી બચી શકતી નથી.
એ જીવતા મહાં જેવી હોય છે,
જેમાં શાસ તો છે પણ ચૈતન્યની ઉર્જા નથી.
વિકારી વ્યક્તિ પોતાના અને બીજાના બધાં માટે નકામી હોય છે.
કોઈ રચનાત્મક-સર્જનાત્મક-કલાત્મક કાર્ય કરવું,



ભौતિક કે આધ્યાત્મિક કોઈ પણ સિદ્ધિ પામવી,
શરીર અને મનની

અદ્ભુત શક્તિઓને ખીલવવી એ એના ગજા બહારની વાત હોય છે.
વિકાર એ મહામૂર્ખામ્ભી છે, સ્ખલન એ નર્યો આપદાત છે.
વીર્યનાશ એટલે સર્વનાશ.

હૃદયોગપ્રદીપિકા કહે છે -

ચિત્તાયત્ત નૃણાં શુક્રં, શુક્રાયત્ત ચ જીવિતમ् ।

તસ્માચ્છુક્રં મનશૈવ, રક્ષણીયં પ્રયત્નતः ॥

મનુષ્યોનું શુક્ર (વીર્ય) મનને આધીન હોય છે,
અને જીવન શુક્રને આધીન હોય છે.

માટે શુક્રનું અને મનનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ.
શાંતિથી વિચાર કરીએ તો જ્યાલ આવશે
કે વિકારનો અર્થ આધ્યાત્મિક રીતે તો વિનાશ છે જ,
ભौતિક રીતે પણ વિનાશ છે.

શંકરાનન્દ કહે છે -

અતિસારો યથા નૃણાં, સર્વતેજોऽપહારક: ।

રેતસ્તે નિર્ગમસ્તદ્વદ્દ, બલવીર્યાપહારક: ॥

યથેક્ષુદણ્ડો નિઃસારઃ, પીડિતસ્તદ્વદેવ હિ ।

પુમાન् ભવતિ નિઃસારો રેતસો હિ વિનિર્ગમાત् ॥

જેમ અતિસાર (જાડા) સર્વ તેજને હરી લેતો હોય છે,

તેમ વીર્યનો નિર્ગમ પણ બળ અને વીર્યનું અપહરણ કરતો હોય છે.

જેમ શેરડીના સાંઠાને નિયોવી લેવાથી એ ખોખલો બની જાય છે.

તેમ વીર્ય નીકળી જવાથી પુરુષ ખોખલો બની જાય છે.

અસ્યાવસ્થાનતો પુંસા-મોજો નામાષ્મારી દશા ।

ભવત્યયં યયા જન્તુ-સ્તેજસ્વી સન् હિ જીવતિ ॥



अस्य संस्थापने तृणां, जगा वैरुप्यकारिणी ।

मृत्युश्च न भवेच्छ्रीघ्रं, बलं चेह न नश्यति ॥

सात धातुनी पधीनी दशा छे ओज.

वीर्य स्थिर थाय तो आ दशा आवे,

ऐनाथी ज्ञव तेजस्वीदृपे ज्ञवे छे.

वीर्य स्थिर थाय

ऐटले हालहुवाल करी देनारुं घडपाण अने मृत्यु

जल्दी आवतुं नथी अने तेनुं बण नाश पामतुं नथी.

सायणा कहे छे -

ओजः शरीरस्थितिकारणमष्टमो धातुः ।

ओज ए शरीरना टकवाना कारणदृप आठमो धातुं छे.

हृदयस्थमपि व्यापि तत्परं जीवितास्पदम् ॥ अष्टांगसंग्रह ॥

ओजनी वृद्धि थाय

ऐटले शरीरनी तुष्टि, पुष्टि अने बणनो उद्य थाय छे.

ते हृदयमां होवा छतां देहव्यापी छे.

ज्ञवननो तेना जेवो आधार बीजो कोई ज नथी.

आयुर्वेद कहे छे -

ब्रह्मचर्यरतेग्राम्य-सुखनिःस्पृहचेतसः ।

निद्रा सन्तोषत्रुपस्य, स्वं कालं नातिवर्तते ॥

जेने ध्रष्टव्यर्थमां रति छे,

जेने भैयुनमां कोई ज रस नथी अने ऐ संतोषधी तृम छे,

ऐने निद्रा ऐना सभये आवी ज जाय छे.

(योग्य निद्रा ए आरोग्यनुं भृत्यवनुं कारण छे.)

अष्टांगहृदय कहे छे -

स्मृतिमेधाऽयुरारोग्य-पुष्टीन्द्रिययशोबत्तैः ।

अधिका मन्दजरसो, भवन्ति स्त्रीषु संयताः ॥



સ્વીની બાબતમાં જે સંયમી બની રહે
 તેને સ્મરણશક્તિ, બુદ્ધિશક્તિ, દીર્ઘ આયુષ્ય, આરોગ્યપુષ્ટિ,
 ઈન્ડ્રિયોની સક્ષમતા, યશ અને બળ આ બધાની વિશિષ્ટતા મળે છે,
 એમને ઘડપણ ખૂબ મોંઢું આવે છે.

પાંચ દિવસ સતત શારીરિક શ્રમ કરવાથી
 અને ત્રણ દિવસનો સતત માનસિક શ્રમ કરવાથી
 શરીરની જે ઉર્જા વપરાય છે
 તેટલી ઉર્જા એકવાર વીર્યપાત કરવાથી વપરાઈ જાય છે.
 વીર્યપાત કરનાર માણસ
 ગમે તેટલો ઉત્તમ આહાર ચેહણ કરતો હોય,
 તો પણ તેનું શરીર કમજોર જ રહે છે.
 વીર્યની અંદર એન્ટીઇન્ફ્લેન્દેમેટરી હોર્મોન્સ હોય છે,
 જે શરીરના સાંધારો વગેરેને મજબૂત રાખે છે.
 તેથી વીર્યપાત થવાથી
 શરીરના સાંધા, ખભા, પિંડીઓ વગેરે દુઃખવા લાગે છે.
 આયુર્વેદના મતે ફક્ત ૨૦ મિલીલિટર વીર્યપાત થવાથી
 ૨૭ કિલો આહાર અને ૧.૮૨ લિટર લોહીની ખેંચ અનુભવાય છે.
 આધુનિક વિજ્ઞાનના મતે પણ
 વીર્યપાતથી શરીરના જે પોષક તત્ત્વો નાશ પામે છે,
 તેમની વિગત આ મુજબ છે-

એક વાર વીર્યપાત (૩.૪ મિલી) કરવાથી નાશ પામતા તત્ત્વો :-

પોષક તત્ત્વો	માત્રા (ગ્રામ)
પ્રોટીન	૦.૧૭
જલુકોગ્ન	૩.૪૧
કેલ્વિશયમ	૧.૨૧
લેક્ટીક એસિડ	૨.૧૫



પોષક તત્વો	માત્રા (ગ્રામ)
મેંગ્રેશિયમ	0.39
પોટેશિયમ	3.79
ઈંક	0.46

ડૉ. પી. ટી. હાર્ન એ કહ્યું છે -

વીર્ય જ મનુષ્યનું જીવન છે,
એ બગડી જાય તો લોહીનો નાશ થઈ જાય છે
અને છેવટે અને સુધારવું પણ અશક્ય થઈ જાય છે.

ડૉ. કાઉ (એન.એમ.ડી.) એ કહ્યું છે -

બ્રહ્મચર્યના અભાવે ગુમ રોગો થાય છે
અને આયુષ્ય ઓછું થાય છે.

સર અન્દૂજ કલાર્ક એ કહ્યું છે -

સંયમથી શક્તિ વધે છે, અને જીાનચક્ષુ તેજ થાય છે.
સ્વેચ્છાચારથી મન નખળું થાય છે, અને પ્રમાદ વધે છે.

ડૉ. લુઈસે કહ્યું છે -

શરીરનો સાર વીર્ય છે
અને વીર્યની રક્ષા માટે પ્રત્યેક મનુષ્યે બ્રહ્મચર્ય પાળવું જોઈએ.
વીર્યરક્ષા વિના શરીરની બધી જ શક્તિઓનો નાશ થઈ જાય છે,
અને કોઈ પણ રૂપે તેમનો વિકાસ થઈ શકતો નથી.

ડૉ. નિકોલસ કહે છે -

ચિકિત્સા અને શરીરવિજ્ઞાને આ વાતને
સારી રીતે સિદ્ધ કરી છે કે
મનુષ્યના શરીરની જીવનધારિણી શક્તિ
એના રક્તથી તૈયાર થાય છે, જે મનુષ્યનું જીવન પવિત્ર છે,
જેણે વીર્યની રક્ષા કરી છે,



એના શરીરનું રક્ત શુદ્ધ અને સબલ રહે છે
અને બળવાન વીર્યનું નિર્માણ કરે છે.
જેનાથી એનું માથું પ્રસત્ર રહે છે, માંસપેશીઓ સબલ રહે છે,
અને હદ્ય ઉર્ધ્વથી પ્રકૃતિલિત રહે છે.

માનવશરીરનું વીર્ય ૪
એને સાહસી, તેજસ્વી, બુદ્ધિમાન અને ઉધમી બનાવે છે,
જે મનુષ્યોનું વીર્ય દૂષિત થઈ જાય છે,
તેઓ આ ગુણોથી વંચિત થઈ જાય છે.

વૈજ્ઞાનિક દસ્તિઓ જોઈએ તો
વૃષાળ ગ્રંથિઓમાં બે સાવ ઉત્પત્ત થાય છે.
એક બહિઃસાવ અને બીજો અંતઃસાવ.

વીર્ય ઉત્પત્ત થાય
ત્યારે વૃષાળ ગ્રંથિઓથી શુક્કવાહિની દ્વારા શુકાશયોમાં ભેગું થાય છે
અને મૈથુનપ્રવૃત્તિથી શરીરની બહાર નીકળે છે, આ બહિઃસાવ છે.
અંતઃસાવ કયાંય ભેગો થતો નથી કે શરીરની બહાર નીકળતો નથી.
એ ઉત્પત્ત થાય એટલે લોહીમાં મળીને પૂરા શરીરમાં ફેલાતું રહે છે.
એનું મુખ્ય તત્ત્વ ટેસ્ટોસ્ટેરોન હોય છે.

જે પુરુષોમાં યૌવનના લક્ષણોને વિકસિત કરે છે
અને શરીરમાં બળ, વીર્ય, પૌરુષ અને પરાક્રમ ઉત્પત્ત કરે છે.

યૌવન-અવસ્થા ઉત્પત્ત કરવા સાથે
યૌવનને ટકાવવાની અને

શરીરને પુનર્યૌવન આપવાની શક્તિ પણ આ તત્ત્વમાં હોય છે.
વૃષાળ ગ્રંથિઓમાં બહિઃસાવ અને અંતઃસાવ
ઉત્પત્ત કરનારી કોશિકાઓ (સેલ્સ) જુદા જુદા હોય છે.
તેમનો પરસ્પર સંબંધ એવો છે કે



જો બહિઃસાવની કોશિકાઓ અધિક વર્ધિત અને વિકસિત થઈ જાય
તો અંતઃસાવની કોશિકાઓ ક્ષીણ અને
વ્યપજનિત (Degenerated) થઈ જશે.

અને જો બહિઃસાવની કોશિકાઓ ક્ષીણ થઈ જશે,
તો અંતઃસાવની કોશિકાઓ વધશે અને વિકસિત થશે.
વધારે કામ કરાવવાથી કોશિકાઓ વધે છે,
જેને Overuse hypertrophy કહેવાય છે.

કામ ન કરાવવાથી તે ક્ષીણ થાય છે,

જેને Disuse atropy કહેવાય છે.

મૈથુનનિરત વ્યક્તિની બહિઃસાવની કોશિકાઓનું કામ વધી જાય છે,
પરિણામે તેની અંતઃસાવની કોશિકાઓ ક્ષીણ થાય છે,
અને અંતઃસાવ ઘટે છે.

મૈથુનનિરત વ્યક્તિના વીર્યનો નાશ વધુ થાય છે,
અને તેના શરીરને અંતઃસાવ પણ ઓછો મળે છે.

એટલે કે શરીરની બંને રીતે હુાનિ થાય છે.

આનાથી વિપરીત શુદ્ધ બ્રહ્મચર્યના પાલનથી વીર્યનાશ થતો નથી
અને શરીરને અંતઃસાવ વધારે મળે છે,
તેનાથી શરીરને બંને બાજુ વધારે લાભ થાય છે.

એ વ્યક્તિ ચિરયૌવન, બળવતા અને દીર્ઘ આયુષ્યને પામે છે.

(It has been suggested by steirach that by bying of spermatic cord might promote rejuvenation by causing the acinal cells to degenerate and thus allowing the cells of internal secretion more room to grow.

- Halliburtons Physiology)

ડૉ. લોરેન્ઝો કહે છે -

વીર્યની અંદર ભારે ઉત્પાદક શક્તિ રહેલી છે



અને તે જો કોઈ પણ રીતે શરીરમાં સંચિત કરવામાં આવે
 તો તેનું બળ જીવનના સ્વરૂપમાં પરિવર્તિત થઈ શકે છે.
 તે નવા ગ્રાણીને જન્મ આપવાના બદલે
 પોતાના જ શરીરને નવું જીવન અર્પણ કરે છે.
 આ તત્ત્વ જો નવયુવકોના અંતરમાં વસી જાય
 તો તેઓ અનેક પ્રકારની વિપત્તિઓ અને કષ્ટોની પરંપરાથી બચી જાય.

ડૉ. હેવલોક એલીસ કહે છે -

વીર્યનાશમાં જ્ઞાનતંતુઓનું તાણ થાય છે,
 તેથી જે હાનિ પહોંચે છે તે એટલી તો ભયંકર હોય છે,
 કે તેથી સંભોગ થયા પછી
 અનુભવાતા નુકશાનો તદ્દન સાહજિક લાગે છે.
 પશુઓમાં પણ તેવું જ જોવામાં આવ્યું છે.
 પ્રથમ સંભોગ પછી

- * મોટા ભાગે બળવાન આખલા, ઘોડા અને પાડા બેભાન થઈને
 પડી જાય છે.
 - * સૂવરો સંઝાહીન બની જાય છે.
 - * માઇલીઓ સંતાનોત્પત્તિ પછી અત્યંત ક્ષીણ થઈ જાય છે,
 પછી મરી જાય છે.
 - * ઉંદર, બિસકોલી અને સસલા પ્રજોત્પત્તિ બાદ ક્યારેક મરી
 જાય છે અને ક્યારેક બેભાન થઈ જાય છે.
 - * પક્ષીઓના મધુર ગીતો, પાંખોના સુંદર રંગો અને પગનું
 નાચવું સમાસ થઈ જાય છે.
- મનુષ્યોમાં મરણ તો જોવામાં આવ્યા જ છે,
 સાથે જ અનેક ઉપદ્રવો પણ જોવાયા છે.
 નવયુવકોમાં બેભાની, ફેફસાના રોગ, પગ ઢીલાં પડી જવા,
 બરોળ ફાટી જવી વગેરે ઉપદ્રવો થાય છે.



લોહીના દબાણને ન સહી શકવાના કારણે

કેટલાકની મગજની નાડી ફાટી જાય છે.

કેટલાકને પક્ષધાત પણ થાય છે.

ડૉ. સેર્સ કહે છે -

એક યુવાનને મૈથુન અવસ્થામાં જ બેભાની આવી ગઈ હતી

અને ઉતેજના કાયમ રહેવાથી અંતે તેનું મૃત્યુ થયું હતું.

ડૉ. એન. કેલ કહે છે -

એક પુરુષ વેશ્યાગૃહની બહાર આવતાં જ બેભાન થઈ ગયો હતો.

તેથી તેને દવાખાનામાં લાવવો પડ્યો હતો. ત્યાં તેનું મૃત્યુ થયું હતું.

ડૉ. આરથરકીથ કહે છે -

વીર્ય - શિરાઓની બનાવટ એવી છે કે તે બે પ્રકારના કામ કરે છે -

(૧) વીર્ય ઉત્પન્ન કરવું.

(૨) રુધિરાભિસરણ દ્વારા શરીરના તમામ ભાગોને

એક પ્રકારનો અત્યંત પૌષ્ટિક પદાર્થ પહુંચાડવો.

આ પદાર્થ અત્યંત શક્તિદાયક છે

અને શરીરની વૃદ્ધિને ઉતેજન આપે છે.

જો વીર્યપાત કરવામાં ન આવે

તો આ જ શિરાઓ દ્વારા તેનું શોષણ થઈને

સર્વ અવયવો હષ-પુષ બને છે.

ડૉ. કાઉન કહે છે -

મનુષ્યના તન-મન સાથે નિકટનો સંબંધ રાખનાર

તેમજ તેની જીવનયાત્રા સફળ કરનાર

બ્રહ્મયર્ય વ્રતનું પાલન હોવાથી

પ્રત્યેક મનુષ્યે સદૈવ વીર્યરક્ષા કરવી જોઈએ.

જેઓ વીર્યને મળ-મૂત્રના સ્થાને ગણીને

તેને શરીરમાંથી બહાર કાઢવું જરૂરી માને છે,



તેમને ડો. લીડસ્ટન કહે છે કે -

આજીવન કે અતિ દીર્ઘ કાળ સુધી
પ્રજોત્પત્તિ અવયવને કોઈ પણ પ્રકારની હાનિ સિવાય
ઉપયોગ રહિત રાખી શકાય છે.
આહાર, નિકા કે મળત્યાગ
એ જેમ આરોગ્ય દસ્તિએ આવશ્યક છે,
તેવી રીતે વીર્યસ્થાવ કદી પણ આવશ્ક નથી.
જેવી રીતે ન રોવાથી રૂદ્ધનશક્તિનો નાશ થતો નથી.
તેવી જ રીતે સખ્ત બ્રહ્મચર્ય પાળવાથી
જનનશક્તિનો નાશ કે
શરીરને બીજી કોઈ પણ પ્રકારની હાનિ થતી નથી.
વિષયભોગને મનુષ્ય જીવનના રક્ષણ માટે આવશ્યક માનવો
એના જેવી ગંભીર અને આફ્ટકારક ભ્રમણા નથી.

ડૉ. ટ્રોલ કહે છે -

મનુષ્ય સો વર્ષ જીવે તો પણ
યુવાવસ્થાથી અંતિમ વૃદ્ધાવસ્થા-જીવનના અંત કાળ સુધીમાં
એક વખત પણ આરોગ્ય દસ્તિથી તેણે વીર્યપાત કરવાની જરૂર નથી.
બ્રહ્મચર્ય હુંમેશ લાભદાયક છે.
તેનાથી આરોગ્ય અને સુખની વૃદ્ધિ થાય છે,
તે કદી પણ નુકશાન કે વ્યાધિનું કારણ થતું નથી.

મૌંશ્યોર પોલ બ્યૂરો કહે છે -

વિષયેચછા બુદ્ધિ અને સંકલપશક્તિ એ બનેના અંકુશને આધીન છે,
વિષયેચછા એ વિષયેચછા જ છે,
પણ વિષયની હાજરત તો નથી જ.
કારણ કે એ સંતોષાય નહી તો જીવન ન ચાલે એવું નથી જ.



ડો. બેનીડીકર લુસ્ટ કહે છે -

જેટલા અંશમાં જે મનુષ્ય બ્રહ્મચર્યની રક્ષા વિશેષ કરે છે,
તેટલા અંશમાં તે મનુષ્ય વિશેષ મહુત્વવાળા કાર્યો કરી શકે છે.

સર એન્ડુ કલાર્ક કહે છે -

સંયમથી શક્તિ વધે છે, જ્ઞાનચું તેજ થાય છે,
સ્વેચ્છાચારથી મન નબળું થાય છે,
અધઃપાતનો રસ્તો મોક્ષો થાય છે,
અને પેઢી દર પેઢી સુધી રોગનો વારસો ફેલાય છે.

ડૉ. ડુબોય કહે છે -

માનસિક રોગવાળા ઘણા ખરા
વિષયી જીવન ગાળનારાઓ જ છે, એમ જાગ્યાયું છે.

પ્રો. ફોર્નિયર કહે છે -

બ્રહ્મચર્યથી આરોગ્યને હાનિ થાય છે,
એમ કહેનારાઓએ શરમાવું જોઈએ.
ડોક્ટર તરીકે હું કહું છું કે એ વાતમાં રજમાત્ર વજૂદ નથી.

ઇ.સ. ૧૯૦૨ માં દુનિયાના મોટા મોટા ડોક્ટરોની
અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની એક કોંગ્રેસ મળી હતી.
એમાં એક ઠરાવ આ થયો હતો -

યુવાનોને શીખવવું જોઈએ કે બ્રહ્મચર્ય અને સંયમ હાનિકર્તા નથી.
એટલું જ નહીં પણ

મેડિકલ અને હેલ્થની દાખિએ પરમ આવશ્યક છે.

પ્રોફેસર રામમૂર્તિ સેન્ડો

વેગભર ચાલી જતી મોટરને પોતાના હાથથી અટકાવી શકતા હતા.
લોટાની મજબૂત સાંકળને આંચકો મારીને તોડી દેતા હતા.
પોતાની છાતી પર હાથીને ચાંચાવીને તેનો ભાર સહન કરતા હતા.



માગુસોથી ભરેલી ગાડીઓ પોતાના સાથળો પર ચાલવા દેતા હતાં.
તેમની આટલી બધી ચમત્કારિક ક્ષમતાનો યશ
તેમણે બ્રહ્મચર્યને આપ્યો હતો.

ડો. ગાઈનર કહે છે -

વીર્ય એ લોહીનો સાર છે.
અમાં જીવનદાયિની શક્તિ છે.
વીર્યનો શરીરમાં ઉપયોગ થવાથી
સમગ્ર શરીરમાં સંજીવની શક્તિનો સંચાર થાય છે.

ડો. કોવન કહે છે -

જો કુવિચારો દ્વારા વીર્યને શરીરની બહાર ફેંકી ન દેવાય,
તો તેઓ શરીરમાં જ નવું જીવન ઉત્પદ્ધ કરે છે,
શરીરિક અને માનસિક બળને અદ્ભુત રીતે વધારી હે છે.

ડો. બલોચ કહે છે -

વીર્ય બહાર નીકળવા જેવો પદાર્થ છે,
એવું માનવું એ ભયંકર ભૂલ છે,
વીર્યપાત વખતે થતા આવેશથી જીવનશક્તિ
અને તંતુબળનો ક્ષય થાય છે.
વીર્યમાં જે રાસાયણિક પદાર્થો રહેલા છે,
એમનો ઉપયોગ જીવનના હિતકર કાર્યોમાં કરવો એ જ શ્રેયસ્કર છે.

ડો. બાલક્ષર કહે છે -

માનવશરીરનો સંપૂર્ણ વિકાસ શરીરમાં વીર્યસંયય ઉપર જ નિર્ભર છે.
કોઈ પણ રીતનો વીર્યપાત ન થવા દેવાય
અને વીર્યને શરીરમાં જ શોષી લેવાય તો આંતરિક શક્તિ વધે છે.
અને એ શક્તિથી શરીરનો શ્રેષ્ઠ વિકાસ થાય છે.
ક્ષાળભંગુર સુખ માટે આ અગત્યના પ્રાગુત્તાવનો નાશ કરવો



એના જેવું એકે ય આત્મધાતી કૃત્ય નથી.

ઈરાનના એક પ્રસિદ્ધ હકીમ હતા.

એમણે પચાસ વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્ય પાળ્યું.

પછી લગ્ન કર્યા. એક પુત્ર થયો.

તેમના પત્નીએ કામાસક્રિયાની દીકરાને શીખવાડીને પતિ પાસે મોકલ્યો...

“મને એક ભાઈ હોય તો કેટલું સારું !”

હકીમે કહ્યું, “તને ઉત્પત્ત કરવામાં મારું અડધું બુદ્ધિબળ ખલાસ થઈ ગયું છે, તો પછી તારા ભાઈને ઉત્પત્ત કરવામાં મારી કેટલી બરબાદી થશે, આ તું સમજત તો આવી માંગણી ન કરત.”

ડૉ. ટ્રોલ કહે છે-

અસંખ્ય વ્યાધિઓ અને અકથનીય દુઃખોને આમંત્રણ આપનાર વીર્યનાશ જેવું એકે ય દુષ્કૃત્ય નથી.

દુઃખદાયી ઘડપણ પણ એનાથી જ આવે છે.

વીર્યનાશ કરવો એટલે પોતાની જીવનશક્તિનો તત્કષણ નાશ કરવો.

મીસીસ ડાફી કહે છે -

વીર્યમાં ઘણું જ અગત્યનું પ્રાણદાયક તત્ત્વ રહેલું છે.

મગજને પોષણ આપવા માટે

અને શરીરને કઠણ અને સશક્ત કરવા માટે તે અમોદ શરૂ છે.

બનાઈ મેકફેડન કહે છે -

જનસમાજનો મોટો ભાગ વિષય-વાસનાને આધીન થઈ

વીર્યરૂપી પ્રાણરક્ષક તત્ત્વનો દુરુપયોગ કરતો હોવાથી

તેની કાર્યશક્તિ 30 થી 40 ટકા ઓછી થાય છે.

ડૉ. લેટસન કહે છે -

વીર્યમાં જીવનશક્તિનો આશ્રયકારક સમૂહ રહેલો હોવાથી

તેની રક્ષાથી શરીર ક્ષીણ થતું નથી.



જ્યારે આ તત્ત્વનું શરીરમાં શોષણ થાય છે
ત્યારે જીવનશક્તિમાં વૃદ્ધિ થાય છે,
આરોગ્ય સુધરે છે, આંખો તેજસ્વી થાય છે,
ચાલ સ્થિતિસ્થાપક થાય છે. શરીર યુવાવસ્થાનો દેખાવ હે છે
અને સ્વી તથા પુરુષ વ્યક્તિસ્વાતન્ત્રય મેળવે છે.

ડૉ. કીલોગ કહે છે -

જનનેન્દ્રિય અને પચનેન્દ્રિયનો બગાડ સહભાવી હોય છે,
કારણ કે આ અવયવોનો એક બીજા સાથે નિકટનો સંબંધ છે.
સર્વ રોગોની ઉત્પત્તિ પચનેન્દ્રિયના બગાડથી જ શરૂ થતી હોય છે.
માટે વીર્યનો દુરુપ્યોગ એ સર્વ રોગોનું મૂળ છે.

ડૉ. લોરેન્સને (એમ.ડી.) કહે છે -

વાસનાતૃમિના ક્ષાણભરના આનંદ માટે
ઘણી ભારે અને સ્થાયી શિક્ષા ભોગવવી પડી છે
પોતાના આરોગ્યનું ભંડોળ, શૌર્ય અને
મનુષ્યને જીવનવ્યવહારના કાર્યોમાં વિજય અપાવનાર
જે મૂલ્યવાન પદાર્થ છે તેનો સ્વીસંગથી વ્યય થઈ જાય છે.
અને તેનો જરા પણ બદલો મળતો નથી.
આ સત્ય હકીકત ધ્યાનમાં આવતાં
પોતાના અમૂલ્ય જીવનના ઉત્તમોત્તમ વર્ષો
તેમજ કિંમતી દ્રવ્યનો દુરુપ્યોગ કરતા અનેક મનુષ્યો અવશ્ય અટકશે.

ડૉ. નીકલસન કહે છે -

સ્વીસંગનો ત્યાગ કરવાથી
શારીરિક અને માનસિક શક્તિનો પ્રત્યક્ષ વિકાસ થાય છે.
વીર્યના દુરુપ્યોગથી ઉન્માદ, વાયુઘેલછા અને અંતે મૃત્યુ થાય છે.

ડૉ કાઉઅન કહે છે -

આરોગ્યના જે કાયદાઓ કુદરતે ઘડ્યા છે,



તેમનો જે મનુષ્ય ઉદ્ઘતાઈ ભરેલી બેપરવાઈથી ભંગ કરે છે,
તે દરેક ભંગ માટે કુદરતે અવશ્ય શિક્ષા ફરમાવેલી છે.

ખ્રીસંગ પ્રજોત્પત્તિ માટે જ થવો જોઈએ
એ જ કુદરતનો મુખ્ય કાયદો છે.

તે કાયદાનો ભંગ કરનારને

જેટલી સખત ત્રાસદાયક અને ત્વરિત શિક્ષા ભોગવવી પડે છે,
તેટલી કુદરતના અન્ય કાયદાનો ભંગ કરનારને ભોગવવી પડતી નથી.

ન્યૂટન કહે છે -

શરીરમાં શોષાયેલ વીર્યથી મનુષ્યની બુદ્ધિ તીક્ષણ થાય છે
અને તેના જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ
વિશોષ સુદૃઢ અને બળવાન બને છે.

બ્રહ્મચર્યનું પાલન કરનારાઓમાં રોગો ૧૦% થતા હોય છે.

અબ્રહ્મચર્યારીઓમાં ૪૨% થતા હોય છે.

બ્રહ્મચારીઓમાં ૧૦% શારીરિક નર્બળતાના ભોગ બની શકે છે.

અબ્રહ્મચારીઓ ૬૮% ભોગ બનતા હોય છે.

બ્રહ્મચારીઓમાં ડિપેશાન ૧૦% જ જોવા મળે છે.

અબ્રહ્મચારીઓમાં ૭૦% જોવા મળે છે.

આત્મવિશ્વાસનો અભાવ બ્રહ્મચારીઓમાં ૨૦% જ હોય છે.

અબ્રહ્મચારીઓમાં ૬૦% હોય છે.

બ્રહ્મચારીઓમાં ૨૫% લોકોને કોધ હોય છે,

અબ્રહ્મચારીઓમાં ૭૨% લોકો કોધથી પીડાતા હોય છે.

વીર્યપાત કરવાથી શરીરના હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે,
પરિણામે તે વ્યક્તિ અનેક શારીરિક અને માનસિક રોગોનો
શિકાર બની જાય છે.

કામમાં માણસ બહારથી સુખી પણ લાગતો હોય,



તો ય અંદરથી તો તે ખૂબ જ
 ચિંતા, સ્ટેસ અને ડિપ્રેશનમાં જીવતો હોય છે.
 વીર્ય વિના શરીર મડું છે અને શુદ્ધ પ્રક્રિયા સિવાય
 વીર્યરક્ષાનો બીજો કોઈ જ ઉપાય નથી.
 માટે જ યોગસૂત્રમાં કહું છે -
ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः ।
 પ્રક્રિયાની પ્રતિષ્ઠા થાય એટલે વીર્યલાભ થાય છે.
 વીર્યક્ષયના શારીરિક નુકશાનો
 યોગશાસ્ત્રનાં આ મુજબ કહ્યા છે -
 કમ્પ: સ્વેદ: શ્રમો મૂર્છા, પ્રમિળાનિર્બલક્ષય: ।
 રાજયક્ષમાદિરોગાશ્ર ભવેયુમૈથુનોલિથિતાઃ ॥
 ધ્રુજારી, પરસેવો, શ્રમ, બેભાની, ચક્કર, થાક,
 બળક્ષય અને ટી.બી. વગેરે રોગો મૈથુનથી થાય છે.
 દુનિયા માને છે કે
 જલપ્રદૂષણ, વાયુપ્રદૂષણ અને ભૂપ્રદૂષણથી રોગો થાય છે,
 પણ આના કરતા વધુ મહત્વની વાત એ છે કે
 મનપ્રદૂષણથી રોગો થાય છે.
 કામ, કોધ વગેરે દોષો એ મનપ્રદૂષણ છે.
 કામીનું શરીર સતત તૂટતું હોય છે
 એની રોગપ્રતિકારક શક્તિ સતત ઘટતી હોય છે.
 પ્રક્રિયારી એ જ જલ વગેરેના પ્રદૂષણમાં
 સ્વર્સ્થ અને તંદુરસ્ત રહી શકે છે,
 કામી એ જ વાતાવરણમાં
 દવા, ડેક્ટર ને હોસ્પિટલ સુધીના ચક્કરમાં ફસાઈ જાય છે.
 ચારિત્રને સુધારવાને બદલે
 દવાઓ દ્વારા તબિયત સુધારવાના પ્રયાસો કરવા એ ધર્તિંગ છે.



કોઈ પણ પ્રકારનું મૈથુન

માનસ/ચાક્ષુષ/શાવાણ/વાચિક/શારીરિક

એ એવી તુચ્છ, મૂર્ખાંભી ભરેલી અને ગંઢી યેદ્ધા છે

જેનાથી જીવનરસ સુકાઈ જાય છે, શરીર માયકાંગલું બને છે,

ઇન્દ્રિયો નિસ્તેજ થાય છે, ભગજ નબળું અને નકામું બને છે

અને યૌવન યૌવન તરીકે મટી જાય છે.

ચાણક્યનીતિ કહે છે -

નરાણાં મૈથુનં જરા ।

મૈથુન એ નરોનું ઘડપણ છે.

શુક્ર સૌમ્યં સિતં સ્નિગધં બલપુષ્ટિકરં સ્મૃતમ् ।

ગર્ભબીજં વપુઃસારો જીવનાશ્રય ઉત્તમः ॥

શુક્ર સૌમ્ય છે, શ્વેત છે, સ્નિગધ છે, બળને પુષ્ટ કરનારું છે,
ગર્ભનું બીજ છે, શરીરનો સાર છે અને જીવનનો ઉત્તમ આશ્રય છે.

મૈથુનનો અર્થ છે જાતને સળગાવવી.

મૈથુન એટલે પર્વત પરથી કૂદકો મારવો.

મૈથુન એટલે હળાહળ ઝેર પીવું.

મૈથુન એટલે પોતાના પેટમાં છરી હુલાવવી.

મૈથુન એટલે ફાંસો ખાવો.

જ્યાં સુધી વિવેક ગળી ન જાય ને બુદ્ધિ બ્રાષ ન થઈ જાય
ત્યાં સુધી આ મૂર્ખાંભી થઈ શકતી નથી.

આ બધાં છે કામકૃત દોષો - નુકશાનો.

આરાધનાપતાકા ગ્રંથ સ્વીવૈરાઘ્યનો બીજો ઉપાય કહે છે -

સ્વીકૃત દોષો-નુકશાનોનું ચિંતન.

સોયસરી દુરિયદરી કવડકુડી મહિલિયા કિલેસકી િ ।

વડરવિરોયણઅરણી દુક્ખખણી સુક્ખપદિવકખો ॥



શોકની સરિતા... પાપની ગુફા.... કૃપટની કોટી...
 કલેશનું મૂળ.... વેર-આગની અરણિકાણ... દુઃખની ખાણ....
 સુખનો વિપક્ષ... આ છે સ્વી.
 સ્વીધી સુખી થવા જવું એ ઝેર ખાઈને જીવવા જવા જેવું છે.
 હકીકતમાં એ બંને અશક્ય છે, મૂર્ખામીથી વધુ કાંઈ જ નથી.
 આરાધનાપતાકા ગ્રંથ સ્વીવૈરાગ્યનો ત્રીજો ઉપાય કહે છે -
 શરીરની અશુચિનું ચિંતન.
 દેહસ્ય બીયળિપ્પત્તિ ખિત્તમાહારજમ્મવુહીઓ ।
 અવયવનિગમમસુદું પિચ્છસુ વાહી જરા ચેવ ॥
 શરીર બને છે અશુચિમય શુક-શોળિતથી.
 શરીર વધે છે અશુચિમય એંઠવાડથી.
 શરીર જન્મે છે મહાઅશુચિમય લજજનીય અંગથી.
 શરીર વધે છે બાળપાણની અશુચિમય ચેષ્ટાથી.
 શરીરનું એક એક અંગ સતત અશુચિ છોડે છે.
 એ વળી રોગાવિષ થઈને વધુ ગંદું થાય છે
 એ જ ઘરડું થઈને લાળ પાડે છે
 ખાંસી ખાધા કરે છે બેવડ વળી જાય છે,
 એ પોતાના માટે ય ભાર બની જાય છે.
 શરીરમાં રાગ કરવા જેવું છે જ શું ?

આરાધનાપતાકા ગ્રંથ સ્વીવૈરાગ્યનો ચોથો ઉપાય આપે છે - વૃદ્ધસેવા.
 બે પ્રકારના વૃદ્ધ હોય છે - જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ.
 આ બંને વૃદ્ધોની સેવા સ્વીવૈરાગ્યને પુષ્ટ કરે છે.
 જ્ઞાનવૃદ્ધ કે વયોવૃદ્ધ એ બંનેના સામિદ્યમાં રહેવું,
 એ બંનેને ઉપયોગી થવું, એ બંનેને આધીન રહેવું,
 આનું નામ વૃદ્ધસેવા.



યૌવનનો મહુંશો અર્થ છે અવિવેક.

યુવાનોની સોબત પ્રાયઃ અવિવેકની વૃદ્ધિ કરે છે
નીતિશાસ્ત્રો કહે છે -

ન સા સભા યત્ર ન સન્તિ વૃદ્ધા:

તે સભા નથી જેમાં વૃદ્ધો નથી.

સભ્યતાનો આધાર વૃદ્ધસાન્નિધ્ય છે.

યૌવનમાં માત્ર યુવાઓની સોબત એ જોખમ છે.
લપસણો ઢાળ છે.

હોસ્ટેલો આ વાતનો જીવંત પુરાવો છે.

તમા વુદ્ધસહાવે તરુણે વુદ્ધે ય સુદુ સેવંતા ।

ગુરુકુલમવિ ન મુયંતા તરંતિ બંભવ્યં ધીરા ॥
માટે

વૃદ્ધસ્વભાવના - શાનવૃદ્ધ તરુણોની અને વયોવૃદ્ધોની
જે સારી રીતે સેવા કરે છે,

અને જે ગુરુકુળવાસને છોડતા નથી જ,
તે ધીર પુરુષો બ્રહ્મવતનો પાર પામે છે.

તત્ત્વાર્થભાષ્યમાં પૂ.ઉમાસ્વાતિ મહારાજા કહે છે -

ગુરુકુલવાસો બ્રહ્મચર્યમ् ।

ગુરુકુળવાસ એ જ બ્રહ્મચર્ય છે.

કારણ કે એના વિના બ્રહ્મચર્યનું પાલન અશક્યપ્રાયઃ છે.

આરાધનાપતાકા ગ્રંથ વૈરાઘ્યનો પાંચમો ઉપાય આપે છે -
સંસર્ગદોષોનું ચિંતન.

પુરિસસ્ત્રો અપ્પસત્થો ભાવો તિહિં કારણેહિં સંભવઙ્સ ।

વિરહમ્મિ અંધયારે કુસીલસેવાઇ સયરાહં ॥

ત્રાણ કારણથી પુરુખને અશુભ ભાવ જાગે છે -



(૧) એકાંતથી (૨) અંધકારથી (૩) કુશીલસેવાથી.

એકાંત અને અંધકારમાં કોઈ જોતું નથી -

આ મુદ્દે લજજા નાશ પામે છે

અને લજજાના કારણે કાખુમાં રહેલા દોષો

તે જીવ પર આકમણ કરે છે.

કુશીલ વ્યક્તિનું સાન્નિધ્ય, એનું દર્શન, એના શબ્દોનું શ્રવણ

- આ બધું જ દુરાચારનું શિક્ષાશ છે.

ભોર્ઝિંગ નાગનું સાન્નિધ્ય સારું છે, પણ કુશીલનું સાનું નથી.

જેને કુશીલની સોબત ગમે છે, એનું પતન નિશ્ચિત છે.

એનું પતન જ એને કુશીલસેવનની દુર્બુદ્ધિ જગાડે છે.

બ્રહ્મચારી પુરુષ માટે ખીનો સંગ તો ભયાનક છે જ

કુશીલ પુરુષનો સંગ પણ ભયાનક છે.

ને ખી તો સુશીલ હોય કે કુશીલ,

એ સુશ્રાવિકા કે સુસાધ્વી પણ કેમ ન હોય ?

એનો સંસર્ગ બ્રહ્મચારી માટે મહાભયાનક છે.

મારેઝ ઇક્કસિં ચિય તિવ્વવિસભુયંગવગઘસંસગી ।

ઇત્થીસંસગી પુણ અણંતખુતો ણરં હણેઝ ॥

તીવ્ર ઝેરવાળો સાપ કે વાધ

એમનો સંપર્ક તો ફક્ત એક જ વાર મારે છે,

પણ ખીનો સંસર્ગ તો પુરુષને અનંત વાર મારે છે.

આ છે પાંચ હેતુ - ખીવૈરાયના.

આનાથી ભાવિત થવાય તો

ખીવૈરાય સરળ પણ છે અને સહજ પણ.

નૈષિક બ્રહ્મચર્યનું મૂળ આ જ વૈરાય છે.

વૈદિક પરંપરામાં બ્રહ્મચર્યના ચાર પ્રકાર બતાવ્યા છે.



- (૧) સાવિત્ર બ્રહ્મચર્ય :- જનોઈ લઈને ગાયત્રીનો ઉપદેશ ગ્રહણ કરતી વખતે જે તુ દિવસનું બ્રહ્મચર્ય પળાય તે.
- (૨) પ્રાજ્ઞપત્ય બ્રહ્મચર્ય :- કોઈ પણ ક્રતનું પાલન કરતા વખતે એક વર્ષ સુધી જે બ્રહ્મચર્ય પળાય તે.
- (૩) ભ્રાન્ત બ્રહ્મચર્ય :- વેદાભ્યાસના સમય સુધી જે બ્રહ્મચર્ય પળાય તે.
- (૪) નૈષિક બ્રહ્મચર્ય :- જન્મથી લઈને જીવન સુધી જે બ્રહ્મચર્ય પળાય તે. જ્ઞાનીઓએ બ્રહ્મચર્યનો અપાર મહિમા ગાયો છે.

સત્યે રતાનાં સતતં, દાન્તાનામુદ્ધ્વરીતસામ् ।

બ્રહ્મચર્ય દહેદ્ર રાજન्, સર્વપાપાન્યુપાસીતમ् ॥ - મહાભારત
રાજન् ! જેઓ સત્યમાં રત છે, દાન્ત છે, ઉધ્વરિતા છે,
તેમની બ્રહ્મચર્યની ઉપાસના સર્વ પાપોને બાળી નાંખે છે.

ન તપસ્તપ ઇત્યાહૃબ્રહ્મચર્ય તપોત્તમમ् ।

ઊર્ધ્વરીતા ભવેદ્ યસ્તુ, સ દેવો ન તુ માનુષः ॥
તપ એ તપ નથી (બ્રહ્મહીન તપ એ હુકીકતમાં તપ નથી,)
પણ બ્રહ્મચર્ય એ તપ છે. એ જ શ્રેષ્ઠ તપ છે.
જે ઉદ્ધર્વવીર્ય હોય, તે દેવ છે, મનુષ્ય નથી.

બ્રતેષુ વै બ્રહ્મચર્યમ् ॥ - અર્થર્વવેદ ।

બ્રહ્મચર્ય એ શ્રેષ્ઠ વ્રત છે.

તવેસુ વા ઉત્તમ બંભચેરં ॥ - સૂત્રકૃતાંગ સૂત્ર ।

વિશુદ્ધ બ્રહ્મચર્ય એ શ્રેષ્ઠ તપ છે.

બ્રહ્મચર્ય પરં બલમ् ॥

શ્રેષ્ઠ બળ છે બ્રહ્મચર્ય.

ન બ્રહ્મચર્યાત् પરમસ્તિ પાવનં, ન બ્રહ્મચર્યાત् પરમસ્તિ મહ્લગલમ् ।

ન બ્રહ્મચર્યાત् પરમસ્તિ દૈવતં, ન બ્રહ્મચર્યાત् પરમસ્તિ વાજ્ઞિતમ् ॥



બ્રહ્મચર્યથી શ્રેષ્ઠ પવિત્ર કશું જ નથી.

બ્રહ્મચર્યથી શ્રેષ્ઠ મંગળ કશું જ નથી.

બ્રહ્મચર્યથી શ્રેષ્ઠ દેવતા બીજા કોઈ જ નથી.

બ્રહ્મચર્યથી શ્રેષ્ઠ બીજું કોઈ વાંछિત જ નથી.

તદેવ શુક્ર તદ્દ બ્રહ્મ, તદેવામૃતમુચ્યતે ।

તસ્મિંલોકા: સ્થિતા: સર્વે, તદુ નાત્યેતિ કશ્ચન ॥ - કઠોપનિષદ् ।

તે જ શુક્ર છે, તે જ બ્રહ્મ છે, તે જ અમૃત છે,

આલોક - પરલોકનું સુખ એને જ આધીન છે.

એનાથી ચિદિયાતું બીજું કશું જ નથી.

યદિદં બ્રહ્મણો રૂપં, બ્રહ્મચર્યમિતિ સ્મૃતમ् ।

પરં તત્ત્વર્વધર્મેભ્ય-સ્તેન યાન્તિ પરાં ગતિમ् । - મહાભારત ।

બ્રહ્મનું જે સ્વરૂપ છે તે જ બ્રહ્મચર્ય છે.

સર્વ ધર્મોથી તે ચિદિયાતું છે અને તેનાથી પરમ ગતિ પામે છે.

ધર્મ લભેત દાનેન, મौનેનાજ્ઞાં વિશાંયતે ।

ઉપભોગાંશ્ચ તપસા, બ્રહ્મચર્યેણ જીવિતમ् ॥ - મહાભારત ।

રાજન् ! દાનથી ધન મળે છે, મૌનથી આદેયતા મળે છે,
તપથી ઉપભોગો મળે છે અને બ્રહ્મચર્યથી જીવન મળે છે.

એકતશ્શતુરો વેદા બ્રહ્મચર્ય તથૈકત: ॥ - જિનધર્મવિવેક ।

એક બાજુ છે ચારે વેદો ને

એક બાજુ છે ફક્ત બ્રહ્મચર્ય.

એકમેવ વ્રતં શ્લાઘ્યં, બ્રહ્મચર્ય જગત્ત્રયે ।

યદ્વિશુદ્ધિ સમાપનાઃ, પૂજ્યન્તે પૂજિતૈરપિ ॥ - જ્ઞાનાર્ણવ ।

ત્રણે જગતમાં એક બ્રહ્મચર્યવ્રત જ પ્રશંસનીય છે.

જેની વિશુદ્ધિને પામેલા પૂજિત દ્વારા પણ પૂજાય છે.



धर्म्य यशस्यमायुष्यं, लोकद्वयरसायनम् ।
 अनुमोदामहे ब्रह्म-चर्यमेकान्तनिर्मलम् ॥ - आरांगसंग्रह ।
 ब्रह्मचर्य धर्मप्रद छે, यशोवर्धक छે,
 दीर्घ आयुष्यकारक छે, ઈહलोક અને પરलોકમાં રસાયણ છે,
 એકાન્તે પવિત્ર છે, માટે અમે તેની અનુમોદના કરીએ છીએ,
 આયુસ્તેજો બલં વીર્ય, પ્રજ્ઞા ધીશ્વ મહાયશः ।

पुण्यं च मत्प्रियत्वं च, प्राप्यते ब्रह्मचर्यया ॥ - वृद्धगौतम स्मृति ।
 आयुष्य, तेज, बण, वीर्य, प्रश्ना, भुद्धि, भक्षण यश, पुण्य
 अने भारा प्रियपाणु आ बधुं ज ब्रह्मचर्यर्थी भणे छे.
 ब्रह्म ब्रह्मचारिभिरुदक्रामत् । तं पुरं प्रणयामि वः ।
 तामाविशत तां प्रविशत । सा वः शर्म च वर्म च यच्छतु ॥
 - अर्थर्ववेद ॥

બ્રહ્મચારીઓથી જ જ્ઞાનની ઉત્કાન્તિ થાય છે.
 એ જ્ઞાનની નગરીમાં હું આપને લઈ જાઉં છું.
 એમાં પ્રવેશ કરો. એ જ્ઞાનની નગરી જ તમને સુખ
 અને સંરક્ષણ આપે.
 ‘ભગવતી આરાધના’ વ્યાખ્યા દ્વારા જ બ્રહ્મચર્યનો મહિમા ગાય છે.
 જીવો બંભો જીવમિ ચેવ ચરિયા હવિજ જા જદિણો ।
 ત જાણ બંભચેરં વિમુક્તપરદેહતિત્તિસ્સ ॥
 બ્રહ્મ એટલે જીવ.

મુનિની જે જીવમાં જ ચર્ચા થાય, તે પ્રભાયર્થ છે.
તે મુનિને પરદેહની કોઈ જ પંચાત રહેતી નથી.

બ્રહ્મરક્ષાના પ્રયોગાત્મક ઉપાયો :-

- 1) મરચું, રાઈ, ગરમ મસાલા, અથાણું, ફરસાણા, ઉષણ-ઉત્તેજક વસ્તુઓ કે વધુ સાકરવાળી વસ્તુઓ ન ખાવી.





- ૨) ભોજન ખૂબ ચાવીને લેવું, સાંદું ભોજન જ લેવું.
- ૩) મળ-મૂત્રના વેગને કદી રોકવો નહીં, જોર કરીને મળ-મૂત્ર કરવા નહીં. (સહજ રીતે ન થતાં હોય, તો જોર ન કરવું.)
- ૪) કબજિયાત ન રહે તેવો પ્રયાસ કરવો.
- ૫) પચાસન, વીરાસન વગેરે યોગાસનો કરવા. (અમુક આસનો આગળ બતાવેલા છે.)
- ૬) સતત શુભ યોગોમાં વ્યસ્ત રહેવું.
- ૭) વૃદ્ધાદિની વૈયાવચ્ચમાં વિશેષથી ઉઘમશીલ થવું.
- ૮) પ્રભુ સમક્ષ ભાવથી સ્તુતિ, સ્તવન ભક્તિગીતો બોલવા. મન-વચન-કાયાની પૂર્ણ પવિત્રતા આપવા માટે પ્રભુને અંતરથી વિનંતિ કરવી.
- ૯) યથાશક્તિ તપ + ત્યાગ કરવો.
- ૧૦) મોડા ન સૂવું, વહેલા સૂઈ વહેલા ઉઠવું.
- ૧૧) કોઝી, કોકો, અતિ ખાટા, અતિ તીખા, અતિ કડવા, વાસી પઢાર્થો, બજારું ખાવાનું વગેરે ન ખાવું. દૂધ, મલાઈ, પનીર અને લૂણનો ઉપયોગ બની શકે તેટલો ઓછો કરવો.
- ૧૨) ઉઘ પૂરી થાય એટલે તરત પથારી છોડી દેવી.
- ૧૩) સાંસારિક બાબતોમાં સ્નેહરાગથી પાણ ભાવુક ન થવું. આવી ભાવુકતા બ્રહ્મપાલનમાં બાધક છે.
- ૧૪) ચા એ વીર્યને પાતળું કરે છે, અને વીર્યક્ષયનું કારણ બને છે, માટે એનો ત્યાગ કરવો.
- ૧૫) સતત બીજાની દર્શિમાં રહેવું, જાહેરમાં રહેવું, સાવ એકાંત કે એકાંદ વ્યક્તિ સાથેનું એકાંત - તેનો ત્યાગ કરવો.
- ૧૬) સ્માર્ટ ફોન સંદર્ભ ન વાપરવો. ધંધા વગેરેના ન છૂટકાના કામ માટે સ્કીન વગરના ફોનથી પતાવવું. ગમે તેટલું ધંધાકીય નુકશાન થઈ શકે તેમ હોય તો ય સ્માર્ટ ફોન તો હરગીજ ન રાખવો.
- ૧૭) ઘેર છાપું, મેગેજીન વગેરે ન આવવા દેવું.



- ૧૮) ટી.વી., કોમ્પ્યુટર, સી.ડી. પ્લેયર વગેરે ઘરમાંથી કોઈ પણ ભોગે રવાના કરવું.
- ૧૯) લાંબો સમય બહારગામ ન રહેવું, કોઈના ઘરે જતા પહેલા તે ઘરે એકલી સ્ત્રી (સ્ત્રી પક્ષે એકલો પુરુષ) જ નથી ને એની તપાસ કરીને જવું. જો તેવી સ્થિતિ હોય તો તે ઘરમાં હરળીજ પ્રવેશ ન કરવો.
- ૨૦) ધાર્મિક, સંસ્કારી મિત્રોની જ સોબત રાખવી, કુશીલ મિત્ર સાથેના સંબંધને બિલકુલ આગળ વધારવો નહીં.

ધ્રિષ્ટાસન :-

(૧) શીર્ષાસન : ઉંઘા માથે ઊભા રહેવું, તે શીર્ષાસન છે. જમીન પર ખૂબ પોચું નરમ આસન રાખીને એના પર માથું રાખવું. બંને બાજુથી માથાની પાછળથી બંને હાથે માથાને પકડવું અને પગને સીધા કરીને શરીરને દીવાલની સાથે સમસૂત્રમાં કરી લેવું. પછી પગને ઉપર કરીને ફરી પગને સીધા ઉપર જ લઈ જાઓ. અમુક અભ્યાસ થયા બાદ આ આસન કરવા માટે દીવાલની જરૂર નહીં રહે. પ્રથમ આરેંભમાં આ આસન બે-ત્રણ ક્ષાળ માટે કરી શકાય. ૨-૩ મહિનાના અભ્યાસથી આ આસનમાં અડધો કલાક સુધી રહી શકાય છે. આ આસનના ઘણા લાભો છે. પણ વીર્યનો પ્રવાહ ઉપરી દિશામાં થાય છે એ આનો મુખ્ય લાભ છે. આને કરવાથી કાંઈ હાનિ નથી, અને લાભ બહુ જ છે. ઇ મહિના સુધી રોજ અડધો કલાક આ આસન કરવાથી વીર્ય સ્થિર થવાનો અનુભવ થાય છે.




(૨) સિદ્ધાસન : ડાબા પગની એડીને ગુઢા અને લિંગની વચ્ચે



દૃઢતાપૂર્વક લગાડવી અને જમાણા પગાની એડીને
લિંગની ઉપરના ભાગમાં દૃઢતાપૂર્વક લગાડવી,
હડપચીને કંઈમૂળથી થોડા દૂર હદ્ય પર લગાડવી,
શરીરને સ્થિર અને સીધું કરવું. પલકો અને
આંખોને ન હલાવવી, દણિને બંને ભ્રમરની વચ્ચે
સ્થિર કરવી. આનાથી કામવાસના ઘટે છે.
વીર્યવિકાર દૂર થાય છે. વીર્ય સ્થિર થાય છે.
આ આસનના બીજા પણ ઘણા લાભો છે.




(3) પાદાંગુજાસન : પગાની એડીને ગુદા
અને લિંગ વચ્ચે રાખીને એના પર જ આખા
શરીરનો ભાર આપીને બેસવું. બીજો પગ ઢીંચાણ
પર રાખવો. એક હાથથી દીવાલ વગેરેનો ટેકો
લઈ શકાય છે. ગુદા અને લિંગ વચ્ચે ચાર આંગળી
જેટલું સ્થાન છે. એમાં જ વીર્યનાડીઓ છે. એમના
પર એડીનું દબાણ આવવાથી વીર્યનો બહુર પ્રવાહ
થતો નથી.



(4) અંદ્રિમૂલાસન : પગાની એડીને ગુદા અને લિંગની વચ્ચે રાખીને
આ એડી પર જ બેસવું. બીજા પગાની એડીને બીજી જાંધના મૂળમાં લગાડીને
એ જાંધ સાથે એ પગાને લગાડો. અંડકોશને એક બાજુ કરીને બંને પગોને
એવી રીતે જમાવો કે એમના સંધિસ્થાનના હડકાં એક બીજા પર આવી
જાય. એવો નિશ્ચય કરી લો કે એડી પર જ બેસવું છે. છતાં શરૂઆતમાં
કપડાં વગેરેનો ટેકો ગોઠવી શકાય છે. આ આસન જમાવીને ગુદા, લિંગ
અને ત્યાંની બધી નસોને મનની આકર્ષણશક્તિથી ઉપર ખેંચવાનો પ્રયાસ
કરવો એનાથી વીર્યનો પ્રવાહ ઉપર તરફ થશે અને જેમ જેમ અભ્યાસ
વધતો જશે, તેમ તેમ ઉદ્વર્તિતા બનવાની સિદ્ધિ મળશે. આ સમયે શાસ
ધીમે ધીમે પણ પૂર્ણપણે અંદર લેવો અને થોડી જ વાર સ્થિર કરીને ફરી
ધીમે ધીમે બહુર છોડવો. તથા થોડી વાર બહાર જ સ્થિર રાખવો.



(૫) જાનુ શિરાસન : એક પગની એડીને ગુદા અને લિંગ વચ્ચે જમાવીને બીજા પગને સીધો આગળ રાખવો. એ સીધા પગની જાંધ પર પહેલા પગના તળિયાનું દબાણ હોવું જોએ. બંને



હાથોથી તે સીધા પગને પકડીને એ જ પગના ઢીંચાણ પર માથું અથવા નાક લગાવીને બેસવું. (આસન ર થી પ બહેનોએ ન કરવું)

ભ્રણયર્થક ગ્રાણાયામ :-

(૧) માથું, ગળું અને ઘડને એક રેખામાં રાખીને પદ્માસન/સિદ્ધાસન/શવાસન કરવું. કોઈ પણ પ્રકારના વ્યાપારાદિથી સંબંધિત ચિંતન ન કરવું. આંખો બંધ કરવી, ઉંડો શાસ લઈને ફેફસાને વાયુથી પૂર્ણપણે ભરવાં, શાસ રોકી રાખો. (કુંભક કરવો) જે સમયે શાસ રોક્યો હોય, એ સમય ગુદા અને લિંગની નાડીઓને ખેંચીને ઉપર લાવવી (= મૂલબંધ કરવો) સાથે જ પેઢુને પણ ઉપર અને પાછળ જેટલું લઈ જઈ શકાય એટલું લઈ જવું. (= ઉદ્દીયાન બંધ કરવો) પછી ભાવપૂર્વક નમસ્કાર મંત્રનો જાપ કરવો. એવી ભાવના કરવી કે મારું વીર્ય સંચિત થવા માટે ઉપર ચડી રહ્યું છે. રોકેલા શાસને એકદમ ધીમે ધીમે બહાર છોડવો. આ કિયા અડધા કલાક સુધી કરી શકાય છે. દિવસમાં અનેક વાર કરી શકાય છે.

આ ગ્રાણાયામથી સાધક ઉદ્વરિતા થઈ શકે છે. વીર્ય અના મગજ સુધી ચડીને શરીરમાં સંગ્રહીત થાય છે. ૨૧-૨૨માં ફેલાય છે. અને અંતે એ શરીરમાં જ સમાઈ જાય છે. સ્વખનદોષ બંધ થઈ જાય છે. સાધકને આનાથી આરોગ્ય, ઉત્સાહ અને જીવનશક્તિ ગ્રામ થાય છે.

(૨) સિદ્ધાસનમાં બેસીને શાસને પૂર્ણપણે બહાર કાઢવો (= સેચન કરવું) પછી શાસ બહાર રોકી રાખવો. (= બાહ્ય કુંભક કરવું.) આ સ્થિતિમાં સંકલ્પ કરવો - “મારું વીર્ય લોહી સાથે મળીને આખા શરીરમાં સંચાર કરી રહ્યું છે. મારા વીર્યની ગતિ ઉપર તરફ થઈ રહી છે.” આ સંકલ્પ ખૂબ જ એકાગ્રતાથી કરવો. પછી પૂરક કરવું, પૂરકની સ્થિતિમાં મૂલબંધ



કરવો. ગુદાને ઉપરની તરફ ખેંચવી. સાથે જ જાલંધરબંધ કરવો = હડપચીને કંઠકૂપ પર દઢતાથી રાખવી. પછી પેટને સંકોચ્યોને ફુલાવવું. જેટલી વાર સરળતાથી કરી શકાય એટલી વાર કરવું. પછી ધીમે ધીમે રેચન કરવું. આ એક પ્રાણાયામ થયો, આ જ પ્રકારનો અભ્યાસ સાત કે નવ વાર સુધી વધારવો.

(૩) પીડના બળે સૂવું. મસ્તક, ગરદન, છાતીને એક રેખામાં રાખવું. શરીરને એકદમ ઢીલું કરી દેવું. મોહું બંધ કરીને પૂરક કરવું. પૂરકની સ્થિતિમાં એવી દઠ ભાવના કરવી કે ‘વીર્યનો પ્રવાહ જનનેન્દ્રિયથી વળીને મસ્તક તરફ જઈ રહ્યો છે.’ મનની આંખે જોવું, કે વીર્ય લોહી સાથે ઉપર જઈ રહ્યું છે. લિંગ પાસેની નાડીઓ હલકી થઈ રહી છે. અને મસ્તકની નાડીઓ ભારે થઈ રહી છે. આ રીતે પૂરક કર્યા પછી અન્તઃકુંભક કરવું = શાસને સુખપૂર્વક અંદર રોકી રાખવો. પછી ધીમે ધીમે રેચક કરવો. પૂરક અને રેચકનો સમય સમાન હોવો જોઈએ. અને કુંભકનો સમય એનાથી અડધો હોવો જોઈએ. આ એક કિયા થઈ. એને વધારતા વધારતા ૧૫/૨૦ વાર સુધી પહુંચવું. વીર્યના ઉદ્વર્કિર્ણણનો સંકલ્પ જેટલો દઠ અને સ્પષ્ટ હશે એટલી કામવાસના વધુ ક્ષય પામશે.



બ્રહ્મચર્યપાલનના વિવિધમુખ ઉપાય :-

વર્ધમાનતપોનિધિ પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિજી મહારાજ
(‘બ્રહ્મચર્યના તેજ લિસોટા’-માંથી સાભાર)

બ્રહ્મચર્ય એ આત્માનો શ્રેષ્ઠ ગુણ છે. કેમકે આત્માના વિનય-અહિસા ક્ષમાદિ ગુણો કે સાધુ યા શ્રાવકના વ્રતો, એ બધું શીલગુણ હોવા પર જ સાર્થક બને છે. કિંમતવાળા બને છે, નહિતર અશીલ-કુશીલ પર એ ડાંગરના કુસકા-ફોતરાની જેમ અસાર બને છે.

વાચક ઉદ્યરત્ન મહારાજ કહે છે -



સાધુ અને શ્રાવકતણાં વ્રત છે સુખદાયી રે,
 શીલ વિના વ્રત જાણાજો કુસકા સમ ભાઈ રે,
 મૂલ વિના તરુવર જેહવા, ગુણ વિના લાલ કમાન રે,
 શીલ વિના વ્રત એહવા, ભાખે શ્રી વર્ધમાન રે,
 શીલ સમો વ્રત કો નહિ.

જમીનમાંથી મૂળ કપાઈ ગયા પછી શ્રેષ્ઠ પણ ઝાડ જેમ ખલાસ થઈ જાય છે. એમ શીલ બંગાઈ પછી વ્રતો, મહાવતો એ ખલાસ સમજવાના. ‘ગુણ દોરી’ લાલ કમાન સારું વળી શકે એવું ધનુષ્ય. ધનુષ્યને વાળીને ઉપર ગાંધવાની જે દોરી, એ દોરી વિના જેમ ધનુષ્યની કિંમત નહિ, એમ શીલ વિના વ્રતોની કશી કિંમત નહિ. શીલ એ વ્રતોનો પ્રકાશક છે, શીલ વિના વ્રતો છતાં અંધારું. એટલા માટે કહ્યું -

‘એ વ્રત જગમાં દીવો મેરે ખારે, એ વ્રત જગમાં દીવો.’

અખ્રાત્મ સેવીને જે ગદ્યગદ્તા ઝાણઝાણાટી કામપાત્રની યાદમાં-દર્શનમાં અનુભવાય છે, એવી પ્રભુ ને ગુરુની યાદ યા દર્શનમાં નહિ. આ બતાવે છે કે બ્રહ્મચર્ય એ જ પ્રભુ સાથે ખરેખરું મિલન કરાવી શકે; બ્રહ્મચર્યનું મહત્ત્વ કેવું કે સાધુને કોઈકવાર પ્રસંગ-વિશેષમાં અહિંસા સત્યવ્રતનો બંગ થતા સાધુતા હજી ઊભી રહે, પરંતુ બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થતાં સાધુતા ખલાસ થાય છે. બ્રહ્મચર્યની આવી શ્રેષ્ઠતા બહુમૂલ્યતાને લીધે છે. કહેવાય છે કે ચુવાનીમાં કામદેવને જીતવો મહા ફુષ્કર છે. બ્રહ્મચર્યની અતિમૂલ્યતા અતિ નાજુકતાને લીધે જ એની રક્ષા માટે એક બે નહિ, પણ નવ નવ વાડ જ્ઞાનીઓએ પાળવાની કહી છે. આવા શ્રેષ્ઠ ગુણ બ્રહ્મચર્યના નિર્મળ પાલન માટે ઉપાય શો ?

પરંતુ આજે કેટલાયાદ છે કે ‘આ બધું અમે સમજુએ છીએ, આનો વિચાર કરીએ છીએ ત્યાં બ્રહ્મચર્ય પાળવા નબળા છીએ.’ એટલે જ બ્રહ્મચર્ય પાળવાના સચ્યોટ ઉપાય માટે એ તલસે છે.

અલબત્ત ખ્રી-શરીરની અશુદ્ધતા મળપૂર્ણતા વિચાર અને પાપ પ્રેરકતા વિચારતાં મન અખ્રાત્મથી પાછું હટે. એમ વિષયસંશ્લાના સેવનથી પોખાતી જાલિમ



વાસનાને સંસ્કારો ભવોભવ સુધી પીડે છે. વળી વિષય-સેવન એ નરક-તિર્યંગ ગતિના કારમા કુઃખ લઈ આવે છે. એનો એટલે કે વિષયસંજ્ઞાથી તીબ્દી થતી પરલોકમાં પાપિષ્ઠતા ને કુઃખમયતા, આ બેનો વિચાર અધ્રક્ષ પર ઘૃણા લાવી એનાં સેવનથી પાછા હુટાવીને બ્રહ્મચર્ય પાલનનું બળ આપે છે. એમ સ્વીજાત કુટિલ હોય છે, દોષ ભરપૂર હોય છે, તેમ દેવ-ગુરુને ભુલાવનાર હોય છે, એ વિચારે પુરુષને સ્વીસંગથી પાછો હુટાવે છે, એમ સ્વીને પુરુષજગતની કઠોરતા અભિમાનિતા અને સ્વી ઉપર પુરુષથી બજાવાતું વર્યસ્વ ને જોહુકમિતા આ બધાનો વિચાર સ્વીને પુરુષસંગથી પાછી હુટાવે. આમ બ્રહ્મચર્ય પાલનના આ ઉપાય છે.

આવા બ્રહ્મચર્યના ખપી જીવો માટે આ ઉપાય છે કે બ્રહ્મચર્યનો નિષેધપણે નહિ પણ વિધિપણે વિચાર કરો. બ્રહ્મચર્યનો વિધિપણે વિચાર કરવા સ્વીજાતને બિલકુલ મનમાં ન લાવો, પરંતુ બ્રહ્મચર્યનો મૂળભૂત અર્થ વિચારો અને એને આ આત્મસાત્ કરવાના ઉપાય યોજો. તે આ રીતે કરાય -

બ્રહ્મચર્ય એટલે ‘બ્રહ્મ’ કહેતાં શુદ્ધ આત્મા, રાગાદિ દોષથી તદ્દન રહિત, શુદ્ધ જ્ઞાન દર્શનમય, શુદ્ધ વીર્યમય આત્મા, એમાં રમણાત્મા કરવી, ચરવું, વિચરવું, એ બ્રહ્મચર્ય. એ માટે આ વિચારવું કે ‘હું એટલે કે શરીરમાં કેદ પુરાયેલ આત્મા અસલી સ્વરૂપમાં રાગાદિથી તદ્દન અસ્પષ્ટ, શુદ્ધજ્ઞાન સ્વભાવવાળો છું.’ ને આંખ મીંચીને આ વારંવાર વિચારતા રહેવું, કે રાગ-દ્રેષ, મોહ, મત્તસર વગેરે મારો સ્વભાવ નથી, મારા ગુણકૃપ નથી કિન્તુ એ મારા આત્માના વિકારો છે, રોગો છે, દા.ત. ખરજવું થયું હોય તો એની ખાણજમાં ભલે આનંદ લાગે. પરંતુ એ ખરેખર તો રોગ છે, વિકાર છે. એમ કામવાસનાનું ઉતેજન એ રોગ છે. એટલે જેમ દવા ઉપચારથી ખરજવું મટી જાય, હવે ખાણજ બિલકુલ ઉઠે જ નહિ, તો એટલા અંશો શરીર નિરોગી-નિર્વિકાર બન્યું, એમ રાગદ્રેષાદિની જેમ કામવિકળતાએ આત્માનો રોગ છે, વિકાર છે, એ મટે તો આત્મા નિરોગી નિર્વિકાર બન્યો, પછી જે જ્ઞાન કરાય તે શુદ્ધજ્ઞાન કહેવાય. એ જ આત્માનો શુદ્ધ સ્વભાવ એનો અનુભવ કરવો એનું નામ બ્રહ્મચર્ય. આ શુદ્ધ સ્વભાવાનુભવ કોઈ



આટલું વિચારવા માત્રથી ઉભો નહિ થાય; એ માટે તો પરમાત્માનું બહુભુવાર આંતરદર્શન કરવું જોઈએ.

આંતરદર્શન એ રીતે કરવાનું કે આંખ મીંચીને આંતર નજરની સામે નિર્વિકાર ભગવાન લાવી, એમને નીરખ્યા કરવાના. એમાં પણ ભગવાનની ચક્ષુ અને કીકી પર નજર સ્થિર કરી, એ તાકી તાકીને જોવાની. ત્યાં કોઈ રાગ-દ્વેષ કામ-કોધાદિ વિકાર નથી, રોગ નથી. પ્રભુ એવા વીતરાગ, વીતદ્વેષ, વીતમોહ છે, શાંત છે. પ્રશાંત છે, ઉપશાંત છે. પ્રભુના અનંતજ્ઞાનમાં રૂપાળી અપ્સરાઓ-ઈંદ્રાણીઓ ને રંગરાગ ખેલતા જ્વો દેખાઈ રહ્યા છે. પરંતુ પ્રભુને એની કશી અસર નથી, કોઈ વિકાર નથી, કોઈ આકર્ષણ કોઈ આસક્તિ નથી.

આખું દર્શન સ્પષ્ટ થવા લાગે, પછી અનેક ભગવાન યાવત્ત અનંત ભગવાન અને એમના નિર્વિકાર ચક્ષુ જોવાના. એ અનંત ભગવાનની કીકીમાં નિર્વિકારતા પ્રશાંતતા જોયા જ કરીએ, જોયા જ કરીએ.

પછી તો લોગસ્સ સૂત્રનો ઉપયોગ કરવાનો. એમાં આંખ અર્ધીમીંચી પડલની આરપાર કદ્યનાથી નજર સામે ૨૪ ભગવાન જોવાનાં. એ પણ લોગસ્સ સૂત્રની રજી, ઉજી, ૪થી ગાથામાં લીટીવાર આવતા ભગવાનના નામના કમ પ્રમાણે જોવાના. દા.ત. ૨જી ગાથામાં ભગવાનના નામ બોલતા જઈએ અને નજર તે તે ભગવાનના ચક્ષુ નિર્વિકાર જોતા જઈએ. એટલું ધ્યાનમાં રહે કે ૧લી ગાથામાં ‘ચઉવીસંપિ’માં ‘પિ’ એટલે પણ, અર્થ છે, તો ૨૪ પણ અર્થાત્ ‘બીજા અનંત ભગવાનની સાથે આ ૨૪ પણ’ એ અર્થ હોવાથી ૧લી ગાથા ‘લોગસ્સ...’ વખતે અનંત ભગવાનને સમવસરણ પર જોવાના. પછી રજી ગાથા વખતે એમાં ૨૪ ભગવાનના સમવસરણ જુદા આપણી નજર સામે તરવરે, ને રજી, ઉજી, ૪થી ગાથામાં કમસર ૨૪ ભગવાનને સમવસરણ પર જોતા હોઈએ એમાંય આપણી નજર ખાસ તે તે પ્રભુની ચક્ષુ પર રહે.

એવા અનંતા ભગવાનની નિર્વિકાર ચક્ષુ પર દૃષ્ટિ ઠેરવવા સાથે પ્રાર્થના

૧	૨
૩	૪
૬	૭
૮	



કરવાની ‘પ્રભુ આપની ચક્ષુમાંથી બ્રહ્મતેજ મને મળો.’ આ પ્રાર્થના સાથે કલ્પના કરવાની, અનંત પ્રભુના ચક્ષુમાંથી બ્રહ્મતેજની શીતલ અનંત કિરણ-જ્યોત નીકળીને આપણા શરીર પર પડી રહી છે, તે આપણને એ ઠંડાગાર કરી રહી છે, આ કલ્પના સાથે પ્રભુના ચક્ષુ જોયા કરવાનાં.

આ શાંતતાનો અનુભવ કરતાં ધ્યાન રાખવાનું કે મન સ્વી-તત્ત્વથી તદ્દન અલિમ રહે અને પૂર્વે અનુભવેલ સુંવાળા સ્પર્શનાં સંવેદન-સ્મરણ પણ શાંત થઈ ગયા હોય. બસ, આ વિધિમુખ ઉપાયનો વારંવાર અભ્યાસ બ્રહ્મચર્યનું બળ આપે છે.

બ્રહ્મચર્યના પાલન માટે વિધિમુખ ઉપાય આ, કે તીર્થકર ભગવાનનાં નિર્વિકાર ચક્ષુ નિહાળના અને ‘અમાંથી બ્રહ્મતેજ નીકળી રહ્યું છે’ એ કલ્પી અને આપણા શરીર પર પડતું અને આપણને ઠંડાગાર કરતું જોવું, જેથી વાસનાની આગ શાંત પડતી જાય. આ ‘લોગસ્સ’ સૂત્રનો આધાર લઈને કરાય. તે આ રીતે -

‘લોગસ્સ’ સૂત્રની રજી, ઉજી, રજી ગાથાથી નજર સામે વર્તમાન ચોવીસીના ર૪ તીર્થકર ભગવાન આવે, અને ૧લી - પભી ગાથાની ‘પિ’ શબ્દથી બીજા અનંતા તીર્થકર ભગવાન નજર સામે આવે. અમના ચક્ષુમાંથી બ્રહ્મતેજ આપણા પર પડતું જોવાનું, એ જોતી વખતે પ્રભુનું ‘બ્રહ્મચર્ય’ એટલે કે ‘આત્માના શુદ્ધ સ્વભાવમાં પર્યાયોની રમણતા’ એવી જોવાની કે પ્રભુના અનંત જ્ઞાનમાં મોહમૂઢ જીવોની વિષયલીલા-ઈંડ્રાળી-અપ્સરાનાં મનોહર રૂપ, રત્ને જડ્યા દેવતાઈ વિમાન વગેરે સુખ-સામગ્રી ભગવાનની નજર સામે છે છતાં પ્રભુને એની સામે ‘નરો વા કુંજરો વા’ છે, અર્થાત્ કશી નિસ્બત નથી. પ્રભુ પોતે પોતાના આત્માના નિર્વિકાર શુદ્ધ સ્વરૂપમાં મસ્ત છે.

વારંવાર આપણે અનંત પ્રભુની ચક્ષુમાં આ રાગાદિ વિકાર રહિત સ્વરૂપ-રમણતા જોયા કરવાથી અને એના બ્રહ્મતેજ જીવ્યા કરવાથી આપણા આત્મામાં એના સંસ્કાર ઉભા થાય છે અને આત્મા ઠંડોગાર બનવાનો, બન્યા રહેવાનો અનુભવ થાય છે. જેમ જેમ એ નિર્વિકારતાનું દર્શન થતું જાય તેમ તેમ એના સુસંસ્કાર વધતા જાય. બ્રહ્મતેજનો અનુભવ વધતો જાય.



આ અનુભવમાં વાસના વિકાર રહિત શાંત-શીતળતા અનુભવવામાં એવું સાચું સુખ માનવાનું કે એની સામે ચામડાની રમતનું સુખ તુચ્છ લાગી જાય, મનને વિષય સુખ પરદેશી માલ Foreign matter લાગે, જીવની સાથે સંગત જ ન લાગે. બ્રહ્મતેજની સુખ-શાંતિ એટલી બધી આત્મસાત્ બની જાય.

આમાં કદાચ મોહનીયકર્મના જોરે ક્યારેક વાસના-વિષયરાગ ઊઠવા જાય, ત્યારે બ્રહ્મતેજ અનુભવતા પૃથ્વીચંદ્ર રાજકુમારના, આઠ પત્નીઓને બોધ પમાડનાર, આ શબ્દ યાદ કરી લેવાના -

‘વિષયસુખ સુરલોકમાં, ભોગવિયાં ઓણે જીવ,
તો પણ તૂમ જ નવિ થયો, કાળ અસંખ્ય અતીવ.’

અર્થાત્ ‘જીવે દેવલોકે વિષયસુખ એકેક ભવમાં અસંખ્ય વાર એવું અનંતા દેવભવોમાં અનુભવ્યું છતાં જીવ ધરાયો જ નહિ તો એવા વિષયસુખમાં શો માલ છે ? કુછ નહિ.’

આ વિચાર કરવાથી વાસના શરીરી જાય છે, ખાણાજ બેસી જાય છે. વિષયનું આકર્ષણ જ મરી પરવારે છે. વાત પણ સાચી છે કે દા.ત. પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ ટેસદાર વાલ-વટાણાનું શાક ખાઈ ખાઈને જાડા થયા કરતા હોય, ને ત્યાં કોઈ વૈઘના કહેવાથી ભય લાગી જાય કે ‘આમ ને આમ કરતાં તો પેટ ને અંતરડાં સાવ ખલાસ થઈ જશે.’ શક્તિહીન થઈ જશે ! હલકા ભાત કે પ્રવાહી પણ નહીં પચે ! ને શરીર રોગિષ્ટ ને દુબણું પડી જશે, એ સહન નહિ થાય ! આવો ભય લાગી જાય તો એને એવા તરફ નફરત થઈ જાય છે. એ નિર્ધાર કરી લે છે કે ‘ઘરે ગયા આવા વાલ-વટાણાનાં ખતરનાક સુખ. મારે એ ન જોઈએ. એના વિના મારે તો પ્રકૃતિને અનુકૂળ સાદું ભોજન જ સારું છે.’ એમ પછી એને વાલ-વટાણા વિનાના સાદા ભોજનની સ્વસ્થતાનો અનેરો આનંદ લાગ્યા કરે છે.

એ જ પ્રમાણે અનંતા કાળની વિષય રમતનાં કટુ ફળ અને જીવની વિષય-ગુલામી તથા કર્મગુલામી હજી સુધી તદ્વસ્થ ઊભેલી જોઈ વિષયો



પર ને વિષયરમત પર નફરત ધૂટી, પરમાત્માની નિર્વિકાર પરમ સુખદ અવસ્�ા અને બ્રહ્મતેજનાં આકર્ષણ ઊભા થાય. પરમાત્માના નિર્વિકાર ચક્ષુનાં આંતરદર્શન કર્યા કરાય. એમનાં બ્રહ્મતેજ આપણા પર જીલાય, તો સહેજે બ્રહ્મચર્યનું આકર્ષણ અને બળ વધે.

બ્રહ્મચર્યનો વિધિમુખ બીજો ઉપાય :-

આવો વિધિમુખ બીજો ઉપાય છે કે મનને શાસ્ત્રોના પદાર્થોમાં જ રમતું રાખવાનું. કેમકે અનુભવીઓ કહે છે તેમ ‘કામ ! જાનામિ તે મૂલં સંકલ્પાત્ કિલ જાયસે ! ન ચાહં તે કરિષ્યામિ ન વાપિ ત્વं ભવિષ્યસિ ।’ અર્થાત્ હે કામ ! હું તારું મૂળ ઉત્પત્તિસ્થાન જાણું છું કે તું વિચારમાંથી ઉદ્ભબે છે. તો હું કામવાસનાનો વિચાર જ નહિ કરું એટલે તું પણ જન્મી જ નહિ શકે ! આમ કહીને આ બતાવ્યું કે વાસના વિકાર મનમાંથી, મનના વિચારમાંથી ઉઠે છે. પેલી ક્રી રૂપાળી’ એટલો માત્ર એના રૂપનો વિચાર કરતા એના અંગનો વિચાર કરવા જતાં કામરાગ ભભૂકે છે. જો આવા કોઈ વિચાર જ ન કરવામાં આવે, તો કામરાગ ન ભભૂકે.

આ ઉપરથી સ્પષ્ટ છે કે મનને એવા વિચારોમાં ન જવા દેવું જોઈએ પણ નવરું મન ત્યાં ગયા વિના રહે નહિ. તેથી મનને એક ક્ષાળ પણ નવરું ન પડવા દેવા માટે એને શાસ્ત્ર પદાર્થોના પવિત્ર વિચારણામાં રમતું રાખવું જોઈએ.

(૧) આ માટે તત્ત્વાર્થસૂત્ર, જીવવિચાર, નવતત્ત્વ, દંડ, ત્રાણ ભાષ્ય, કર્મગ્રંથ વગેરે શાસ્ત્રોના પદાર્થ શીખતા રહેવું, ને એની નોંધ કરતા રહેવું, તેમજ રોજ ને રોજ બધી નોંધ પહેલા પાનાથી વાંચતા રહેવું. એમ કરતાં કરતાં પાસે પદાર્થોનો મનમાં સ્ટોક ભેગો થાય. એને ક્રમસર વિચારતા રહેવું; એટલે મન એમાં ને એમાં પરોવાયેલું રહે.

(૨) આ ન ફાવે તો મહાન સંત-સતીઓનાં ચારિત્ર વાંચવાના, પણ એવી રીતે કે એની સરંગ કથા ચારિત્રમાં વાર્ણવ્યા પ્રમાણો એકેક પાત્રની વિસ્તૃત વિગત ધ્યાનમાં લેવાય અને પછી એમ ને એમ જ્યારે ચારિત્ર યાદ કરીએ ત્યારે ચારિત્રે રજૂ કરેલ વિસ્તારથી ચારિત્ર પ્રસંગો વિચારાય. આમ



કરવાથી મન એમાં જ લાગ્યું રહે. તેથી બીજા ત્રીજા વિચાર જ ન આવે, એટલે વાસના વિકારના વિચાર પણ ન આવે.

(૩) અથવા એક ઉપાય એ પણ છે કે પૂર્વ પુરુષોનાં સતવનો સજ્જાયો ખૂબ પ્રમાણમાં કંઈસ્થ થઈ શકે તો તે કરીને પછી એનું વારંવાર રટાણ મનમાં ચાલ્યા કરે. એ કંઈસ્થ કરવાની શક્તિ ન હોય તો એના પદાર્થ નોંધી લઈ એને વારંવાર વાંચતા રહી કંઈસ્થ જેવા કરાય. જેથી પછી એ પદાર્થ કમસર મનમાં ચાલાયા કરાય.

(૪) અથવા તીર્થકર ભગવાનના આટ પ્રાતિહાર્ય કમસર એકેક મનની સામે લાવી આબેહુબ જેવા જોવાય, તે પણ એક પ્રાતિહાર્ય જોયા પછી બીજા પ્રાતિહાર્યને જોતા એને પહેલા બે પ્રાતિહાર્ય જોવાનો... એ રીતે આઠેય પ્રાતિહાર્ય એક સાથે નજરમાં આવે એવીરીતે મનથી જોવાના, એનો અભ્યાસ થયા પછી નવરા મનને એમાં જોડાય.

(૫) યા, સકલાઈંત સ્તોત્રમાંના ચોવીસે ભગવાનના શલોકના પદાર્થને ચિત્રાત્મક તૈયાર કરાય. એક પછી એક દરેક ચિત્રને પછીના ચિત્ર સાથે શો સંબંધ તે નક્કી કરી ચિત્રો વચ્ચે કરી જોડાય. આમ કરીબદ્ધ ચોવીસ ભગવાનનાં ચિત્ર મનમાં ગોઠવી લઈ, પછી એની કરીબદ્ધ વિચારણાં ચાલે, ને અરિહંત ભગવાનની જુદી જુદી મુદ્રા અવસ્થાની હારમાળા નજર સામે આવ્યા કરે, એટલે મન એમાં જ પરોવાયેલું રહે; ને તે પણ પરમ સાત્ત્વિક પદાર્થોમાં, એટલે મનમાં બીજા ત્રીજા કે વાસના વિકારના કોઈ વિચાર ન જાગે, ને એમ બ્રહ્મચર્યને બળ મળે.

બ્રહ્મચર્ય માટેના કેટલાક ચિંતનો ને ઉપાયો :-

બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ યાને શુદ્ધ આત્મામાં ચર્ચા = રમણતા એ વ્યુત્પત્તિર્થ છે. રૂઢર્થ છે અબ્રહ્મત્યાગ - મૈથુનત્યાગ (૧) બ્રહ્મચર્ય એ સર્વ વ્રતોમાં શિરદાર છે, દીવો છે. સરદાર વિનાનું લશ્કર હારી જાય. દીવા વિનાના વ્રતો અંધકારમાં રહે. ‘શીલ સમો વ્રત કો નહિ.’ મોક્ષાર્થી જીવને આ જંખના હોય છે કે મારા જીવનમાં કેમ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન આવે; કેમકે એના લાભ અનેરા છે. (૨) બ્રહ્મચર્યથી વીર્ય રક્ષા થાય છે. જે



જીવનના અંત સુધી રોગોનો સામનો કરે છે. (૩) બ્રહ્મચર્યથી સત્ત્વ ખૂબ જ વિકસે છે, જે આધ્યાત્મિક પરાક્રમોમાં સારું સહાયક બને છે. (૪) બ્રહ્મચર્યથી મગજશક્તિ વધે છે, જે ઠેઠ ઘડપણ સુધી સ્મરણ શક્તિને સતેજ રાખે છે. (૫) બ્રહ્મચર્યથી ઈષ્ટસિદ્ધિ થાય છે.

આ ‘ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિ-નીતિં મનાગપિ મનો ન વિકારમાર્ગમ्’

શ્રી ભક્તામર સ્તોત્રના આ શ્લોકથી આત્માને નિરંતર ભાવિત કરવો, વાસિત કરવો, દિલને એના ભાવથી રંગાપેલું કરવું. એનો અર્થ આ છે કે ‘હે વીતરાગ અરિહંત પ્રભુ ! એમાં શું આશ્રય છે કે દેવાંગનાથી પણ તમારું મન જરાય વિકારમાર્ગે ન ગયું. શું કલ્પાંત કાલના પવનથી મેરુ ચલાયમાન થાય ?’ આ ચિંતવતાં આપણી નજર સામે વિચરતા તીર્થકર ભગવાનને જોવાના અને એમની સામે લોટબંધ અપ્સરાઓ ટસીને જોઈ રહી છે. પરંતુ ભગવાન ઉદાસીન છે. એમને એના પર એક નજર પણ નાખવાની પડી નથી. અરે ! એટલું જ શું ? પરંતુ ભગવાનના કેવળજ્ઞાનમાં અસંખ્ય દેવાંગનાઓ, અરે ! મોટી હંદ્રાણીઓ સ્પષ્ટ દેખાય છે, છતાં પ્રભુને એમના પ્રત્યે કશું આકર્ષણી નથી, કશો રાગ નથી. એમના ગણિતમાં એના દિવ્યરૂપની કશી મહત્ત્વ જ નથી. બસ, આવા નિર્વિકાર પ્રભુની નિર્વિકારતાથી આપણા આત્માને ભાવિત કરવાનો; એટલે કે આપણે એ નિર્વિકારતાનો અંશે પણ સ્વાનુભવ કરતા રહેવાનું. તેથી બ્રહ્મચર્ય માટે બળ મળે.

(૨) કોશા વેશ્યાને ત્યાં ચોમાસું રહેલા શ્રી સ્થૂલભદ્રસ્વામીને ધ્યાનસ્થ ચક્ષુ રાખીને બેઠેલા જોવાના. સામે વેશ્યા નૃત્ય-હાવભાવ કરી રહી છે, છતાં એમની આંખ પોણી ઉપર મીંચેલી તે વેશ્યાનું કશું જોવા આતુર જ નથી - એ જોવાનું. એટલી બધી દૃઢ મક્કમતાથી એ અરિહંતનું સ્વરૂપ-જીવન-સાધના-ઉપકાર અને અતિશયો તથા પંચપરમેષ્ઠીનું સ્વરૂપ વગેરેનું ચિંતન અને ધ્યાન કરતા બેઠા છે, એ જોવાનું; તેમજ ‘નમોનમઃ શ્રી સ્થૂલભદ્ર સ્વામીને’નો જાપ ઉછળતા હૈયાથી કરવાનો. એથી આપણી સુષુપ્ત વાસનાનો ક્ષય થતો આવે છે. એથી બ્રહ્મચર્ય સારું પાળી શકાય.



(3) આપણા શરીરમાં ખ્રટ્યક ધારવાના છે. ઠેઠ નીચે પુંક પાસે (૧) મૂલાધારચક. એના પર સીવનીમાં (૨) સ્વાધિષ્ઠાનચક. એથી ઉપર નાભિમાં (૩) મહિષપુરચક. એથી ઉપર હદ્યમાં (૪) અનાહતચક. એના પર કંઠસ્થાને (૫) વિશુદ્ધિચક. અને એના ઉપર ભૂરુ-મધ્યમાં (૬) આજ્ઞાચક. એની ઉપર મસ્તકના સૌથી ઊંચા મધ્યભાગમાં બ્રહ્મરન્ધ છે, ત્યાં સહસ્રદલ પદ્મમાં શૂન્યચક છે.

હવે આપણે ઠેઠ નીચેના મૂલાધાર ચકમાં, આકાશમાં જેમ અમાસરાત્રે વીજળીનો ઝબૂંકો પ્રગટીને પ્રશરે તેમ, એક જ્યોતિ પ્રગટતી જોવાની; અને એ જ્યોતને ઉપર ઉપરના ચકમાં ક્રમશઃ લંબાતી જોવાની, તે ઠેઠ ઊંચે બ્રહ્મ સુધી વ્યાપેલી જોવાની. આ રીતે આપણું મન આ ખ્રટ્યકમાં ફેલાતી જ્યોતિમાં મન પરોવાયાથી, વિકાર શાંત થાય છે; અને એ જ્યોતિના દીર્ઘ નિરીક્ષાણથી મન શાંત અને શીતલ બને, એનો બ્રહ્મચર્યનો પાવર વધે છે. તે એવો કે આસપાસના રાગમય વાતાવરણની અને કોઈ અસર નથી થતી. ત્યાં

(૪) લલાટમાં આજ્ઞાચકમાં જ્યોતિર્મય ‘ॐ દ્રોં અર્હ’ અક્ષરો ધારવાના, તે પછી એ જોયા જ કરવાના. અરિહુંતનો આ ‘ॐ દ્રોં અર્હ નમः’ મૃત્યુંજ્ય મંત્ર ખૂબ જ પાવરકુલ છે. અનું અહીં સંભેદ પ્રગિધાન થાય છે. એ માત્ર બ્રહ્મચર્ય જ નહિં, પણ બીજી કેટલીય સાત્ત્વિક સિદ્ધિઓ પ્રગટ કરે છે.

(૫) જેવું અરિહુંતદેવના આ ધ્યાનનું અચિંત્ય સામર્થ્ય છે એવું ગુરુના ધ્યાનનું પણ જબરદસ્ત સામર્થ્ય છે. માટે હદ્યકળણ પર કરુણાભર્યા ત્યાગી ગુરુ મહારાજને સ્થાપિત કરી એમની સામે જોતાં.....

“ધ્યાનમૂલં ગુરોર્મૂર્તિઃ, પૂજામૂલં ગુરો: પક્ષમ ।

મંત્રમૂલં ગુરોર્વાક્યં, મોક્ષમૂલં ગુરો: કૃપા ॥”

એ શલોક રટાં ‘ॐ નમો ગુરુભ્યઃ’ જપવું. સ્થાપિત ગુરુની તાકાત એકલાય ભીલમાં જોવા મળે છે. ગણધર શ્રી ગૌતમ સ્વામીજી મહારાજના દિલમાં ગુરુ વીર વિભુનું કેવુંક ધ્યાન રહ્યા કરતું હશે ? - એ વિચારથી આ ગુરુધ્યાન હદ્યવેધી અને ગદ્ગાદ બને. ત્યાગી ગુરુના ધ્યાનથી વાસના મરે.



(૬) વિષય-વિરાગ અને સ્વી અંગેની અશુદ્ધિ ભાવનાના ખૂબ પરિશીલન (અભ્યાસ)થી કામ-કીડા પર સૂગ ઉભી થાય; કેમકે એ ગદ્ધા-ગદ્ધી, કૂતરા-કૂતરીની પશુક્રિયા લાગે. એવી સૂગથી વાસના વિકારો શાંત થતા આવે; એટલે બ્રહ્મચર્ય પાળવાની સરળતા અને મક્કમતા ઉભી થાય. આમાં વિષય-વિરાગનું પરિશીલન કરવા માટે અર્થાત્ વૈરાગ્યનો હૃદયસ્પર્શી અભ્યાસ કરવા માટે દુન્યવી સારા સારા રૂપ, સ્પર્શ, શબ્દ વગેરે વિષયો પ્રત્યે મનમાં ભયની લાગણી, ધૃષ્ણા-સૂગ નફરત કર્યા કરવી. પૂછો સારા પ્રત્યે સૂગ શી રીતે જાગે ? કહો, એમાં કાતિલ જેર દેખવાથી સૂગ જાગે. જેમ દૂધપાકમાં જેર પડ્યાની જાણ થતાં એ દૂધપાક પ્રત્યે સૂગ થાય જ છે ને ? માત્ર સૂગ જ નહિ, પણ એનાથી ભય લાગે છે, કે ‘હાય બાપ ! જો ખાધો તો તો મર્યા જ સમજો !’

બસ, જો તીર્થકર ભગવાનના વચન પર જબ્બર શ્રદ્ધા હોય, તો આ દુન્યવી વિષયો અને એમાંય ખાસ કરીને સ્વી-વિષયમાં હુળાહળ જેરથી ય મહાભયંકર જેર દેખાય. બ્રહ્મચર્યમાં એ જેરથી બચવાનું મળે, એ બચી ગયાનો અતિશય આનંદ હોય. વિષયો મહાભયંકર એટલા માટે કે અનેક દુઃખ દુર્ગતિના જન્મોમાં પારાવાર દુઃખ, ત્રાસ અને વિટંબાળ વેઠવાનું લાવે છે. દીર્ઘદિને દેખાતા આ ભયંકર દુઃખોની અટકાયત પર વારે વારે ધ્યાન જવાથી બ્રહ્મચર્ય ખૂબ હોંશથી ઉછરંગથી અને અતિશય પાવર સાથે પળાય.

આ તો પરલોકની દિનિએ જેરની વાત થઈ; પરંતુ આ લોકની દિનિએ પણ એની ભયાનકતા એ દેખાય, કે સ્વી-વિષયમાંનું જેર સ્વી કે સ્વીનું એક અંગ પણ નજરમાં આવે ત્યાં જ એનું જેર આપણી સત્યેતનાને નાશ કરે છે. એટલે માનો કે ભગવાનની મૂર્તિ દર્શન-પૂજન-સમરણમાં મનમાં લાવ્યા હોઈએ, એની એ મનમાં પેઠેલ સ્ત્રીઅંગ તરત જ હકાલપણી કરે છે. મનમાં સ્વીગાત્રનો રાગ ખડો કરી દે છે. ત્યારે ‘આવા અતિ અતિ દુર્લભ વીતરાગ અરિહૃત ભગવાન આપણને અહીં મળ્યા છતાં જો એવો સ્વી-વિષય મનમાં પેસવા માત્રથી તારણહાર દેવાધિદેવની મગજમાંથી હકાલપણી કરતો હોય, તો આપણે એવી તે શી ભાંગ ખાધી છે કે એનાથી



ગાંડા થઈ સ્વીને મનમાં લાવીએ ? અને ભગવાનને મનમાંથી હંકી કાઢીએ ? સ્વીને વિચારવાનો એ આનંદ જહુમમાં ગયો.’ આમ વિચારીને બ્રહ્મચર્યને મન-વચન-કાયાથી બરાબર પકડી રખાય.

(૭) ‘લય’ યોગથી અર્થાત् ચિત્તને આત્માના શુદ્ધ અરૂપી નિર્વિકાર અને અનંત જ્ઞાનમય સ્વરૂપમાં લીન રાખવાથી ચિત્તમાં અબ્રહ્મનો વિચાર જ ન ઉઠે એ સહજ છે. આ માટે અંતરમાં પહેલાં રંગ વિનાના સ્ફટિક જેવા ઉજજવલ આત્માને શુદ્ધ જ્ઞાન-પ્રકાશમય જોવા પ્રયત્ન કરવાનો. એવો પ્રયત્ન સતત ચાલે એથી, એક જાતનું એવું સંસ્કરણ ઉલ્લું થાય છે કે ચિત્તને માત્ર જ્યોતિમય આત્મા જ દેખાય છે. એની રંગતમાં પછી ત્યાં સ્વીના કે બીજા જડ વિષયના વિચાર જ સ્ફુરતા નથી. આમ બ્રહ્મચર્ય સરળ અને સહજ જેવું બને છે.

(૮) બ્રહ્મચર્યના પાલન માટે પ્રભુને રોજ આ પ્રાર્થના કરતા રહેવાનું છે.

અનાદ્યાભ્યાસયોગેન વિષયાશુચિકર્દમે ।

ગર્તે શૂકરસઙ્કાશં યાતિ મે ચટુલં મન: ॥

ન ચાહં નાથ ! શક્નોમિ તં નિવારયિતું ચલમ્ ।

અત: પ્રસીદ તહેવ દેવ ! વારય વારય ॥

‘હે નાથ ! અનાદ્યના અભ્યાસના લીધે ભૂંડના જેવું મારું ચ્યપળ મન વિષયરૂપી વિષાના કીચડભર્યા ખાડામાં દોડી જય છે, અને હું તે ચંચળ મનને નિવારી શકતો નથી. માટે હે દેવાધિદેવ ! મારા પર મહેર કરીને તેને જરૂર જરૂર અટકાવી દો.’’

પૂછો, શું પ્રાર્થનાથી સિદ્ધિ થાય ? હા, ‘લલિત-વિસ્તરા’ શાસ્ત્ર કહે છે કે ‘પ્રાર્થનાત: એવ ઇષ્ટસિદ્ધિ: ।’ પ્રાર્થનાથી જ ઈષ સિદ્ધિ થાય છે. વીતરાગ પ્રભુને દિલથી એની પ્રાર્થના એક મહાન ઉપાય છે. ભગવાનને આ પ્રાર્થના કરીયે કે ‘પ્રભુ ! તારા અચિન્ય પ્રભાવથી અચિન્ય સિદ્ધિઓ નીપછે છે. તો મને બ્રહ્મચર્યની સિદ્ધિ જરૂર નીપજશે એવી મને તારા અચિન્ય પ્રભાવ પર શ્રદ્ધા છે.’ આ રોજ ને રોજ કરતી પ્રાર્થનાની અજબ તાકાતથી બ્રહ્મચર્ય સુલભ થાય છે. એજ રીતે પૂર્વના શાલિભદ્ર ધનાજી જેવા



મહાભોગીઓ ક્ષાળવારમાં મહાત્યાગી અને મહાબ્રહ્મચારી બની ગયા. પ્રાર્થનાથી સાધવાનું કશું અશક્ય નથી.

(૯) બ્રહ્મચર્યના પાલન માટે અનિત્યાદિની ભાવનાઓથી મનને ભાવિત કરવાનો છે. ‘જગતમાં આત્માને મળતા બાધ સંયોગો અને આભ્યંતર સંયોગો બધા જ અંતે નાશવંત છે, બધા જ અનિત્ય છે.’ - આ ભાવનાથી આત્માને ભાવિત કરવાનો છે. જેમ પાણીનો પરપોટો અનિત્ય છે, આ અનિત્યતાના જ્ઞાનથી આત્મા ભાવિત છે તો મોટો સુંદર પરપોટો જોઈને આત્મા ખીલતો નથી, ને પરપોટો ફૂટી ગયે આત્મા કરમાઈ જતો નથી, બિન્દ થતો નથી. એવી રીતે બધા જ બાધ અપ્રશસ્ત સંયોગોના આજવવા જવામાં જીવે ખીલવા-કરમાવા જેવું કશું નથી એમ મનને ફિક્સ-સચોટ બેસી ગયું હોય તેથી એના પ્રત્યે મન ઉદાસીન ભાવમાં રહે. પછી મોટી અપ્સરાના સંયોગને ય ‘કૂછ નહિ’ લેખતો રહે. એમ જડ પુદ્ગાલ માત્ર પ્રત્યેની ઉદાસીનતા કામવાસનાને અટકાવે. એવી રીતે અશરાણ-ભાવના, સંસાર-ભાવના... વગેરેથી મન ભાવિત કરવામાં આવે, એથી પણ બ્રહ્મચર્યમાં સ્થિરતા લવાય.

(૧૦) બ્રહ્મચર્ય માટે એક ચિંતન એ છે કે માનવની પાસે મન-મગજ સૌથી ઊંચા ભાગે મસ્તકમાં હોય છે, અને ઈન્દ્રિયો એનાથી નીચેના ભાગમાં છે. આ પાંચે ઈન્દ્રિયોના ભાગો અને ઉપર મગજ એ રૂમો છે, કંપાઈમેન્ટો છે. ‘એમાં મારે એના એના વિષયોને નથી ઘાલવા, અને મારે તો માત્ર ઉપરના ઉમદા મગજના કંપાઈમેન્ટમાં ઉમદા આધ્યાત્મિક વિષયો જ ઘાલવા છે.’ આ દફ નિર્ધાર કરાય. દા.ત. મગજમાં તીર્થકર પ્રભુનાં અને પૃથ્વીચંદ્ર-ગુણસાગર-સ્થૂલભક્રસ્વામીનાં ચરિત્ર મમરાવવા છે. એ વિવેક કર્યા પછી આ નિર્ધાર પ્રમાણે કરતા રહેવાથી બ્રહ્મચર્યની ભાવના મજબૂત થતી જાય.

પશુ કરતાં મનુષ્યની આ એક વિશેષતા છે. પશુને મગજ ઈન્દ્રિયોની લગતના સમલેવલમાં હોય છે, ત્યારે મનુષ્યને મગજ સૌથી ઊંચા સ્થાને હોય છે. આનું તાત્પર્ય એ છે કે પશુને મોટા ભાગે મગજ ઈન્દ્રિયોની સાથોસાથ ચાલે છે. ત્યારે મનુષ્યને મગજને ઈન્દ્રિયોની સાથોસાથ ચાલવવા ઉપરાંત ઈન્દ્રિયોના વિષયોને નીચા-આધા રાખી, એની ઉપરના પદાર્થોનો



વિચાર કરી શકે છે. એટલે કે પરમાત્મા-જિનશાસન-જિનવચન-શાસ્ત્રો-સમ્યગ્દર્શન-દશવિધ યત્તિ ધર્મ-નવતત્ત્વ... વગેરે એવા ઘણાનો વિચાર કરી શકે છે કે જે પાંચ ઈન્દ્રિયોના ગજ બહારના પદાર્થ છે. બસ, આપણી પાંચ ઈન્દ્રિયોઝ્પી રૂમો શબ્દ-રૂપ-રસ વગેરેને ભાડે આપીએ છીએ, ઈન્દ્રિયોમાં એમને ઘાલીએ છીએ. એના બદલે આપણું મનરૂપી રૂમ જ એ પરમાત્માદિ પદર્થોને જ ભાડે આપવાનું અને એનો કારભાર ચલાવવાનો, પછી સહજ છે કે સ્ત્રી-વિષયને આંખ-સ્પર્શનેન્દ્રિય વગેરે રૂમ ભાડે આપવાની જ નહિ, અને મન તો એ જિનવચનાદિને ભાડે આપેલું છે, તે એનો કારભાર ચાલ્યા કરે. પછી ત્યાં સ્ત્રીને દાખલ કરાતી નથી.

(૧૧) બ્રહ્મચર્ય-પાલન માટે આ એક મહાન ઉપયોગી ચિંતન છે કે ‘જીવ ! વાસનાવશ જે અબ્રહ્મનો વિષય ભોગવવા તું તણાય છે, એવા વિષય તો તેં અનંતીવાર ભોગવ્યા, છતાં એની તૃસિ નથી થઈ, પણ અતૃસિની આગ સળગતી રહી છે. એ આજની તારી વાસનામય ભુખારવી સ્થિતિ કહી રહી છે. તો હવે પાછો તારો એ ભોગવવાનો અભરખો અને ભોગવટો એ અતૃસિની આગ વધારનારો થશે. શા સારુ હે પામર જીવ ! તું તારી જાતે જ એ આગ વધારે ? સમજુ રાખ. ખા-ખા કરવાથી ખાવાનું ભુખારવાપણું મટતું નથી, પણ વધે છે. એ તો ખાવાનું છોડતો આવે, તેમ તેમ ભુખારવાપણું ઓછું થતું આવે. એમ ભોગવ ભોગવ કર્યા કામવાસનાનું ભુખારવાપણું મટે નહિ. એ તો ભોગવૃત્તિ અને ભોગવટા ઓછા કરતો આવે તો જ અનું ભુખારવાપણું ઓછું થતું આવે’ આમ વિચારી સ્ત્રી વગેરે વિષયોમાં વાસનાની આગ મહેકાવવાનો મહા અનર્થ ચિંતયા કરવાનો. એથી મન વાસનાથી પાછું પે.

હવે આ જ માટે બ્રહ્મચર્ય-પાલનના કેટલાક ઉપાયોનો વિચાર કરીએ.

(૧) બ્રહ્મચર્ય પાળવા માટે પહેલા ઉપાયમાં સ્ત્રી સામે દણ્ઠ નાખવાથી બચવું જોઈએ. દણ્ઠ નાખવાનું મન થાય તો ત્યાં તરત જ આંખ મૌંચી દઈ, આ વિચારવું કે ‘જીવ ! તારે શું જોવું છે ? સામે જે દેખાશે એ તો અતિ સામાન્ય રૂપવાળી સ્ત્રી છે, પરંતુ કદ્યનાથી જોવી હોય તો મોટી



અપ્સરા કે હૃદાણી જોઈ શકે છે, પરંતુ એમાં જોવા જેવું છે જ શું ? કલ્પનાથી જોવા જેવા તો મહાવિદેહમાં સમવસરણ પર બિરાજમાન શ્રી સીમંધર ભગવાન છે, યા શ્રી સિદ્ધગિરિ પર શોભતા આદીશર ભગવાન છે, આમ ‘આમાં જોવા જેવું છે જ શું ? અનંતવાર જોયું છે’ - આ વિચાર મનની આતુરતાને શાંત કરી દે છે. પછી ખ્રી સામે દાખિ જ નહીં જાય. આ ઉપાય માત્ર ખ્રી અંગે નહિ, કિન્તુ કોઈપણ મનોહર વસ્તુ જોવાની આતુરતા શાંત કરવા માટે ઉપયોગી છે. દા.ત. આબુ યાત્રાએ ગયા, ને ત્યાં નખી તલાવ જોવા જવાનું મન થયું. તો એટલું જ વિચારીએ કે ‘આ નખી તલાવમાં શું જોવું છે ? મારે જોવું હોય તો કલ્પનાથી આના કરતાં કેઈ ગણું સુંદર નખી તળાવ જોઈ શકું છું. દા.ત. આ નખી તલાવ તો માટીની આણઘડ પાળીવાળું, ત્યારે હું કલ્પનાથી સોનાની ત્રણ સુંદર પાળીવાળું જોઈ શકું છું. વળી એ કલ્પનાના નખી તળાવમાં કેઈ પ્રકારના દેવતાઓ નૃત્ય-ગીત-આનંદ કરતા જોઈ શકું છું ઉપરાંત એમાં કેઈ પ્રકારના સારક-ચકવાક-ચકવાકી વગેરે કેઈ જાતના પંખીઓ જોઈ શકું છું... આવું બધું કેઈ સૌંદર્યવાળું તળાવ જોઈ શકું છું. પરંતુ એ બધામાં વાસ્તવિક જોવા જેવું છે જ શું ?’ એમ આંખ મૌચીને વિચારતાં અહીંના નખી તળાવને જોવાની જિજ્ઞાસા મટી જશે.

આમ જે તે જે તે વસ્તુ સામે નજર નાખવાની અને ડાફોળિયાં મારવાની કુટેવ મટાડવા તરત આંખ મૌચીને જીવને કહેવું ‘તારે આમાં શું જોવું છે ? આના કરતાં અતિ સુંદર રત્નમય દેવતાઈ વસ્તુ કલ્પનાથી જોઈ શકે છે પરંતુ એમાં તાત્ત્વિક જોવા જેવું છે જ શું ? અને જોઈને તને મળે શું ?’ એમ માનસિક વિચારણાથી બહારનું જોવાની ઈચ્છા શાંત થઈ જાય છે. તો એ રીતે ખ્રી સામે પણ દાખિ નાખવાની ઈચ્છા પણ મરી જાય. આમ વારંવાર ઈરાદાપૂર્વક ખ્રીદર્શન રોકવાથી બ્રહ્મચર્ય પાલનને બળ મળે છે.

(૨) આમ છતાં ક્યારેક ખ્રીદર્શનની વાસના જાગતી હોય, તો તરત આપણા પગના અંગુઠા સામે જોઈ ધ્યાન લગાવવાથી એ વાસના શામે છે. ત્યાં ધ્યાનમાં અરિહુંત ભગવાનની અતિ પરિચિત પ્રતિમા જોવાની - એમાંય



એ પ્રભુની શાંત મુખમુદ્રા જોવી. દા.ત. સિદ્ધગિરિદાદા યા શાંખેશર ભગવાન અથવા ગામના મંદિરના પ્રભુજી.

(૩) આમ કરી ખીદર્શન રોકવા નક્કી કર્યું, પરંતુ એ પહેલાં અચાનક આજના ઉદ્ભબ વેશવાળી કોઈક યુવાન સ્વી દેખાઈ ગઈ ને એ મનને પકડી લે અર્થાત્ મનમાં એનું જ સ્મરણ જામવા જાય એવું લાગે છે, તો ત્યાં તરત જ ચૈત્યપરિપાટી કરવા લાગવું. અર્થાત્ એક જ પરિચિત મંદિરના ભગવાન એકેક કરીને કલ્પનાથી જોવા લાગવું. અથવા જીવનમાં અનુભવેલા તીર્થોના અને છુટા જિનમંદિરને દરેકને અને એમાં રહેલ ભગવાનને કલ્પનાથી જોતા ચાલવું. બસ મન આમાં ઘાલવાથી સામેની સ્વી જોવાની આતુરતા મટી જશે.

(૪) બ્રહ્મચર્ય-પાલન માટે ખીદર્શન ટાળવા ઉપરાંત સ્વી અને વાસનાના વિચાર અટકાવવા જોઈએ. એ અટકાવવા માટે જેમ મંદિરોના ભગવાનોનું સ્મરણ ઉપયોગી છે, તેમ પૂર્વના મહાપુરુષોનાં જીવન-પરાક્રમ વિચારવા જરૂરી છે એ માટે દા.ત. ભરહેસરની સજ્જાયમાં અને બીજે આવતાં મહાપુરુષોનાં એકેક નામ લઈ એમના જીવનના પરાક્રમ વિચારી શકાય. દા.ત. ભરતેશર ચક્રવર્તી આરીસાભવનમાં પોતાનો ઠઠારેલો વેશ બરાબર છે ને, એ જોવા ગયા હતા, પરંતુ આંગળિયેથી એક વીંટી પડી જતાં એ લુંઘી દેખાયાથી બધો જ વેશ ઉતારીને પછી શરીર જોતાં વૈરાય ભાવનામાં ચડી ધ્યાનમાં આગળ વધતાં વીતરાગ સર્વજ્ઞ બની ગયા ! બાહુબલિજી યુદ્ધભૂમિ પર ભરતના અન્યાયની સામે એને મૂઢી ઉગામી મારવા દોડ્યા પણ અધવચ્ચે વૈરાય ભાવનામાં ચડી એ જ મૂઢીથી મસ્તકે પોતાના કેશનો લોચ કરી સાધુ બની ધ્યાનમાં ઊભા રહી ગયા ! આમ એકેક મહાપુરુષના આત્મ-પરાક્રમ કલ્પનાથી જાણે નજર સામે આબેહૂબ જોવામાં મનને લગાડી દેવાથી કામવાસનાના વિચાર પડી ભાંગે.

(૫) બ્રહ્મચર્ય-પાલનનો એક ઉપાય ત્યાગપૂર્વકનો તપ છે. તપ કરતા રહેવાથી સતત આહાર-સંશોના માર્યા ખા-ખા કરતાં કરતાં જે વાસના-પોષણ થયા કરે છે તેના પર તપથી કાપ પડે છે, એમાં વળી તપના ઓઠા બ્રહ્મ _____ ૯૬ _____



હેઠળ પારાણમાં રસ-પોખરણનાં પાપ થયા કરતા હોય તેના પર રસ-ત્યાગથી કાપ પડે છે. આમ ત્યાગ અને તપથી વાસના પર કાપ પડતો આવે એટલે બ્રહ્મચર્ય-પાલન સરળ બને છે. અનુભવ કરવાથી આ સમજાય એવું છે. અહીં એક ધ્યાનમાં રહે કે તપ કદાચ કોઈ મોટો ન બની શકે તો પણ ખાનપાનના ટંક ઓછા કરવા એ પણ તપ છે.

(૬) આ ત્યાગ-તપ પણ શાસ્ત્ર-સ્વાધ્યાય સાથે કરવાના કેમકે મન જો સ્વાધ્યાયમાં રોકાયું રહે, તો મનમાં બીજા ત્રીજા સંકલ્પ વિકલ્પ નહિ ચાલી શકે. નહિતર કહે છે ને કે ‘નવરું મન નખ્ખોદ વાળે’ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરતા રહેવામાં એ પણ લાભ છે કે શાસ્ત્રોમાં વાતો પણ એ મળે છે કે જેથી બ્રહ્મચર્ય પુષ્ટ થાય.

સ્વાધ્યાયની બલિહારી છે. શ્રાવકયોગ્ય પણ એટલા બધા શાસ્ત્રો છે, ઉપદેશ ગ્રંથો છે. શ્રાવકધર્મના આચાર વિચારના ગ્રંથો છે. મહાન આત્માઓના ચરિત્ર ગ્રંથો છે, તત્ત્વાર્થ મહિશાસ્ત્ર અને લોકમકાશમાં તત્ત્વનાં નિરૂપણો છે, કે આ બધાનો જો સ્વાધ્યાય સતત ચાલુ રહે, તો એથી બ્રહ્મચર્યનાં પાલનને મહાબળ મળે છે. એમ ભરપૂર ધર્મસાધનાઓ તથા દેવ-ગુરુ-સંઘની સેવા-વૈયાવરચ્ચ પણ બળ આપે છે.

બ્રહ્મચર્ય પાળવું કેમ સહેલું ?

કેટલાકો કહે છે કે ‘માણસને જેમ ખાવાની ભૂખ લાગે છે એ કુદરતી હાજત છે. એમ કામભોગની ઈચ્છા થાય છે એ પણ કુદરતી હાજત છે. પછી જેમ ભૂખ શમાવવા ખાવું પડે એમાં કાંઈ ખોટું નથી, એમ કામની ઈચ્છા શમાવવા કામ સેવવા પડે એમાં શું ખોટું ? એટલે બ્રહ્મચર્યની વાત વાહિયાત છે ખોટી ઘેલછા છે.’

આ પ્રતિપાદનની સામે પહેલો સવાલ એ છે કે કુદરતી હાજત એટલે શું ? મનની સહજ ઈચ્છાઓ ? ના, એમ જો કહો તો તો ચોરને ધૂતારાને લૂંટારાને પણ સહેજે ચોરી-ઠગાઈ-લૂંટની ઈચ્છા જાગે છે, કિન્તુ એને થોડી જ કુદરતી હાજત ગણાય ? ને એમ ગણીએ તો તો એ ગુના જ ન કહેવાય. ત્યારે કુદરતી હાજત એટલે શું ? એમ જ કહેવું પડે કે શરીરની



સહજ જરૂરિયાતોથી ઊભી થતી ઈચ્છા. એમાં ભૂખ આવે, તરસ આવે, લઘુશંકા-વડીનીતિ આવે; કિન્તુ કામભોગની ઈચ્છા નહિ.

આનું કારણ એ છે કે ભૂખ તૃપા વગેરે તો શરીર સાથે સંકળાયેલ અશાતાવેદનીય કર્મના લીધે ઊભી થાય છે. ત્યારે કામભોગની ઈચ્છા મોહનીય કર્મના ઉદ્યે જાગે છે. આમાં ભૂખની અશાતા તો બોજનથી જ શર્મે; પણ મોહનો ઉદ્ય ભોગથી જ શર્મે એવું નથી. સદ્વિવિયારથી એ શર્મે છે.

વળી માનવ શરીર લઈને બેઠા એટલે આ ભૂખ-તરસની અશાતા જાગ્યા કરવાની; ને એને અમાદિથી ન શમાવો તો શરીર કામ કરવા તૈયાર નહિ હોય. ત્યારે ભોગેચ્છામાં એવું નથી કે એને ભોગથી ન શમાવો તો શરીર અટકીને ઊભું રહે.

ગમે તેવો ભોગલુભ્ય પણ મનુષ્ય જો ક્ષયરોગનો દરદી બન્યો અને ડોક્ટર/વૈદ કહે કે ‘તમે બે વરસ બ્રહ્મચર્ય પાળો, નહિતર તમે ખત્મ થઈ જશો.’ પછી ત્યાં જીવનનો લોભી એ દરદી ભોગેચ્છાને ભોગથી શમાવવાને બદલે બ્રહ્મચર્ય પાળે છે. છતાં અનું શરીર અટકીને ઊભું નથી રહેતું, બધાં કામ બજાવે છે, ઉલ્લંઘ દરદ નરમ પડી શરીર સશક્ત બનતું આવે છે. તો પછી ભોગેચ્છા એ કુદરતી હાજત ક્યાં રહી? ખરી વાત એ છે કે એ મોહનીયના ઘરનો ચાળો હતો તે ક્ષયરોગીએ જીવન ટકાવવાની ઈચ્છાથી સમજુને દબાવ્યો.

માણસને પરસ્વીનું રૂપ જોવાની ઈચ્છા એ શું છે? એ થોડી કુદરતી હાજત છે? એ તો મોહના ઉદ્યનો નાચ છે - માણસ જો સંતના ઉપદેશથી એની પ્રત્યે પરલોકનો ભય કે ઘૃણા ઊભી કરે છે, તો સહેજે એ મોહોદ્ય શરીર જાય છે. પચી ત્યાં સંયમના અભ્યાસથી પરસ્વીરૂપ-દર્શનની ઈચ્છા જ નથી થતી.

બસ, એ જ રીતે સંતવચનથી કામભોગ પ્રત્યે ઘૃણા ઊભી કરવામાં આવે કે ભવભ્રમણ-દુર્ગતિગમનનો ભય ઊભો કરવામાં આવે તો ભોગની ઈચ્છા જ નહિ થાય; અને બ્રહ્મચર્ય સહજ ભાવે પળાશે.

વિચારવું આ જોઈએ કે ક્ષણાભર માટે ભોગના આનંદથી ભોગની ઈચ્છા



શાંત થતી લાગે, પરંતુ ભોગથી કદ્દી ભોગેચ્છા ખરેખર શાંત પડવાની નથી. અથ્રિ જો ઈન્ધાગથી શાંત થાય, કે સમુદ્ર જો નદીઓથી ધરાય, તો જીવની ભોગેચ્છા ભોગથી શામે. અનંતકાળ વહી ગયા ને અનંતી વાર ભોગ જોઈ નાખ્યા, છતાં જીવ હજુ એનો ભૂખારવો છે. એ સૂચવે છે કે ભોગથી જ એ ભોગનો ભૂખારવો રહે છે, ભોગેચ્છા જીવંત રહે છે; અને આ ખાણજ તત્ત્વની સમજ, ભવભ્રમણનો ભય, પશુકિયાની ધૃણા... વગેરેથી શમાવ્યા વિના જીવની વિટંબણા મટવાની નથી.

પરમાત્મા અને એમના કલ્યાણ ઉપદેશને ભૂલાવનાર ભોગો છે.

મહામૂલ્યવંતી પવિત્ર અને તારક યોગસાધના માટે યોગ્ય એકમાત્ર જે માનવજીવન, તેના ફૂચા કરનારી ભોગસાધના છે.

મહાસ્વતંત્ર એવા માનવને પરતંત્ર બનાવનાર ભોગની ભૂખ છે.

આ બધી દુર્દ્શાનો વિચાર કરતાં ભોગેચ્છાને દબાવી બ્રહ્મચર્ય પાળવું એ માનવ-જીવની લહૃપણ છે; અને તે કુદરતી હાજર નહિ હોવાથી દબાવી શકાય એમ છે.

બીજું, આ વિચારવાથી પણ સરળ છે કે ‘આપણો આત્મા મૂળ સ્વરૂપે નિર્વિકાર શુદ્ધ-જ્ઞાનમય છે, શૈલેશ-મેરુ જેવો નિષ્પક્ષપ છે. એમાં કામ-વિકાર વગેરેના કોઈ જ આંદોલન નથી. પરંતુ આત્માને ઘેરો ઘાલીને પહેલી મોહસેના આત્મામાં વિકારોરૂપી તોફાનો ધુસાડે છે તો મારે મારા અસલી નિર્વિકાર સ્વરૂપને જ જોયા કરી અને એનું કલ્પનાથી સંવેદન કરી પેલા વિકારોને મયક આપવાનું કામ શું છે ? મનને કહી દઉં કે ખબરદાર ! તેં આ વિકારોને અપનાવ્યા તો ? તારે મારા શુદ્ધ નિશ્ચય નિર્વિકાર સ્વરૂપને જ જોવાનું.’ આ વિચારનો વારંવાર અભ્યાસ કરવાથી બ્રહ્મચર્ય સહેલું બને છે.

એક વસ્તુ ધ્યાનમાં રહે કે જેમ આપણા હાથ-પગ, ઈંક્રિયો, કાયા અને વાણી પર આપણો અધિકાર છે, માટે જ એને ધાર્યા મુજબ હુલાવી-ચલાવી કે રોકી યા ફેરવી શકીએ છીએ, એમ આપણાં મન પર પણ આપણું વર્ચસ્વ છે, અધિકાર છે; તેથી એને ધાર્યા મુજબના વિચાર કરાવી શકીએ, રોકી શકીએ, ફેરવી શકીએ. માત્ર, આપણે એને હુકમ કરવાનો છે કે તું



આ રીતે વિચાર કર. મેલો વિચાર પહોં મૂક, મારી આ ઈચ્છા છે, ને
તારે તે બજાવવાની.’

આત્માના શુદ્ધ નિર્વિકાર સ્વરૂપનો વિચાર કરવા માટે એક સાધન એ
છે કે આપણો જે ચૈત્યવંદન સામાયિક-પ્રતિકમણ યા જાપ વગેરે કિયા કરીએ,
એમાં કાં તો પરમાત્માના ગુણગાન હોય છે, અગર એમની આગાન આપણાં
પાપનો ઈકરાર-સંતાપ હોય છે, અથવા શુદ્ધિની માગણી હોય છે. પરંતુ
એ બધુંય પરમાત્માને નજર સામે રાખીને કરવાનું. એ વખતે પરમાત્માનું
શુદ્ધ સ્ફટિક જેવું નિર્વિકાર નિશ્ચળ સ્વરૂપ નજર સામે રાખવાનું; અને સાથે
ચિંતવવાનું કે મારું ય સ્વરૂપ આવું નિર્વિકાર છે; કિંતુ મોહવિકારો મેં મફતિયા
ઘાલ્યા છે. એની સામે શુદ્ધ એવા મારે કોઈ સંબંધ નથી. તેથી નવા વિકારો
ઘાલવાનો મારે મોખ નથી.’

એક ‘નમો અરિહંતાણ’નો જાપ કરતી વખતે આ વીતરાગ અરિહંતને
નજર સામે શુદ્ધ નિર્વિકાર રૂપે ઘારવાના, અને આપણો ય એવા છીએ એમ
ધારી કામભોગ કે કોધાદિવિકારો આપણાને સ્પર્શતા નથી, કિન્તુ એ બિચારા
બહાર આંટા મારે છે; ‘હું તો અરિહંત જેવો નિર્વિકાર છું;’ - એમ જાપ
વખતે સતત ખ્યાલ રાખ્યા કરવાનો. એથી આત્મામાં એક એવો સુંદર સંસ્કાર
ઉભો થાય છે કે એ પછી કામવિકાર અને ભોગેચ્છા ઉઠવા નહિ દે.
કદાચ ઉઠશે તો સહેલાઈથી એને ફગાવી દેશે. માત્ર કામવિકાર જ નહિ,
કિન્તુ રાગ-દ્રેષ, હાસ્ય-અસ્થ્યા, ઉર્ધ્વ-ખેદ વગેરે અનેકાંને
દ્વારાવવાની તાકાત આ સ્વાત્માના શુદ્ધ નિર્વિકાર સ્વરૂપના વારંવાર કરાયેલ
હાર્દિક ચિંતનમાં છે. એનાથી ઉભા થયેલ સુંદર સંસ્કારમાં છે. બ્રહ્મચર્ય
પાલન આથી સરળ બને છે અને તે પણ માનસિક સુધી.

બાકી તો સ્થૂલભદ્ર સ્વામી, સુર્દર્શન શેઠ, જંબુકમાર, પૃથ્વીચંદ્ર વગેરેનાં
પરાક્રમનું ચિંતન-મનન પણ બ્રહ્મચર્યપાલન સહેલું બનાવે છે. એટલું ધ્યાનમાં
રહે કે શાસ્ત્ર કહે છે તેમ બ્રહ્મચર્યનાં નિર્મળ પાલન માટે શબ્દ-રૂપ-રસ-
ગંધ-સ્પર્શનાં આકર્ષણ-મૂલ્યાંકન-વિચારણાથી દૂર જ રહેવું ઘટે.



છેલ્લી વાત

આલોકની અને પરલોકની
 દુઃખોની વાગુંજારથી દુઃખી થતો જવ
 એ સર્વ દુઃખોને ઊભી પૂંધડીએ ભગાડી દેવા માટે
 જે શક્તિને ભીતરમાં ધારણ કરી શકે છે,
 એનું નામ છે બ્રહ્મ.
 પશુવૃત્તિ જેવી વાસનાને આધીન બનીને
 તન-મન-આત્માનું બળ ગુમાવીને
 સાવ જ શરમજનક કૃત્ય કરીને
 પોતાની જ ઉર્જા, સુખ, શાંતિ, સદ્ગતિ ગુમાવવી
 એના કરતાં
 એ નબળી ક્ષણોને દૃઢ સંયમથી જતીને
 નબળા નિમિત્તોને દૂરથી છોડીને
 શુભ આલંબનોને જ સતત સેવીને
 સહજ બ્રહ્મની ભૂમિકામાં જ નિવાસ કરીને
 વિશુદ્ધ બ્રહ્મચર્યના
 અપરંપાર લાભોને પ્રાપ્ત કરી
 તાત્કાલિક સુખ, આલોકનું સુખ, પરલોકનું સુખ
 અને સદ્ગતિની પરંપરા સાથે મોક્ષનું સુખ
 - આ જ મેળવી લેવું ઉચિત નથી ?

Please, Think Well.

વિચાર કરો તો જવાબ પણ સરળ છે
 અને બ્રહ્મ પણ સરળ છે
 ખરેખર,
 બ્રહ્મ is easy.



❖ બ્રહ્મચર્ય શુદ્ધિ માટે ઉપયોગી સાહિત્ય (સાનુવાદ)

- બ્રહ્મોપનિષદ્ - ૧૦ બ્રહ્મચર્ય સમાધિ
ભર્તૃહરિનિર્વેદ - વૈરાજ્યરસ-ભરપૂર નાટક
સત્ત્વોપનિષદ્ - (ફક્ત સંયમી ભગવંતો માટે)
સુખોપનિષદ્ - પરમ સુખનું રહસ્ય
પરમોપનિષદ્ - (દેવધર્મપરીક્ષા સાથે સંયुક્ત)
શમોપનિષદ્ - સોળ ભાવનાનું ઉપવન
અનુભૂતિગીતા - ભીતરી સંગીતનું સૌંદર્ય

❖ આત્મરમણાતાનું આલંબન (સંસ્કૃત ગ્રંથો)

- અવધૂતગીતા
અષ્ટાવક્રગીતા
આત્માવબોધ
સદ્બોધચન્દ્રોદય
ઈષ્ટોપદેશ
આનંદોપનિષદ્
સમાધિતંત્ર
મહુઓપનિષદ્
જ્ઞાનસાર-ઉપહાર
સમાધિસુધા
મોક્ષોપનિષદ્
વિમુક્ત્યુપનિષદ્

